

શ્રી યજોવિજય

જૈન ગુણમાળા

દાદાગઢે, લાઘબંદા

ફોન : ૦૨૭૮-૨૪૩૫૩૨૮

૩૦૦૮૮૫૬

શ્રી

મહાવીર પરમાત્માનું

સંક્ષિપ્ત

જૈવનબરિત્રિ

ચાર મોદા સ્તવનો સાથે



પ્રસિદ્ધકર્તા—

શ્રી જૈવનબર્મ પ્રસારક સલા

લાવનગર.

શ્રી મહાવીર પરમાત્માનું સંક્ષિપ્ત

જીવનચરિત્ર

(૪૨ ચોમાસાના ક્રમસર સ્થળ તથા
વિહારવર્ણન યુક્ત)



શ્રીવીરપ્રભુના ચાર મોટા સ્તવનો સાથે



ચોગ્ય સંકલના સાથે તૈયાર કરનાર
કુંવરજી આણુંદજી



છપાવી પ્રગટ કરનાર
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા

ભાવનગર

વિર સં. ૨૪૬૮]

::

[વિકિમ સં. ૧૯૬૮

કિંમત ચાર રૂપાના.

મુદ્રક : - શાહ ગુલાખયંદ લદ્દુભાઈ, શ્રી મહોદ્ય પ્રેસ - ભાવનગર.

श्री महावीरजिनस्तुति



कनकसमशरीरं, प्राप्ससंसारतीरं,
कुमतघनसमीरं, क्रोधदावाज्ञिनीरं ।
जलधिजलगभीरं, दंभभूसारसीरं,
सुरगिरिसमधीरं, स्तौषि भक्त्या च वीरं ॥ १ ॥

नमदखिलसुरेंद्राः, पापपंके दिनेंद्राः,
कुमतमृगमृगेंद्राः, कर्मवृक्षे गजेंद्राः ।
सुगुणमणिसमुद्राः, साधुचकोरचंद्राः,
गतघनतरतंद्राः, पांतु वः श्रीजिनेंद्राः ॥ २ ॥

जिनवदनहृदंतात्, निर्गता वार्द्धिकांता,
सुपदसलिलपूता, पापपंकौघहर्ता ।
जननमरणभेत्ता, द्वादशांगी विचित्रा,
मुनिजनहितकर्ता, मोक्षसौख्यप्रदाता ॥ ३ ॥

जिननयनकुरंगी, इयमवेणीभुजंगी,
जिनमुखकजभृंगी, श्वेतवस्त्रैर्वृतांगी ।
निविडजडिमरोग-धंसने मातुलिंगी,
श्रुतनिचयवरांगी, देहि मे देवि! सदूगीः ॥ ४ ॥*



* त्रीने ने चोथे ३६०५ लाखाहोपवालो ७४४.४ छे.

પ્રસ્તાવના

આ નાની સરખી ખુક્ટે પ્રસ્તાવનાની જરૂર ન હોય, પરંતુ આ ખુક્ટે લખવાનો હેતુ અને તેની પશ્ચાતુપૂર્વીએ કરેલી ધરના સંબંધી કંઈક જણાવવા માટે લખી છે.

શ્રી વીરપ્રભુનું ડેવળાયવસ્થાના ૩૦ વર્ષના વિહારનું વર્ષાન અને તેમણે કમસર કરેલા ચોમાસાના સ્થળ વિગેરે સુખોધિકા તથા શ્રી ન્ર. શ. પુ. ચરિત્ર વિગેરેમાં લક્ષ્ય ન થવાથી બનતો પ્રયાસ કરીને આ ખુક્ટા પ્રારંભમાં તે જણાવવામાં આવ્યા છે. ત્યારપછી છદ્રસ્થાવસ્થાનાં ૧૨॥ વર્ષની ચોમાસા તથા ઉપસગેં વિગેરેની કમસર હકીકિત લખવાનો વિચાર થતાં તે પણ લખીને દાખલ કરેલ છે. બાદ ગૃહસ્થપણાના ૩૦ વર્ષની પણ કંઈક ટૂંકી હકીકિત લખી હોય તો શ્રી વીરપ્રભુનું એંતરે વર્ષનું સંક્ષિપ્ત ચરિત્ર ગુંથાધ જય એમ ધારી તે પણ લખ્યું છે. આમ વિચારનો કમ પાછળપાછળનો થયેલ હોવાથી એ પ્રમાણે આ ખુક્ટમાં સમાવેશ કરવામાં આવેલ છે.

આ પ્રમાણે સંક્ષિપ્ત ચરિત્ર લખ્યા પછી ટેક્ટ બહુ નાની લાગવાથી શ્રી મહાવીર પરમાત્માના એ સત્તાવીશ ભવના ને એ પંચકલ્યાણુકના એમ કુલ ચાર મોટા સ્તવનો દાખલ કર્યાં છે.

એમાં પ્રથમ સ્તવનની પ્રાંતે પૃષ્ઠ ૫૭, ૫૮ ઉપર શ્રી વીરપ્રભુના ૨૭ ભવનું ટૂંક વર્ષાન કમસર બતાવવા માટે લખેલ છે. તેમાં ૧૫ માત્રા ૧૬ મા તેમજ ૨૧ મા અને ૨૨ મા ભવની વર્ચ્યે વીરપ્રભુએ અસંખ્યાતા ભવો કર્યાનું લખ્યું છે, પરંતુ પાંચમા ને છઠ્ઠા ભવ વર્ચ્યે અસંખ્યાતા ભવો કર્યાં છે તે લખવાનું રહી ગયું છે. પ્રથમ આપેલા ૨૭ ભવના સ્તવનમાં પણ તે હકીકિત લાવેલ નથી.

પૃષ્ઠ ૪૪ ઉપર વીરપ્રભુએ છદ્રસ્થાવસ્થામાં કરેલા તપતું વર્ષાન આપી એકંદર ૧૨॥ વર્ષનો મેળ મેળવ્યો છે.

પૃષ્ઠ ૪૫ ઉપર પ્રભુને થયેલા ઉપસર્ગોનું ટૂંક વર્ણન તેનો કમ અતાવવા લખેલ છે.

ઉપર પ્રમાણેની હકીકતથી આ બુક પૃષ્ઠ ૮૦ માં પૂર્ણ કરવામાં આવી છે. સ્તવનોમાં કઠળું શબ્દના અર્થે પણ આપ્યા છે. આ બુકમાં થયેલી સ્બલના માટે મિચાહુકુડ આપવામાં આવે છે.

અશાડ શુદ્ધ ૧
સ. ૧૬૮

કુંવરજી આણંદળ
લાલનગર

અનુક્રમણિકા

૧	શ્રી મહાવીર પરમાત્માના ડેવળજ્ઞાન પાદ્યા પદ્ધીના	૩૦
	વર્ષનું વિહારવર્ણન.	૧-૨૫
૨	શ્રી વીરપ્રભુના છદ્રસ્થપણાના ૧૨ા વર્ષના વિહારમાં થયેલા ઉપસર્ગોનિકનું સંક્ષિપ્ત વર્ણન.	૨૬-૪૩
૩	શ્રી વીરપ્રભુએ ૧૨ા વર્ષમાં કરેલ તપતું લીસ્ટ. ...	૪૪
૪	શ્રી વીરપ્રભુને થયેલા ઉપસર્ગોનો કમ.	૪૫
૫	શ્રી મહાવીર પરમાત્માના ગુહસ્થપણાના ૩૦ વર્ષનું ... સંક્ષિપ્ત ચરિત્ર....	૪૬-૪૮
૬	પં. શુલવિજ્યજ્ઞકૃત શ્રી વીરપ્રભુનું સત્તાવીશ અવનું સ્તવન. (છ ઢાળ)	૪૯
૭	શ્રી વીરપ્રભુના ૨૭ અવની ટૂંક હકીકત.	૫૭
૮	શાવક હંસરાજ્યકૃત શ્રી વીરપ્રભુનું પંચ કલ્યાણકનું સ્તવન. (દશ ઢાળ)	૫૮
૯	શ્રી રામવિજ્યજ્ઞકૃત શ્રી વીરપ્રભુનું પંચ કલ્યાણકનું સ્તવન. (ત્રણ ઢાળ)	૬૬
૧૦	પં. વીરવિજ્યજ્ઞકૃત શ્રી વીરપ્રભુનું સત્તાવીશ અવનું સ્તવન. (પાંચ ઢાળ)	૭૫

—॥૪૦૪॥—

શ્રી મહાવીર પરમાત્માના કેવળજ્ઞાન પાદ્યા પઢીના ત૦ વર્ષનું વિહારવર્ષન.

—॥૫॥—

[૧૩ માથી ૪૨ મા સુધીના ત૦ ચોમાસાના સ્થળ સાથે]

શ્રી મહાવીર પરમાત્માના ૪૨ વર્ષના ચારિત્રયર્થમાં પ્રથમના ૧૨ા વર્ષ તે છબ્બસ્થપણે વિચર્યા. અનેક ઉપસર્ગો ને પરિસરે સદ્ગા. અત્યંત તીવ્ર તપ કરીને ૧૨ા વર્ષના પ્રાંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ છબ્બસ્થપણાના ૧૨ા વર્ષનું વર્ષન તો સુષોધિકા ટીકા વિગેરેમાં વિસ્તારથી આવે છે. કેવળજ્ઞાન પાદ્યા ને પાવાપુરી પધારી દેશના આપી, અનેક મનુષ્યોને દીક્ષા આપી, તેમાંથી ગણુધરપદચોણ્ય ૧૧ સુનિએને ગણુધરપદવી આપી, અતુર્વિધ સંઘની સ્થાપના કરી. આટલા વર્ષનું પઢી ત્રીશ વર્ષ સુધી કરેલા વિહારનું વર્ષનું સુષોધિકા ટીકા વિગેરેમાં આવતું નથી. માત્ર પ્રાંતભાગે પરિવારનું વર્ષનું અને નિર્વાણુ-ગમનની હકીકત આવે છે. આ ત્રીશ વર્ષનું વર્ષનું કુમસર એકત્ર કરી અત્ર સંશોધથી આપ્યું છે. ત્રીશો ચોમાસા કયા કયા સ્થળે કર્યાં તે પણ કુમસર ખતાંયું છે. પ્રલુના સમાગમમાં આવેલા કેટલાક શ્રાવકો ને સુનિએા વિગેરેનું વર્ષનું તેમની પ્રાંતા-વસ્થા સુધીનું આપેલું છે તે ત્યાં પ્રસંગોપાત જ લખેલું સમજવું,

તે વર્ષમાં બનેલું સમજવું નહીં. જે જે વર્ષમાં જેમના નામો લખ્યા છે તેમનો પ્રભુ સાથે પ્રથમ સમાગમ તે વર્ષમાં થયેલ સમજવો. અજાત હકીકત કુમસર જાણી શકાય તેટલા માટે જ આ પ્રયાસ કરેલ છે. તેમાં થયેલ સ્ખલના માટે પ્રારંભમાં જ મિચ્છા ફુઝડં દેવામાં આવે છે.

x

x

x

દીક્ષા લીધા બાદ ૧૨ા વર્ષો પ્રભુ કેવળજ્ઞાન પાણ્યા, પછી પાવાપુરી પધાર્યા અને દેશના આપી. ૧૧ ગણુધરની સ્થાપના કરી. ત્યાંથી રાજગૃહી તરફ પધાર્યા. ત્યાં શ્રેણિક રાજ, અલય-કુમાર, અન્જલિશન્ત્રુ (કેણિક), મેધકુમાર, નંદિષ્ણકુમાર (દશાદશના પ્રતિષેધક)નો અનુકૂળે સમાગમ થયો. મહાવીર પરમાત્માએ શ્રાવક ધર્મ કહ્યો. પ્રભુએ રાજગૃહીમાં જ તેરમું ચોમાસું કર્યું.

ચોમાસાખાદ વિદેહ તરફ ગમન. માહણુંકુંડ થામે પધારવું. ત્યાં દેવાનંદા ને ન્રાષ્ટ્રલદ્ધતા (પ્રભુના મૂળ માતાપિતા) નું પ્રભુ પાસે આગમન. પ્રભુના ઉપદેશથી તેમણે પ્રભુ પાસે લીધેલી દીક્ષા. (પ્રાંતે મોક્ષગમન.)

જમાલિ ને પ્રિયદર્શિના (પ્રભુના જમાઈ ને પુત્રી) એ પ્રભુ પાસે લીધેલી દીક્ષા. પ્રભુએ વિશાળા તરફ જઈને ચૌદમું ચોમાસું વિશાળામાં કર્યું.

ચોમાસાખાદ વત્સદેશ તરફ ગમન. ત્યાંથી કૌશાંખી પધારવું. જ્યાંતી શ્રાવિકાનું મિલન. તેના પ્રશ્નો ને પ્રભુના ઉત્તરો. જ્યાંલીની દીક્ષા. (તેનું મોક્ષગમન.) ત્યાંથી પ્રભુનું શ્રાવસ્તીનમરીએ ગમન. ત્યાં સુમનોલદ્ર ને સુપ્રતિષ્ઠ નામે એ શ્રાવકે પ્રભુના

ઉપદેશથી લીધેલી દીક્ષા. (તેમણે કરેલ મહાન् તપ. પ્રાંતે અનશન કરીને વિજ્ય વિમાનમાં ઉપજવું.) પ્રલુનું વાણિજ્યથામે ગમન. આનંદ શ્રાવકનું પ્રલુ પાસે જવું. પ્રલુનો ઉપદેશ સાંલળી તેમણે થહણુ કરેલા શ્રાવકના વ્રત. તેમાં પરિથિહનું તેમજ લોગો-પલોગનું કરેલું વિસ્તારથી પરિમાણુ. પ્રલુએ વાણિજ્યથામે જ પંદરમું ચોમાસું કર્યું.

ચોમાસાખાદ મગધ તરફ ગમન. રાજગૃહી નગરીમાં ધન્ય ને શાલિકદ્ર. બંનેની ઝડ્ધિનું વર્ષાન. પ્રલુનો ઉપદેશ સાંલળી બંનેએ લીધેલી દીક્ષા. (પ્રાંતે તેમનું અનશન વિગેરે.) પ્રલુએ રાજગૃહીમાં જ સોણમું ચોમાસું કર્યું.

ચોમાસાખાદ ચંપાનગરી તરફ ગમન. દત્તરાજુ ને રક્તાવતીનો પુત્ર મહાચ્ચયંદ્રકુમાર. પ્રલુએ કહેલો તેનો પૂર્વલવ. તેણે પ્રલુ પાસે લીધેલી દીક્ષા. કામદેવ શ્રાવકે પ્રલુ પાસે લીધેલા શ્રાવકના વ્રત. (ચૈદ વર્ષ પછી તેણે શરૂ કરેલું શ્રાવકની પડિમાનું વહન. મિથ્યાત્વી દેવે કરેલો પ્રાણુંત ઉપસર્ગ. કામદેવનું સહનરીતયણું. પ્રલુએ કરેલી તેનો પ્રશંસા.) ‘ઉદ્યન છેલ્લા રાજર્ષિ’નું વર્ષાન. તેમણે લીધેલી પ્રલુ પાસે દીક્ષા. સત્તરમું ચોમાસું પ્રલુએ વાણિજ્યથામે કર્યું.

ચોમાસાખાદ બનારસ તરફ ગમન. ત્યાં ચૂલણીપિતા શ્રાવકે સ્વીકારેલ ગૃહસ્થ ધર્મ. ત્યાં જ સૂરાદેવ શ્રાવકે પણ પ્રલુનો દેશના સાંલળીને સ્વીકારેલ શ્રાવક ધર્મ. પ્રલુ ત્યાંથી આલંબિકા પધાર્યા. ત્યાં ચૂલ્લિશાતક શ્રાવકે સ્વીકારેલ શ્રાવક ધર્મ. (આ ત્રણે શ્રાવકોને દેવોએ કરેલા ઉપસર્ગ, તેમનું ચલિત થવું. પ્રલુએ સ્થિર કરવા. તેમણે આરાધેલ શ્રાવકની ૧૧

પડિમાયો. પ્રાંતે અનશન કરી પ્રથમ દેવલોકે ઉપજવું.) પુદ્ગલ
પરિત્રાજકની હકીકત. તેણે પ્રલુને ઉપહેશ સાંલળી પ્રલુ પાસે
લીધેલી દીક્ષા. આલાંલિકાથી નીકળી પ્રલુ રાજગૃહી પધાર્યા.
ત્યાં મકાંતી વિગેરે અનેક ગૃહસ્થોએ લીધેલી દીક્ષા. તેઓનું
પ્રાંતે મોક્ષગમન. અદારસું ચોમાસું પ્રલુએ રાજગૃહીમાં કર્યું.

ચોમાસા બાદ પ્રલુ ભગધહેશમાં જ વિચયર્યા. તે જ વર્ષમાં
રાજગૃહીમાં શ્રેણિકરાણને પ્રલુ મહાવીર સાથે થયેલ વિશેષ
પરિચય. એક હિવસ સમવસરણુમાં એક દેવનું આવવું
ને પોતાના શરીર ઉપરથી પ્રલુને પગે કુષ્ટની રસીનું ચોપડવું.
તે જોઇ શ્રેણિકરાણને થયેલ કોધ. તેવામાં પ્રલુને, અલયકુમારને,
શ્રેણિકરાણને અને કાલ સૌકર્યિકને આવેલી છીંક. દેવે અનુકૂમે ‘મરો,
મરો યા જીવો, જીવો, મ મરો અને મ જીવો’ એમ કહેવું. દેવનું
અદશ્ય થવું. પ્રલુને પૂછતાં તે દેવદર્શિરાંક નામે હતો. ને તે બાવના
ચંદનનું વિલેપન કરતો હતો એમ કહ્યું. તેમજ ચારેની છીંક
બાખતમાં ખુલાસો કર્યો. તેમાં શ્રેણિકરાણને જીવો કહેવાનું
કારણું મરણ પામીને તેમને પ્રથમ નરકમાં જવાનું છે તે સાંલળી
શ્રેણિકરાણને થયેલ પારાવાર ઐદ. પ્રલુએ તેના આથહુથી
બતાવેલા તેના નિવારણુના ઉપાય. તેમાં નિરાશ થતાં ભાવી કાળે
પ્રથમ તીર્થંકર થવાનું કહીને પ્રલુએ આપેલો હિલાસો.
શ્રેણિકરાણએ કોઈપણ દીક્ષા લેવા ઈચ્છનારને તમામ પ્રકારની
સહાય આપવાની કરેલી પ્રતિશા અને તેવી જહેરાત.

આર્દ્રકુમાર-તેનું સવિસ્તર વૃત્તાંત. હસ્તિતાપસોને પ્રતિ-
બાધી તેની સાથે આર્દ્રકુમારનું પ્રલુ પાસે આવવું. અલય-
કુમારનો પ્રતિમા મોકલ્યા સંબંધી આલાર માનવો. આ

વર्षमां ધણુ મનુજ્યોએ પ્રભુ પાસે લીધેલી દીક્ષા. અણુધારી તક મળી જતાં અભયકુમારે પણ લીધેલી દીક્ષા. શ્રેણિક રાજના ધીજ ૨૧ પુત્રો અને ૧૩ રાણીઓએ લીધેલી દીક્ષા. તેમનું સ્વર્ગ અથવા મોક્ષગમન. આ વર્ષમાં રાજગૃહીમાં રહેવાથી થયેલો ધણુ ઉપકાર. પ્રભુએ રાજગૃહીમાં જ જીદું ચોમાસું કર્યું.

ચોમાસા ખાદ વત્સ દેશ તરફ ગમન. ત્યાંના ઉદાયન રાજની વિધવા રાણી મૃગાવતીએ ચંડપ્રદોતનને આશા આપીને પાછો વાળ્યો. તેનું ફરીને કૌશાંખી ઉપર ચડી આવવું. તેવામાં પ્રભુનું ત્યાં સમવસરવું. ચંડપ્રદોતન ને મૃગાવતી વિગેરેનું પ્રભુ પાસે આગમન. તે પ્રસંગે પ્રભુએ આપેલ ઉપહેશ. તેમાં સ્વીલ્પટ સોનીનું આપેલું દણાંત. તેને ૫૦૦ સ્વીઓ હતી, તેમાંથી એકને મારી નાખતાં ૪૬૬ સ્વીઓના આરીસા પડવાથી થયેલું તેનું મરણ. તેનું ને પહેલી મરણ પામેલી સ્વીનું એક તિર્યંચનો લવ કરીને પ્રાણાણુકુળમાં ભાઈ ખેણ તરીકે જન્મવું. સોનીની ૪૬૬ સ્વીઓનું અગિનપ્રવેશ કરી બળી મરવું ને એક અટવીમાં મનુષ્ય થઇને ચોર થવું. પેલા પ્રાણાણુપુત્રનું ચોર થતાં તે ૪૬૬ના સ્વામી થવું. પ્રાણાણુપુત્રીનું ૫૦૦ ચોરની સ્વી થવું. ચોરાએ લાવેલી ધીજ સ્વીને તેણીએ મારી નાખવાથી શાંકા પડતાં સુખ્ય ચોરે પ્રભુ પાસે આવી સંશોપમાં યાસા ? એમ પૂછવું. પ્રભુએ સા સા એમ કહેવું. સલાએ પૂછતાં તેનું વૃત્તાંત સંભળાવી પ્રભુએ આપેલો ઉપહેશ. મૃગાવતીએ અવસર પામી પોતાના પુત્રને ચંડપ્રદોતનના ઘોળામાં એસાડી દીક્ષા બૈવા માટે માગેલી આજા. પ્રભુની શરમે તેણું આપેલી આજા. પ્રભુએ આપેલી દીક્ષા. ચંદના-આર્યાને સુપ્રત. ત્યાંથી વૈશાળીમાં આવીને પ્રભુએ વીશમું ચોમાસું ત્યાં જ કર્યું.

(અહીં અભયકુમારની ખુદ્ધિના એ ગ્રાણુ પ્રસંગોનું વર્ણન
મહાવીર ચરિત્રમાં કરેલ છે તે વાંચવા ચોંચ્ય છે.)

ચોમાસા બાદ પ્રલુચે આ વર્ષમાં અનેક સ્થળે વિહાર કર્યો. પ્રથમ કાકંદીપુરીમાં આવ્યા. ત્યાં લદ્રાશોઠાણીના પુત્ર ધન્યને પ્રલુનો ઉપદેશ લાગ્યો. તેણે માતા પાસે આવી દીક્ષા લેવાની આજા માગી. માતાએ બધુ સમજાયા છતાં ન સમજવાથી લદ્રા ત્યાંના રાજ પાસે ગઈ. તેણે પણ તેને ઘેર આવીને ધન્યને સમજાયો. ધન્યકુમારે કહ્યું કે ‘જે તમે જરા તથા મરણને રોકી શકતા હો તો હું સંસારમાં રહું.’ રાજએ તેની અશક્યતા બતાવી અને ચોતે જ ખીજ અનેક શ્રેષ્ઠ-પુત્રો સાથે તેનો દીક્ષામહેસાવ કર્યો. પ્રલુચે સર્વને દીક્ષા આપી. ધન્યકુમારે થોડા વખતમાં જ્ઞાનાલ્યાસ સાથે એવી તપસ્યા કરી કે તેના દેહમાં હાડ માત્ર રહ્યા. પ્રલુનું રાજગૃહી પધારવું. શ્રેણ્યિક રાજએ ‘સર્વ મુનિમાં શ્રેષ્ઠ કોણુ છે?’ એમ પ્રલુને પૂછતાં પ્રલુચે ધનાકાકંદીને બતાવ્યા. તેઓ એક માસતું અનશન કરી સહૃગતિએ ગયા. તેના ભાઈ સુનક્ષત્રે પણ પ્રલુ પાસે દીક્ષા લીધી.

ત્યાંથી પ્રલુ કંપિલ્યપુર પધાર્યો. ત્યાં કુડકૌલિક નામના ગૃહસ્થે પ્રલુનો ઉપદેશ સાંલળી શ્રાવકના વ્રત અહણુ કર્યો. તે પ્રલુના મુખ્ય દશ શ્રાવકોમાં છુટ્ટા હતા. તેને ગોશાળકમતિ એક દ્વેવ સાથે પ્રશ્નોત્તર થયા. તેણે દ્વેવને નિરૂત્તર કર્યો અને તે દ્વેવ પ્રલુના માર્ગમાં દર થયો.

પ્રલુ ત્યાંથી ચોલાસપુર પધાર્યો. ત્યાં સદાલપુત્ર નામે કુંલાર આળવિકમતિ હતો. તેને પ્રલુચે અનેક પ્રકારે સમ-

જાવ્યો, તેથી તેણે શ્રાવકના વ્રત પ્રબુ પાસે લીધા. તે સાતમો શ્રાવક થયો. (તેના પ્રશ્નોત્તર ખાસ વાંચવા જેવા છે.)

એ એકવીશમું ચોમાસું પ્રબુએ વાણિજ્યથામે કર્યું.

ચોમાસા બાદ પ્રબુ મગધદેશમાં આવ્યા. રાજગૃહીએ પધાર્યા. તે વખતે ત્યાં મહાશતક નામે ગૃહસ્થ રહેતો હતો. તે મેટો ધનાદ્ય હતો. તેને ૧૩ સ્ત્રીઓ હતી. પ્રબુનો ઉપદેશ સાંલળી તેણે શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. તે આઠમો શ્રાવક થયો. (તેની ૧૩ સ્ત્રીઓમાં રેવતી નામે સ્ત્રી અતિ વિષયી હતી. તેણે પોતાના વિષયવિલાસમાં લાગ પાડનારી ૧૨ શોકયોને શક્ત-પ્રયોગ તેમ જ વિષપ્રયોગથી મારી નાંખી. તે માંસાહારી હતી. મહિરા પીતી હતી. એકદા રાજ શ્રેણિકે અમરપડહ વગડાવતાં બીજે સ્થળોથી માંસ ન મળવાને લીધે તેણે પોતાના ગોકુળમાંથી રેઝ એ વાછડાએને મારીને તેનું માંસ ખાવાનું શરૂ રાખ્યું.) (મહાશતક શ્રાવકે તો વ્રત લીધા પછી ૧૪ વર્ષ થતાં ૧૫ મા વર્ષના મધ્યમાં શ્રાવકની ૧૧ પડિમા વહેવાની શરૂઆત કરી. તે પ્રસંગમાં પણ રેવતી દાર્દ પી, ઉનમત્ત બની તેની પાસે પૌષ્ઠ્રશાળામાં આવી ઉપદ્રવ કરવા લાગી. ત્યારપછી મહાશતકને તો શુલ દ્યાનના યોગથી આનંદ શ્રાવકની જેમ અવધિજ્ઞાન ઉત્પત્ત થયું. કુરીને રેવતી ઉપસર્ગ કરવા આવી ત્યારે તેણે કોધ્ય-વેશમાં કદ્દું કે-‘ રે હુએ ! અહીંથી તું ચાલી જી, તું તારા પાપકર્મથી મરણું પામીને નરકે જઈશ.’ તે ત્યાંથી ચાલી ગઈ. પછી વીર પરમાત્મા ત્યાં પધારતાં તેમણે ગૌતમસ્વામીને મહાશતક શ્રાવક પાસે મોકલીને કહેવરાંયું કે-‘ પડિમાધારી શ્રાવકે કોઈને કાંઈપણ કઠિન વચ્ચે કહેવું ન કરે. તમે

દેવતીને કઠળું વચન કહ્યું તેનું પ્રાયશ્ક્રિત કરો. ' મહાશતકે પ્રલુના કહેવા પ્રમાણે પ્રાયશ્ક્રિત કર્યું. પછી અનશન કરી મૃત્યુ પામી પ્રથમ દેવલોકે ગયા.) યાવીશાસું ચોમાસું પ્રલુએ રાજગૃહીમાં કર્યું.

ચોમાસા દરમ્યાન પાર્શ્વનાથના સંતાનીઓ અનેક મુનિઓનો પ્રલુ સાથે સંચોગ થયો. તેમની સાથે પ્રશ્નોત્તર થતાં તેમને પ્રલુના સર્વજ્ઞપણુંની ખાત્રી થઈ એટલે તેમણે વીરપ્રલુનું શાસન સ્વીકાર્યું.

ચોમાસાબાદ પ્રલુ ત્યાંથી વિહાર કરી પક્ષિમહિશા તરફ જતાં કૃતંગલા નગરીએ પધાર્યા. ત્યાં અનેક શ્રાવક શ્રાવિકાઓ પ્રલુને વંદન કરવા આવ્યા. તે સાથે સ્કંદક નામે પરિ-પ્રાજક પણ આવ્યો. તે પરિપ્રાજકને પ્રથમ પિંગળ નામના એક નિર્દ્ધારણ મુનિ સાથે ધર્મ સંબંધી વાદવિવાદ થયો હતો. તેથી તેના મનમાં પોતાના ભત વિષે શાંકા ઉત્પજ્ઞ થઈ હતી. તેવામાં પ્રલુ ત્યાં પધાર્યા. સ્કંદક તેના શાસ્ત્રોમાં બહુ પ્રવીણુ અને ધૂરંધર હતો. તે પ્રલુ પાસે જવા ચાલ્યો. પ્રલુએ તેની સામે ગૌતમસ્વામીને મોકલી તેના હૃદયના લાવ કર્યા. પ્રલુ પાસે આવી પ્રશ્નોત્તર થતાં તેને પ્રલુનું સર્વજ્ઞપણું સમજાણ્યું. પ્રલુએ બીજી ધણી વાતો તેને સમજાવી, પ્રાંતે તેણે પ્રલુ પાસે ચારિત્ર અંગી-કાર કર્યું. (સ્થવિરો પાસે રહી અભ્યાસ કર્યો. પછી પ્રલુ પાસે મુનિની ધાર પડિમા વહેવાની આજા માગી. [અહીં તે બાર પડિમાનું સ્વરૂપ વિસ્તારથી બતાઓયું છે.] પ્રલુની આજા મળતાં સ્કંદમુનિએ યથાર્થપણે તે પ્રતિમાનું આરાધન કર્યું. તેના આરાધનમાં બહુ તીવ્ર તપ કરવાનો હોય છે, તે પ્રમાણે તપ કરવાથી તેમજ લારપછી શુષ્ણુરતનસંવત્તસર તપ કર્યો

તેથી પરિણામે તેમનું શરીર બહુ ક્ષીણુ થઈ જતાં પ્રલુની આજા માગી તેમણે અનશન કર્યું. તે પ્રસંગે સારી રીતે સંવેખના કરી અને શુલધ્યાને મરણુ પામી સ્વર્ગે ગયા.)

લગ્નાંતે ત્યાંથી શ્રાવસ્તી તરફ વિહાર કર્યો. શ્રાવસ્તીમાં નાદિનીપિતા અને સાલિહીપિતા નામે એ ગૃહસંશો રહેતા હતા. તે પ્રલુને સમવસર્યા જાણી તેમની પાસે આવ્યા. ધર્મો-પદેશ સાંલાજ્યો. શ્રાવકના ત્રતો અહણુ કર્યા. (પ્રાંતે શ્રાવકની ૧૧ પડિમા વહન કરી, કુલ ૨૦ વર્ષ ગૃહસ્થધર્મ પાળી તે બંને શ્રાવક-દ્વારા ને ૧૦મા પ્રાંતે અનશન કરી પ્રથમ સ્વર્ગે દેવ થયા.)

ત્રૈવીશમું ચોમાસુ પ્રલુએ વાણિજ્યામે કર્યું.

ચોમાસા બાદ પ્રલુ પ્રાણણુકુંડ ચામે પધાર્યા. ત્યાં જમાલિ-સુનિએ આવી એકલા વિચરવાની આજા માગી. પ્રલુ મૈન રહ્યા એટલે તેને આજા માની જમાલિએ એકલવિહારીપણું સ્વીકાર્યું.

પ્રલુ ત્યાંથી વત્સદેશ તરફ વિહાર કરતાં કૌશાંધીએ પધાર્યા. ત્યાં દિવસને પાછલે પહોરે સૂર્ય તથા ચંદ્ર મૂળ વિમાને પ્રલુને વંદન કરવા આવ્યા. સૂર્યસ્ત સમય જાણુ ચંદ્રના સાધ્વી ઉપાશ્રે ગયા પણ મૃગાવતી સાધ્વી પ્રકાશ જોઈને એસી રહ્યા. પહોર રાત્રિ જતાં સૂર્ય ચંદ્ર પાછા ગયા એટલે અંધકાર થતાં મૃગાવતી ઉપાશ્રે આવ્યા. ચંદ્રના સાધ્વીએ આટલી રાત્રિ સુધી બહાર રહેવા બાણત ઠપકો આપ્યો. પછી તે તો નિદ્રા-વશ થયા, પરંતુ અપરાધ ખમાવતાં ખમાવતાં મૃગાવતી સાધ્વીને કેવળજ્ઞાન થયું. તેવા વખતમાં એક સર્વને ચંદ્રના સાધ્વીના હાથ પાસે થઈને જતો જોઈ મૃગાવતીએ તેમનો હાથ જાચો કર્યો એટલે તેમણે જાગી જઈને કારણુ પૂછતાં સર્વનુ કારણુ કહ્યું. ‘આવી

અંધારી રાત્રે સર્પને કેમ હીડો ?' તે બાખત પૂછતાં કેવળજ્ઞાન પાખ્યાતું જણું ચંદના સાધ્વી તેમને ખમાવવા લાગ્યા. શુભ ધ્યાનવડે તેમને પણ કેવળજ્ઞાન થયું.

ત્યાંથી પ્રલુચે મગધહેશમાં વિહાર કર્યો, રાજગૃહી પદ્ધાર્યી. ત્યાં શ્રી પાર્શ્વનાથના સંતાનિયા મુનિ સાથે આવકોને થચેલી ચર્ચાં સાંલળી ગૈતમસ્વામીએ પ્રલુને પૂછ્યું કે 'તે મુનિઓએ ઉત્તર આપ્યા એ ખરાખર છે ?' પ્રલુચે કહ્યું કે 'ખરાખર છે.'

આ અરસામાં અલયકુમાર વિગેરે મુનિઓએ અનશન કર્યું એટલે પ્રલુચે તે ર૪ મું ચોમાસું રાજગૃહીમાં જ કર્યું.

ત્યારપણીની હુકીકત જાણવા માટે આપણે રાજગૃહીમાં થચેલી રાજ્યકાંતિ વિગેરેની બીજા જાણવી પડશે. શ્રેણિકરાજ રાજ્ય ઉપર ૫૧-૫૨ વર્ષ રહેવાથી તેનો પુત્ર કેાણ્ણિક મૂંઝાયો. તેણે બીજા ભાઈઓને પક્ષમાં લઈને શ્રેણિક રાજને કેદખાનામાં નાખ્યા અને પોતે રાજ થયો. શ્રેણિકની કેદખાનામાં તેણે ઘણું કદર્થના કરી, તેની પાસે આવવાની પણ અધાને મનાઈ હતી. તેનો વિચાર ભૂખ્યાતરસ્યા શ્રેણિકરાજને મારી નાખવાનો હતો, પરંતુ માત્ર ચેલણુને તેની પાસે જવાની છૂટ હતી. તે મસ્તકના વાળ મહિરાવડે પૂળ પલાળી, અંદર અડફનો લાડવો સંતાડી શ્રેણિક રાજ પાસે જતી અને કેશ નીચેાવી મહિરાપાન કરાવતી ને લાડવો ખવરાવતી તેથી તે બચ્યા હતા.

કેાણ્ણિક ગર્ભમાં આવ્યો ત્યારે જ ચેલણુને શ્રેણિકરાજના હુદ્ધયતું માંસ ખાવાની છચ્છા થઈ હતી. અલયકુમારે યુક્તિથી પૂર્ણ કરી હતી, પરંતુ ચેલણુએ જન્મતાં જ તે પુત્રને ઉકરડે નાખી

દીધો હતો. શ્રેણિકરાજ તે વાત જાણુતાં તેને લઈ આંયા હતા. પરંતુ ચેલણું તેની ઉપર દિલ ન હોવાથી તે તેને માટે બીજ પુત્રો કરતાં ખાનપાનમાં સંકોચ કરતી હતી. કોણિક આ બધું શ્રેણિક કરાવે છે એમ માનતો હતો. એક વાર કોણિક તેના પુત્રને ખોળામાં લઈને જમવા એડો હતો, તે વખતે ખાળક લાણું મુતરો, કોણિકે તેને અટકાયો નહીં અને લોજનનો થાડો ભાગ ફૂર કરી બીજું ખાદ ગયો. તે વખતે તેની સામે એડેલી ચેલણું આંખમાં આંસુ આંયા. કોણિકે તેનું કારણ પૂછ્યું, એટલે ખાલ્યાવસ્થામાં તેના પર શ્રેણિક રાજનો સંનહ કેવો હતો તે ચેલણું એ કહી સંભળાયું. તેથી તેમને તરત જ કેદમાંથી છૂટા કરવા તે કુહાડો લઈને પાંજરું ભાંગવા ચાહ્યો. શ્રેણિકરાજએ તેને તેવી રીતે આવતો જોઈ મરણું ના ભયથી આપદાત કરો. કોણિકને ઘણો શોક થયો. પછી શોક અળસાવવા રાજગૃહીથી રાજધાની બદલી ચંપામાં કરી.

પ્રલુબો રાજગૃહીથી ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં શ્રેણિક રાજના પદ્ધ વિગેરે દશ પૈત્રોએ પ્રલુની દેશનાથી વૈરાગ્ય પામી આચહુપૂર્વક માણાપની રજ લઈ ચારિત્ર લીધું. પ્રાંતે અનશન કરી સ્વર્ગો ગયા.

ત્યારપછી માકંદી અને ભદ્રાના પુત્ર જિનપાલિતે પ્રલુ પાસે દીક્ષા લીધી. તેની કથા બાહુ લાંખી છે, પરંતુ તેનો સાર એ છે કે-માકંદીના પુત્ર જિનરક્ષિત ને જિનપાલિત નામના હતા, તેમણે ૧૧ વાર સસુદ્ધમાર્ગે મુસાઝરી કરીને પુષ્કળ દ્રંય મેળોયું હતું. બારમી વખત માણાપની ના છતાં સસુદ્ધ માર્ગ ધારું કરિયાણું લઈને ગયા. પવનના જોરથી વહાણ ખરાબે ચડ્યું ને

ભાંગી ગયું. બંને ભાઈઓને એક પાટિયું મળ્યું. તેને આધારે તે એક અજ્ઞાત કીપે નોકળ્યા. ત્યાંની દેવી તેને પોતાના ભુવનમાં લઈ ગઈ અને તેની સાથે સુખલોગ બોગવવા લાગી. એક વાર તે દેવીને ઈદ્રની આજ્ઞાથી લવણુસમુદ્ર સાઝ કરવા માટે જલું પડ્યું. એટલે તે બંને જણુને દક્ષિણ દિશાના વન તરફ ન જવાનું સૂચવીને ગઈ. બંને જણુને એક વાર દક્ષિણ તરફ જવાની મરણ થઈ. ત્યાં જતાં એક જણુને શૂળી ઉપર ચડાવેલો જોઇ દેવીનું તે કૃત્ય જાણી તેઓ લય પામ્યા. તેમણે આ લયમાંથી ખચવાનો ઉપાય શૂળી પર રહેલાને પૂછ્યો. પેલા પુરુષે કહ્યું કે—“ અહીંથી પૂર્વદિશાએ એક શૈલક યક્ષનું મંહિર છે. તે યક્ષ આઠમ વિણે છ તિથિએ પ્રગટ થઈ ‘કોને તારું ? કોને ઉગારું ? ’ એમ પૂછે છે. તે વખતે તમે કહેને કે ‘અમને તારો, અમને ઉગારો ’ એમ કહેવાથી તે અસ્થનું રૂપ ધારણ કરશો ને તમને તેના પર એસાડી તમારે સ્થાનકે પહોંચાડ્યો. ” બંને જણુએ તે પ્રમાણે કહ્યું. યક્ષે કહ્યું કે—‘ પેલી દેવી તમારી પાછળ આવી તમને બોગવવાના અનેક પ્રયત્નો કરશો, તેથી જે બોગવાશો ને તેની સામું જોશો તેને હું પાડી નાખીશ ને તે મરણ પામશો.’ બંને જણુએ તે વાત કખૂલ કરી. યક્ષ બંનેને પોતાની પોઠ ઉપર એસારી ચાલ્યો. દેવી પાછળ આવી. તેણે ધણ્ણા પ્રયાસ કર્યે પણ જિનપાલિત ન બોગવાણ્ણો. જિનરક્ષિતે તેની સામે જોયું એટલે યક્ષે તેને પાડી નાખ્યો. તે ખૂરે હાલ મરણ પામ્યો. જિનપાલિત નિર્વિઘ્નપણે પોતાને સ્થાનકે પહોંચ્યો. માતાપિતાને અધી વાત કહી. તેઓ એદ પામ્યા. પછી ભગવંત ત્યાં પધારતાં જિનપાલિત વંદન કરવા ગયો. તેણે પ્રભુનો ઉપદેશ

સાંલળો વૈરાગ્ય પામી દીક્ષા લીધી. તે વખતે પ્રલુચે સર્વે શ્રમણુશ્રમણીઓને તેનું દ્ધાંત આપીને કહ્યું કે—‘જે સાધુ કે સાધી ચારિત્ર લીધા પછી જિનરક્ષિતની જેમ સંસારના વિષય-સુખમાં લોલાશે તે હુર્ગતિનું ભાજન થશે.’ (જિનપાલિત ચારિત્ર પાણી સ્વર્ગો ગયો.) આ રૂપ મું ચોમાસું પ્રલુચે મિથિલામાં કર્યું.

ચોમાસાખાદ પ્રલુ અંગદેશ તરફ વિહાર કરી ચંપાનગરીમાં પદ્ધાર્યા. આ અરસામાં વૈશાલીનું મહાયુદ્ધ થયું. યુદ્ધનું કારણું એ હતું કે—શ્રેણિકરાણાએ એક ૧૮ શેરનો હાર ને સેચનક હસ્તિત પોતાના પુત્ર હૃદ્વિહૃદ્વને આપ્યા હતા. શ્રેણિકરાણના મૃત્યુ પછી ડેણિક રાણ થતાં તેની સ્વી પદ્માવતીએ તે બંને પદાર્થી લાવવા ડેણિકને કહ્યું. ડેણિકે બંને વસ્તુ આપવા કહેવરાયું. હૃદ્વિહૃદ્વને જાણ્યું કે ‘ડેણિક જોરાવરીથી તે લઈ લેશો’ તેથી તે છાનામાના બંને વસ્તુ લઈને ચંપાથી નીકળી પોતાના માતામહ ચેડારાણ પાસે વિશાળામાં આવ્યા. ડેણિકે એ વસ્તુ ‘સાથે તે બંનેને પાછા મોકલવા ચેડારાણને કહેવરાયું. ચેડારાણએ તેની ના પાડતાં ડેણિક તેના પર ચરી આંધો. આ વખતે વૈશાલીમાં મહાયુદ્ધ થયું. જેમાં લાઘો માણુસો મરાણ્યા. પ્રલુ ચંપામાં હતા તે અરસામાં શ્રેણિકરાણની ૧૦ વિધવારાણીઓએ પોતાના દશ પુત્રો યુદ્ધમાં મરાણુ પામવાથી વૈરાગ્ય પામીને પ્રલુ પાસે દીક્ષા લીધી અને તીવ્ર તપ કર્યું. પ્રલુએ રૂપ મું ચોમાસું મિથિલામાં કર્યું.

યુદ્ધમાં જીતવાનો સંદેહ થવાથી ચેડારાણએ નગરીના દ્વાર બંધ કર્યા. ડેણિક ફરતો ઘેરો ઘાલીને રહ્યો. તે વખતે હૃદ્વિહૃદ્વ રાત્રે સેચનક ઉપર આવીને ડેણિકના લશકરનો વિનાશ કરવા લાગ્યા. તેની ખખર પડતાં ડેણિકે તેના માર્ગ વર્ચે એક ખાદ્ય

ઐદાવી તેમાં અંગારા લરી ખાઈ ઢાકી દીધી. સેચનકે વિલંગજાને તે વાત જાણી આગળ પગલું ન ભર્યું. હૃત્વિહૃત્વના આકોશથી સેચનકે તેને પોતાની પીડ ઉપરથી ઉતારી પોતે અભિમાં જંપાપાત કર્યો. તે જેઠ હૃત્વિહૃત્વને અલંત હુંઘ થયું. પછી પ્રબુએ મિથિલાથી શ્રાવસ્તી ભણી વિહાર કરતા હૃત્વિહૃત્વે પ્રબુ પાસે આવી દીક્ષા દીધી.

એ ચોમાસા બાદ કોણિકે કુલવાલુકને લાવી, વૈશાળીમાં દાખલ કરી સુનિસુત્રતસ્વામીનો પ્રભાવિક સ્તૂપ ઐદાવી નાખ્યો. પછી કોણિકે વૈશાળીમાં પ્રવેશ કર્યો. ચેડા રાજને વાવમાં પડતું મૂક્યું. લાંથી ધરણેંદ્ર તેમને પોતાના આવાસમાં લઈ ગયા. કોણિકે આખી વૈશાળી નગરીનો ધ્વંસ કરી તેમાં ગઢેડાવડે હળ ઐડાંયું. (વૈશાળીના વિનાશ સંબંધી જૈન ને જોદ્ધ શાસ્ત્રકારો જુદા જુદા કારણો કહે છે.)

હૃત્વિહૃત્વને દીક્ષા આપી પ્રબુ શ્રાવસ્તીએ પધાર્યા. અહીં પ્રબુને ગોશાળકનો છેલ્લો સમાગમ થયો. તે આ પ્રમાણે-

ભગવંત શ્રાવસ્તીમાં પધાર્યો ત્યારે ગોશાળો પણ ત્યાં આવેલ હતો. તે હાલાહલા નામની કુંભારણુના હાટમાં જિતર્યો હતો. પ્રબુએ ત્યાં ગોશાળાતું ખરું સ્વરૂપ પ્રગટ કરેલું તે સાંલળી ગોશાળો પ્રબુ પર ખાડુ કોધે ભરાણો. તેણું પ્રબુના શિષ્ય આનંદમુનિ ગોચરી માટે નીકળ્યા હતા તેને ઐદાવીને કહ્યું કે ‘તું તારા ધર્માચાર્યને કહેને કે તે મારી નિદા કરે છે પણ હું જ્યારે તેમની પાસે આવીશ ત્યારે તે મારું તેજ સહન કરી શકવાના નથી અને હું તેને બાળી દર્દ્દશ.’ આવા તેના વચ્ચન સાંલળી આનંદમુનિ ગભરાઇને પ્રબુ પાસે આંધ્યા. ગોશાળાએ કહેલી

વात કહી અને તેની શક્તિ વિષે પૂછ્યું. ત્યારે પ્રલુચે કહ્યું કે ‘તેના કરતાં આ અણુગારે અનંતગણી શક્તિવાળા છે. ગોશાળો મને કાંઈ કરી શકે તેમ નથી, તો પણ તું બધા મુનિઓને કહી હે કે તે આવે ત્યારે તેની સાથે કોઈ વિવાદ ન કરે.’ ગોશાળો આવ્યો. પ્રલુને હલકા વચ્ચનો કહેવા લાગ્યો. તે ન સાંભળી શકવાથી એ મુનિઓએ તેને ખોડું જોલવા માટે અને પ્રલુનું અપમાન કરવા માટે સહજ કહ્યું, તેટલામાં તો તેણે કોપાયમાન થઈ તે બંને મુનિને તેનેલેશ્યાવડે બાળી હીધા. પછી પ્રલુચે તેને પોતાપણું ન છુપાવવા કહ્યું, એટલે તેણે પ્રલુની ઉપર પણ તેનેલેશ્યા મૂકી. તે પ્રલુને પ્રદક્ષિણા દઈને ગોશાળાના શરીરમાં જ ચેઢી. ગોશાળાએ પ્રલુને કહ્યું કે ‘તમે મારી તેનેલેશ્યાથી છ માસમાં મૃત્યુ પામશો’ પ્રલુચે કહ્યું કે ‘હું તો હણુ ૧૬ વર્ષ વિચરવાનો છું, પણ તું તારી જ તેનેલેશ્યાવડે આજથી સાતમે દિવસે મરણ પામશા.’ તે ત્યાંથી ચાલ્યો ગયો. પરિણામે સાતમે દિવસે મરણ પામયો. અહીં પ્રલુને તેની તેનેલેશ્યાના રૂપર્થથી છ માસ પર્યાંત દસ્તમાં લોહી પડ્યું. પછી સિંહમુનિની વિનાંતિથી દૈવતી શ્રાવિકાને ત્યાંથી તેણે પોતાને માટે કરેલો ઝીજેરાપાક મંગાવી પ્રલુચે વાપર્યો ને વ્યાધિ તરત જ શરીર ગયો. સિંહમુનિ અને સર્વ ગણુધરાદિ નિશ્ચિંત થયા.

પ્રલુ ત્યાંથી વિહાર કરી ભિથિલા તરફ પધાર્યા અને સત્તાવીશમું ચોમાસું ભિથિલામાં કર્યા પછી પ્રલુચે પશ્ચિમ તરફ વિહાર કરતાં પ્રથમ શ્રાવસ્તીમાં આવ્યા. તે વખતે શ્રી પાર્શ્વનાથના

વીરપ્રલુના કેવળીપણ્ણાના છેણ્ણા ૧૫ વર્ષ.

૨૭ સું ચોમાસું ભિથિલામાં કર્યા પછી પ્રલુચે પશ્ચિમ તરફ વિહાર કરતાં પ્રથમ શ્રાવસ્તીમાં આવ્યા. તે વખતે શ્રી પાર્શ્વનાથના

સંતાનિયા કેશી ગણુધર પણ ત્યાં આવ્યા હતા. તે વળતે બંને સમુદ્દરાયના સાધુ એકત્ર મળતાં ત્રતની સંખ્યામાં અને વસ્તુના રંગ વિગેરેમાં જુદાઈ જાણી પોતપોતાના શુલ્પ પાસે આવી તેનું કારણું પૂછવા લાગ્યા. એટલે ગૌતમસ્વામી પોતે જ કેશીગણુધરનો દીક્ષાપર્યાય વિશેષ જાણી તેમની પાસે ગયા. કેશીગણુધરે સત્કાર કર્યા પછી બંને વચ્ચે વાતચીત થતાં સ્પષ્ટ ઝુલાસો થયો. માર્ગ-લેદનું કારણું જીવલેદ-ઋજુજડ, ઋજુપ્રાજ અને વહેજડની વિવક્ષા થઈ. પરિણામે કેશીગણુધરે વીરપ્રભુનું શાસન સ્વીકાર્યું.

પ્રભુ ત્યાંથી હસ્તિનાપુર તરફ જતાં ત્યાં શિવરાજર્ખિ મહ્યા કે જે ત્યાંના રાજ હતા અને વૈરાગ્ય થવાથી તાપસી દીક્ષા લીધી હતી. અનેક પ્રકારનું અજ્ઞાનકષ્ટ કરતાં તેમને વિલંગજ્ઞાન થયું હતું તેથી તે સાત દીપ ને સાત સુદૃઢ જોગ શકતા હતા. એટલે તેથી વધારે દીપો કે સમુદ્રો નથી એમ કહેતા હતા. તે વાત ગોચરી ગયેલા ગૌતમસ્વામીએ સાંભળી, તેથી પ્રભુ પાસે આવીને પૂછ્યું. પ્રભુએ કહ્યું કે ‘શિવરાજર્ખિની વાત ખોટી છે, દીપો ને સમુદ્રો તો અસંખ્યાતા છે.’ આ વાત સાંભળી શિવતાપસ મહાવીર પ્રભુ પાસે આવ્યા અને ઘણી ચર્ચા કર્યા બાદ પ્રભુએ કહેલ તે સત્ય છે એમ સ્વીકારી પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યાર-પછી તીવ્ર તપ બહુ વર્ષો સુધી કરી અનશન કરીને મોક્ષ ગયા.

આ અરસામાં ત્યાં પોઢુલ નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેણું પણ પ્રભુનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને તે પોઢુલ અણુગાર અસુક વર્ષ સુધી ચારિત્ર પાળી પ્રાંતે અનશન કરી અનુત્તર વિમાનમાં હેવ થયા.

પ્રભુએ ત્યાંથી વૈશાળી ને વાણુજ્યથામ તરફ વિહાર કર્યો.

વैशाणीनुं યુદ્ધ તો બંધ થયું હતું, પરંતુ તે યુદ્ધથી વાણિજ્ય-
આમને પણ ઘણી હાનિ થઈ હતી. ધીમે ધીમે માણુસે ભરાવા
માંડ્યું હતું. પ્રલુબે ૨૮ સું ચોમાસું ત્યાં કર્યું.

ચોમાસા બાદ પ્રલુબે મગધ તરફ વિહાર કર્યો. એ વર્ષમાં
કંઈ વિશેષ હક્કીકત બનેલો નોંધાણી નથી. ડેટલાક મુનિઓએ
વિપુલગિરિ પર જઈને અણુસણુ કર્યું હતું. આ ૨૯ સું ચોમાસું
પ્રલુબે રાજગૃહીમાં કર્યું.

ચોમાસા બાદ પ્રલુબે ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં શાલ ને
મહાશાલ નામના એ બંધુઓ યુવરાજ હતા. તેમણે પ્રલુબો
ઉપરેશ સાંભળી વૈરાગ્ય પામી પોતાની બહેન યશોમતીના પુત્ર
ગાગલીને રાજ્ય સૌંપી દીક્ષા લીધી.

પ્રલુબે ત્યાંથી દશાર્થ દેશ તરફ વિહાર કર્યો. તે દેશમાં
દશાર્થપુરના રાજ દશાર્થલદ્રે પ્રલુબે પધાર્યા સાંભળી કોઈએ
ન કર્યું હોય એવું અપૂર્વ સામૈયું કરવાનો નિરધાર કર્યો અને
તેવું સામૈયું લઈ પ્રલુબે પાસે આવ્યા. તે વખતે સૌધમેંડ્ર તેમની
અભિજ્ઞાતીમાં અલિમાનનું વિષ અણતું જણી પોતો ૬૪૦૦૦ હાથીએ
વિંગેરે વિકુવી આકાશમાર્ગે ઉત્તરવા લાગ્યા. તેમની ઝડ્ધ જોઈ
દશાર્થલદ્રનું માન ગળી ગયું, એટલે તેમણે તત્કાળ વૈરાગ્ય પામી
રાજ્ય તણું દઈ પ્રલુબે પાસે દીક્ષા લીધી. તે જોઈ ઈંદ્રે તેમને
નમસ્કાર કર્યો અને ખરેખરા માનતના જળવતારા કહી ખમાંયા.
દશાર્થલદ્ર મુનિ અનેક પ્રકારનો તપ તપવા લાગ્યા.

પ્રલુબે ત્યાંથી વિદેહ દેશ તરફ વિહાર કર્યો. માર્ગમાં

વાણિજ્યથામમાં સોમિલદિજ ભજ્યો. તે પોતાના શાસ્ત્રમાં ધણ્ણા પ્રવીષુ હતો. તેણું પ્રલું પાસે આવી અનેક પ્રક્ષો પૂછી પ્રલુના સર્વજ્ઞપણુની ને અક્ષાયોપણુની ખાત્રી કરી. તેણું પ્રલું પાસે ચારિત્ર પાળવાને અશક્ત હોવાથી શ્રાવકના વ્રતો બહણું કર્યો અને શ્રાવકપણું ધણ્ણા વર્ષો સુધી પાળી સ્વર્ગો ગયો.

પ્રલુએ ઊં ચોમાસું વાણિજ્યથામે કર્યું.

ચોમાસા બાદ પ્રલુએ કોશલ, પાંચાલ વિગેરે દેશો તરફ વિહાર કરી વૈશાળીમાં આવી ઊં ચોમાસું ત્યાં કર્યું.

ચોમાસા બાદ કંપિદ્યપુરમાં અંભડ પરિત્રાજક ભજ્યો. તેણું દીક્ષા તો ન લીધી પણ જૈનપણું સ્વીકારી શ્રાવકના કેટલાક વ્રતો લીધા. ત્યાંથી વિહાર કરી, પ્રલુ કાશી વિગેરે પ્રદેશમાં ફરી પાછા વૈશાળીએ આવી ઊં ચોમાસું ત્યાં કર્યું.

વાણિજ્યથામમાં પ્રલુને પાર્શ્વનાથના સંતાનીઆ ગાંગેય અણુગારનો સમાગમ થયો. તેમણું પ્રલુને અનેક પ્રકારના પ્રક્ષો અને લાંગાઓ પૂછ્યા. ભગવંતે આપેલા તેના તાત્કાળિક ઉત્તરાથી પ્રલુને સર્વજ્ઞ-સર્વહૃષીં જાણું તેમણું પ્રલુ પાસે ફરીને દીક્ષા લઈ પાંચ મહાવત્તર્ય ધર્મ સ્વીકાર્યો. (આ ભાંગાઓનું સ્વર્ગ ભગવતી સૂત્રના શતક દમાના ઉદેશા રૂર મામાં વર્ણવેલું છે.)

પ્રલુએ ત્યાંથી ભગધ ભણ્ણી વિહાર કર્યો, કારણું કે કેટલાક સુનિઓને વિપુળગિરિ પર અનશન કરવાની દુઃખી હતી.

અહીં પ્રલુએ છઢ્યા આરાના તેમજ પાંચમા આરાના ભાવ કદ્યા. એક કાળચંકનું, ઉત્સર્પિણી અવસર્પિણીનું તેમજ તેના ભારે આરાનું સ્વર્ગ વિસ્તારથી કદ્યું.

ત્યાંથી પ્રલુએ ચંપા તરફ વિહાર કર્યો. ત્યાં પધાર્યા એટલે પ્રલુની આજાથી ગૈતમસ્વામી શાળમહાશાળ મુનિની સાથે ચંપાએ જઈ તેણે રાજ્ય પર સ્થાપન કરેલા ભાણેજ ગાગલીને તેમજ તેના માતાપિતા પીઠર તથા થશોમતીને ઉપદેશ આપ્યો. તેમણે ગૈતમસ્વામી પાસે દીક્ષા લીધી. ત્યાંથી પ્રલુ પાસે આવતાં માર્ગમાં શુલ ધ્યાનવડે શાળમહાશાળ તેમ જ ગાગલી અને તેના માતાપિતા એ પાંચેને કેવળજ્ઞાન થયું. પ્રલુ પાસે આવતાં ગૈતમસ્વામીએ તે હુકીકત જાણી એટલે તેમને આશ્ર્ય થયું અને એહ પણ થયો કે ‘મને કેવળજ્ઞાન થશો કે નહીં ?’ તે જાણી પ્રલુએ તેને પોતાની પાસે ઓલાવી કહું કે—“હે ગૈતમ ! તમે મારી પાસે બહુ વર્ષોથી રહ્યા છો તેથી તમારો મારા પર બહુ રાગ છે તેમ જ પૂર્વનો પણ ધણા લવનો મારી સાથે સંબંધ છે તેથી તમને કેવળજ્ઞાન થતું નથી, પરંતુ પ્રાંતે તમે કેવળજ્ઞાન પામી મારા સરખી સિદ્ધદશાને મેળવશો.” આ પ્રમાણે સંલગ્ની તેઓ નિશ્ચિંત થયા. પ્રલુએ તું સું ચોમાસું રાજગૃહીમાં જ કર્યું.

આ અરસામાં ધણું મુનિએએ અનશન કરેલું હોવાથી ચોમાસાખાદ પણ પ્રલુ રાજગૃહીમાં જ રહ્યા.

રાજગૃહીની બહાર ગુણશીલ નામના યક્ષના સ્થાનમાં પ્રલુ રહ્યા હતા, તેની નજીકમાં થોડે હુર કાળોદાયી વિગેરે દશ ગૃહસ્થો રહેતા હતા. એક વાર તેઓ એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે ‘લગ્નવંત મહાવીર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગળાસ્તિકાય ને લુલાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય કરું છે, તેમાં પુદ્ગળાસ્તિકાય રૂપી છે ને ચાર અરૂપી

છે. આ વાત બરાબર છે ?' આમ વિચારે છે ત્યાં ગોચરીએ નોકળેલા ગૌતમસ્વામી તે તરફ પધાર્યો. તેને કાળોદાયોએ અસ્તિકાય વિષે પૂછ્યું. તેમણે તેનું સ્વરૂપ સમજાયું, પરંતુ તેમને વધારે સ્પષ્ટ સમજવું હતું તેથી તેઓ મહાવીર પરમાત્મા પાસે આવ્યા. તેમને પ્રલુએ પાંચ અસ્તિકાય વિષે બહુ સ્પષ્ટતાથી સમજાયું એટલે તેમને સંતોષ થયો. પછી તેમણે બીજી કેટલાક પ્રક્રિયાએ પૂછ્યા. છેવટે પૂછ્યું કે 'એક માણુસ અભિ સળગાવે છે ને બીજે ઓલવે છે તે બેમાં વધારે પાપી-હિંસક કોણું ?' પ્રલુએ કહ્યું કે-' સળગાવનાર અનેક પ્રકારના જીવોનો હિંસક હોવાથી મહાપાપી છે. ઓલવનાર તેનાથી ઓછો પાપી છે.' આ વાત બહુ સારી રીતે સમજલી, તેથી તે દર્શે ગૃહસ્થોએ પ્રલુ પાસે ચારિત્ર થહુણું કર્યું. પ્રલુએ તેને સ્થવિરાને સાંખ્યા. પ્રલુ અન્યત્ર વિહાર કરી ઝરીને ત્યાં પધાર્યો ત્યારે કાળોદાયી મુનિએ પ્રક્રિયા કર્યો કે-' હે ભગવંત ! પાપકર્મો જીવોને અશુભ ઝૂળ શી રીતે આપે છે ?' પ્રલુએ કહ્યું કે 'વિષમિશ્રિત સુંદર સ્વાદિષ્ટ લોજન કરનારને જેમ પરિણામે વિષ અસર કરે છે અને તેના પ્રાણુનો વિનાશ થાય છે તે જ રીતે પાપકર્મો પણ જીવોને ફુર્ગતિમાં પહોંચાડે છે અને સત્કર્મો સફુર્ગતિનું લાજન કરે છે.' (અહીં ધ્યોન વિસ્તાર જાણવા જેવો છે.)

પ્રલુએ આ ઉઠ સું ચોમાસું રાજગૃહીના નાલંદા નામના પાડામાં જ કર્યું. એ પાડો રાજગૃહીના પરારૂપ છે.

ત્યાં નજીકમાં જ પાર્વિનાથના સંતાનીએ પેઢાલપુત્ર ઉદ્ડક નામના મુનિ આવેલા હતા, તેમણે આ ચાતુર્માસમાં જ ગૌતમસ્વામી પાસે આવી કેટલાક પ્રિનો કર્યા તે જાણવા જેવા

છે. પ્રથમ તો પૂછ્યું કે—‘કોઈ શાવક ત્રસ જીવને ન મારવાનો નિયમ કરે પણ ત્રસ જીવ કાયમ ત્રસ રહેતા નથી, થાવરપણું પામે છે, થાવરજીવો ત્રસપણું પામે છે, તો થાવરની વિરાધના કરતાં તે પૂર્વે ત્રસ હતા તેથી ત્રસની વિરાધના થઈ કે નહીં ? ’ ગૌતમસ્વામીએ કહ્યું કે ‘શાવકે કરેલી પ્રતિજ્ઞા વર્તમાન સમયે જે ત્રસપણું હોય તેનો હિંસાના ત્યાગની જ છે, તેથી તેને સ્થાવરની વિરાધના કરતાં ત્રસની વિરાધના લાગતી નથી.’ (એમના થીલ પ્રશ્નો પણ જાણ્યા જેવા છે તે સ્થળસંકોચના કારણથી અહીં આપ્યા નથી.) પ્રાંતે ઉદ્દકમુનિને ગૌતમસ્વામીએ બહુ હિતશિક્ષા આપીને પરનિંદા કરતાં અટકાવ્યા. તેમણે પાર્ખીનાથના ચાર મહાત્રતર્ફ ધર્મ તળ વીરપ્રભુનો પાંચ મહાત્રતર્ફ ધર્મ ગૌતમસ્વામી પાસે સ્વીકાર્યો.

આ ઉચ્ચ મા ચોમાસાણાદ પ્રભુએ વિદેહ તરફ વિહાર કર્યો. માર્ગમાં વિશાળા પાસે વાણિજ્યથામમાં સુદર્શન શેડનો જીઠો થયો. તેમણે પ્રભુને કાળનું સ્વરૂપ પૂછ્યું. પ્રભુએ તેને પરમાણુની શરૂઆતથી એક ચોજનપ્રમાણ પાલા સુધી સ્વરૂપ કહી તે પાલામાં ભરેલા વાળાથને અસંખ્યાતા કલ્પી સો સો વર્ષે કાઢવા વિગેરે હુકીકત સમજાવીને પદ્ધોપમ તથા સાગરોપમનું સ્વરૂપ કહ્યું. એટલે સુદર્શને કહ્યું કે—‘ એવા સાગરોપમનો અંત શી રીતે આવે ? અને એવા અનેક સાગરોપમના-આયુષ્યવાળા નરકના જીવોનો છૂટકારો શી રીતે થાય ? ’ પ્રભુએ કહ્યું કે—“ હે સુદર્શન ! હસ્તિનાપુરમાં બળરાજને પ્રભાવતી રાણીથી સિંહના સ્વરૂપને સ્થૂચિત પુત્ર થયો. મહાબળ નામ રાજ્યું. તેને સંસારના વિલાસમાં રોકી રાખવામાં આવ્યો, છતાં

એક વાર શ્રી વિમળનાથ પ્રલુના સુનિનો તેને સમાગમંથઈ ગયો. તેમના ઉપદેશથી તેણે માભાપનો સંસારમાં રોકવાનો અત્યંત આથડું છતાં દીક્ષા લીધી અને ચારિત્ર પાળી પાંચમા પ્રક્રિયાએ કર્યાનો હતું. દશ સાગરોપમના અચુણ્યે હેવ થયો. ત્યાંથી ચ્યબી તું સુદર્શન થયો છે. વિચાર કર કે તારું દશ સાગરોપમનું આચુણ્ય પણ પૂરું થયું કે નહીં ? ” આ પ્રમાણે સાંકળી પ્રતિબોધ પામી તેણે દીક્ષા લીધી અને વિશુદ્ધ ચારિત્ર પાળી મોક્ષ ગયા.

આ ઉપ સું ચોમાસું પ્રલુએ વિશાળામાં જ કર્યું. ત્યારપણી પ્રલુ મધ્ય પ્રદેશમાં જુદા જુદા દેશો તથા નગરી-ઓમાં વિચર્યા. પાછા વિદેહ તરફ આવ્યા. ત્યાંથી વાણીજ્યગામમાં આવતાં આનંદ શ્રાવકને થયેલ અવધિજ્ઞાનનો ને ગૈતમસ્વામીએ આપેલ ભિથ્યા હુઝૂતનો પ્રસંગ જન્યો.

૩૬ સું ચોમાસું પ્રલુએ મિથિલામાં કર્યું.

ચોમાસા બાદ અંગદેશમાં ચંપાનગરીમાં આવ્યા. કામહેવ શ્રાવકને પિશાચે કરેલો. ઉપસર્ગ આ વર્ષમાં જન્યો. પ્રલુએ રાજગૃહી તરફ વિહાર કર્યો. ત્યાં પ્રલુના ઘણું સુનિઓ મોક્ષ ગયા. પ્રલાસ ગણુધર પણ આ વર્ષમાં જ મોક્ષ ગયા.

૩૭ સું ચોમાસું પ્રલુએ રાજગૃહીમાં કર્યું.

ચોમાસા બાદ પણ પ્રલુ મગધદેશમાં જ વિચર્યા. આ વર્ષમાં અચળજ્ઞાતા ને મેતાર્ય એ ગણુધર નિર્વાણ પામ્યા.

૩૮ સું ચોમાસું પ્રલુએ રાજગૃહીના નાલંદાપાડામાં કર્યું.

ચોમાસાબાદ પ્રલુએ વિદેહ ભૂમિમાં જ વિચર્યા કર્યું. મિથિ-

લામાં રહ્યા તે વખતમાં પ્રલુચે જૈતમસ્વામીને જ્યોતિષશાસ્ક સમજાયું એમ સૂર્યપ્રશસ્તિમાં કહ્યું છે.

૩૮ સું ચોમાસું પ્રલુચે ભિથિલામાં કર્યું.

ચોમાસા બાદ પણ વિદેહમાં જ વિચર્યા અને ૪૦ સું ચોમાસું પણ ભિથિલામાં કર્યું.

ચોમાસા બાદ પ્રલુચે મગધ તરફ પધાર્યા. મહાશતક શાવકને રેવતીએ કરેલો ઉપસર્ગ આ વર્ષમાં બન્યો, અને આજિનભૂતિ ને વાયુભૂતિ એ ગણુધરો નિર્વાણ પામ્યા.

૪૧ સું ચોમાસું પ્રલુચે રાજગૃહીમાં કર્યું.

તે ચોમાસા દરમ્યાન અવ્યક્તા, મંડિત, મૌર્યપુત્ર ને આંકપિત-એ ચાર ગણુધરો મોક્ષ ગયા.

ચોમાસા બાદ પ્રલુચે પાવાપુરી તરફ વિહાર કર્યો. સતત વિહારથી, ઉપદેશધારાના વહનથી તેમજ ધીજ શારીરિક કારણુથી પ્રલુના શરીરને ધસારો લાગ્યો હતો, પરંતુ પ્રલુનું શરીર અવિચિન્નપણે એકસરખું કામ આપતું હતું. પાવાપુરી પહોંચીને પ્રલુચે હુસ્તિપાળ રાનની કારકુનોને બેસવાની જૂની શાળામાં નિવાસ કર્યો. ઉપદેશનું કાર્ય તો શરૂ જ હતું. છેવટના વખતમાં (૫૫) અધ્યયન પુણ્યકુળવિપાકના, (૫૫) અધ્યયન પાપકુળવિપાકના અને ઉદ્દેશ્યન વગરપૂછ્યે પ્રલુચે પ્રરૂપ્યા. પ્રાંતે ચોગરંધનની કિયામાં પ્રવતર્યા.

શ્રી જૈતમસ્વામીને પ્રલુ ઉપર અત્યંત રાગ હતો, તે

રાગનું બંધન તોડવા માટે પ્રલુએ તેમને નજીકના ગામે દેવ-
શર્મા પ્રાક્ષણુને પ્રતિબોધ કરવા મોકદ્યા.

પ્રલુનો નિર્વાણસમય જ્ઞાનવડે જાણી અનેક દેવહેવીએ
થાં આવવા લાગ્યા. ભગવંતે તો સંસારનો પાશ જે રીતે
ત્રૈયો હતો તે જ રીતે કર્મનો પાશ પણ ત્રૈયી નાખ્યો.
તેમને કોઈના પર મોહુ-મમતા તો હતા જ નહીં, સર્વથા
નિરીહ હતા. તેમણે અંત અવસ્થાએ આ દેહના મમત્વને
પણ તળ હીધે અને આસો વહિ ૦)) ની રાત્રિએ ચાર અધા-
તિકર્મનો ક્ષય કરી એક સમયે મોહ્ને પધાર્યા. અનંત ને
અંયાખાંધ સુખના ભાજન થયા કે જે સુખનું વર્ણન કેવળ-
જ્ઞાનીએ પણ કરી શકતા નથી. તેમણે સમય જિંદગી પરો-
ખકાર માટે જ વ્યતીત કરી. છેવટના મુનિપણુના ૪૨ વર્ષ
તેમાં પણ કેવળીપણુના ઉંઠ વર્ષમાં તો ઉપકાર કરવામાં બાકી
રાખી નહીં. અનેક મનુષ્યોને મુનિપણું ને શ્રાવકપણું આપી
તેમને પરિતસંસારી બતાયા.

આ ૪૨ સું ચોમાસું (કેવળીપણુનું ૩૦ સું ચોમાસું)
પાવાપુરીમાં થયું.

ગૌતમસ્વામીને કેવળજ્ઞાન.

દેવશર્મા દ્વિજને પ્રતિબોધીને કાર્તિક શુદ્ધ ૧ ના પ્રાતઃકાળે
ગૌતમસ્વામીએ ત્યાંથી પાછા વળતા ઉત્સાહલેર પ્રલુ પાસે આવવા
માટે વિહાર કર્યો. માર્ગમાં અનેક દેવહેવીએના સુખેથી પ્રલુનું
નિર્વાણ થયું જાણી તેમને પારાવાર ઘેહ થયો. આવે અણીને વખતે
પ્રલુએ તેમને પોતાથી છૂટા પાડ્યા તેને માટે બહુ લાગી આંધું,

પરંતુ પ્રાંતે તેમના એહે વૈરાગ્યનું ૩૫ લીધું અને પ્રભુની વીતરાગદશા લક્ષમાં આવી. પ્રભુએ પોતાના હિત માટે જ દૂર કર્યાનું સમજાણું. એટલે શુલલાવે ચડચા અને ક્ષપકશ્રેષ્ઠી માંડી તત્કાળ કેવળજ્ઞાન પામ્યા. દેવોએ વીરપ્રભુનો નિર્વાણ મહોત્સવ કર્યા બાદ ગૌતમસ્વામીનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ગૌતમસ્વામી કેવળજ્ઞાનીપણે ૧૨ વર્ષ વિચચર્યા અને ગરુદનો સમસ્ત ભાર સુધર્માસ્ત્વામીને સેંપી નિર્વાણ પામ્યા.

અહો કેવળીપણુના ૩૦ વર્ષની હૃકીકિત પૂર્ણ થાય છે. શચ્ચસ્થપણુના ૧૨ ને કેવળીપણુના ૩૦ કુલ ૪૨ ચોમાસા પ્રભુએ કચાં કચાં કર્યાં ? તે સુષોધિકા ટીકામાં આ પ્રમાણે ખતાવેલ છે.

૧ અસ્થિકચામે, ૩ ચંપા ને પૃષ્ઠચંપામાં, ૧૨ વિશાળાનગરી અને વાણિજ્યચામની નિશાએ, ૧૪ રાજગૃહીનગરી ને નાલંદાપાડાની નિશાએ, ૬ ભિથિલામાં, ૨ લદ્રિકામાં, ૧ અલંસિકામાં, ૧ શ્રાવસ્તિમાં, ૧ વજભૂમિમાં (અનાર્ય દેશમાં) ને છેલ્દું મધ્યમ અપાપામાં. એમ કુલ ૪૨ ચોમાસા સમજવા.



શ્રી વીરપ્રભુના છજ્જસ્થપણાના ૧૨॥

વર્ષના વિહારમાં થયેલા ઉપસર્ગાદિનું

સંક્ષિપ્ત વાર્ણન

(ચોમાસાના સ્થળ સાથે)

શ્રી વીરપરમાત્માએ કાર્તિક વદિ દશમે (મા. માગશર વદિ ૧૦ મે) ક્ષત્રિયકુડ થામે દીક્ષા લીધી અને સ્વજનવર્ગની અનુમતિ માળીને વિહાર કર્યો. સ્વજને શોક સાથે પોતાને સ્થાને ગયા. પ્રભુને શરીરે કરેલા બાવનાચંદન વિગેરે સુગંધી પદાર્થના વિકેપનથી આવેલા ભ્રમરાદિકે પ્રભુના શરીરને ઘણી ઉપાધિ કરી. ચુવાનોએ તેમ ૪ ચુવતીઓએ પણ અનુકૂળ ઉપસર્ગ કર્યાં. પ્રભુ ત્યાંથી એ ઘડી દિવસ હતો ત્યારે કુમારથામે ગયા. રાત્રે કાયોત્સર્ગે રહ્યા, તે દિવસે ગોવાળો સાંજે પોતાના બળદો પ્રભુ પાસે મૂકી જણવવાનું કહીને ગયા. પાછા આવ્યા ત્યારે બળદો નહોટા. ‘કયાં ગયા ?’ એમ પ્રભુને પૂછતાં તેઓ તો મૈન રહ્યા. એટલે તેઓ શોધવા ગયા. પાછા આવતાં પ્રભુ પાસે બળદોને દીઠા એટલે પ્રભુએ સંતાજ્યા હશે એમ માની મારવા દોડ્યા. ઈંદ્રે અવધિજ્ઞાનથી જાણી ત્યાં આવી તેનું નિવારણ કર્યું. પછી ઈંદ્રે પ્રભુને કહ્યું કે ‘આપને બાર વર્ષ પર્યાત ઘણ્ણા ઉપસર્ગો થવાના છે તો તેના નિવારણ માટે હું આપની પાસે રહું.’ પ્રભુએ કહ્યું કે ‘હુ ઈંદ્ર ! તીર્થંકરો અન્યની સહાયથી કર્મ ખપાવતા નથી, તેથી તમારે રહેવાની જરૂર નથી.’ આમ કહેવાથી ઈંદ્ર સિદ્ધાર્થ નામના વ્યાતરને પ્રભુ પાસે રાખીને ગયા.

પ્રભુએ દીક્ષાને બીજે દિવસે સવારે કોદ્વાગ સન્નિવેશમાં જઈ બહુલ પ્રાક્ષણુને ત્યાં ગૃહસ્થના પાત્રે પારણું કર્યું. પાંચ દિવય^૧ પ્રગટ થયા. પ્રભુ ત્યાંથી મોરાક સન્નિવેશો ગયા. પ્રભુના પિતાના મિત્ર તાપસે ત્યાં રહેવાનો આથહ કર્યો. પ્રભુ આડ માસ વિહાર કરી ચોમાસું કરવા ત્યાં આવ્યા અને તાપસે આપેલી એક ઘાસની ઝુંપડીમાં રહ્યા. હોર તે ઝુંપડીનું ઘાસ ખાઈ જવા લાગ્યા. પ્રભુએ નિવારણ ન કર્યું, તેથી કુળપતિએ આવીને ઠપકો દીધો, એટલે તેની અપ્રીતિ થયેલ જાણી, ચોમાસું શરૂ થયાને ૧૫ દિવસ થતાં જ પ્રભુ વિહાર કરી ગયા. તે વખતે પાંચ અલિથહ કર્યા. ૧ અપ્રીતિવાળા સ્થાનમાં રહેવું નહીં, ૨ જ્યાં સ્થિત થવું ત્યાં હમેશાં કાચોસર્ગમાં જ રહેવું, ૩ ગૃહસ્થનો વિનય ન કરવો, ૪ મૈન રહેવું અને ૫ હસ્તપાત્રી થવું.

પ્રભુ ત્યાંથી વિહાર કરી *અસ્થિકુદ્રામે ગયા અને ત્યાં પ્રથમ ચોમાસું કર્યું. માર્ગમાં એક નિમિત્તિએ પ્રભુની પદપંક્તિ લેઈને ડેઢ ચક્વતીને એકલા જતા જાણી પાછળ પગલે પગલે આવ્યો. ત્યાં તો પ્રભુને ચોગીપણુંમાં લેઈ નિરાશ થયો. ઈંદ્રે તેને પ્રભુનું સ્વરૂપ સમજાવી દ્રોય આપી રાજ કર્યો. પ્રભુ એક વર્ષ આજેરા વસ્ત્રધારી રહ્યા, બાકીનો અધો વખત વસ્ત્ર રહિત રહ્યા. પાછળ આવેલા પ્રાક્ષણુને પ્રભુએ અર્ધ વસ્ત્ર આપ્યું. વિશેષ હક્કીકત સુઅધિકારી જાણુવી.

પ્રભુ લોકોએ ના પાડ્યા છતાં શૂલપાણી યક્ષના સ્થાનમાં

૧. સુગંધી જળની વૃષ્ટિ, ૨ સુગંધી પુષ્પોની વૃષ્ટિ, ૩ ચેલોલક્ષેપ,
 - ૪ ૧૨॥ કોડ સેનેયાની વૃષ્ટિ, ૫ અહોદાન અહોદાન એવી ઉદ્ધોષણા.
- * અસ્થિકુદ્રામ નામ પડવાનું કારણ સુઅધિકારી જાણુવું.

જઈને કાઉસગ્ગ દ્યાને રહ્યા. તે વખતે પ્રથમ રાત્રિએ શૂળપાણી યક્ષે અસંશ્ય ઉપસર્ગો કર્યાં. પ્રલુચે તે સર્વ સહુન કર્યાં. પ્રાંતે તે પ્રસન્ન થયો. સિદ્ધાર્થે પણ તેને સમજાવ્યો. પછી તેણે પ્રલુની ગીતજ્ઞાનવડે ભક્તિ કરી. તે શૂળપાણી યક્ષ કોણું હતો? તેની અને તેણે કરેલા ઉપસર્ગોની હકીકત સુધોધિકાથી જાણ્યવી. તે રાત્રિના ઉપસર્ગના અત્યંત શ્રમથી પ્રલુને ક્ષણુવાર નિદ્રા આવી. તેમાં પ્રલુચે દશ સ્વમન્યેયા. બીજે દ્વિવસે અનેક મનુષ્યોની સાથે ઉત્પલુન નિમિત્તિયો પ્રલુપાસે આવ્યો. તેણે પ્રલુને આવેલા દશમાંથી નવ સ્વૈનનું ક્રુણ શું થશે તે કહી બતાવ્યું. એકનું ક્રુણ પ્રલુચે કહ્યું. આ પ્રથમ ચોમાસું અસ્થિક આપે કર્યું. તે ચોમાસામાં પ્રલુચે આડ પક્ષક્ષ્યપણું કર્યું.

અસ્થિકચામથી નીકળી ચોમાસા બાદ પ્રલુપોરાકસન્નિવેશે પદ્ધાર્યો. ત્યાં અરછંદુક નામે એક પાખંડી રહેતો હતો. તે અનેક પ્રકારના મંત્ર, તંત્ર ને છળલેદ કરતો હતો. હુરાચારી પણ હતો. સિદ્ધાર્થે તેની કેટલીક હકીકત પ્રસિદ્ધ કરી તેથી તેની હુલકાઈ થઈ. એટલે તેણે એકાંતમાં પ્રલુપાસે આવીને કહ્યું કે—‘આપ તો બધે પૂજનશો, મારું તો અહીં કાંઈક માન છે, માટે મારા પર કૃપા કરીને આપ મારા પેટ પર પગ ન મૂર્કે.’ પ્રલુચે તેને અપ્રોતિ થતી જાણ્યી ત્યાંથી વિહાર કર્યો. ત્યાંથી ઉત્તરવાચાળ ગામ તરફ પ્રલુપ ગયા. ત્યાં બાકીનું અર્ધ વસ્ત્ર કાંઠામાં ભરાવાથી પડી ગયું તે પાછળ ફરનાર ખાંખણું લઈ ગયો. અને તેને તુનાવી, આખું વસ્ત્ર બનાવી તેના લક્ષ દ્રષ્ટ મેળવ્યા.

પ્રલુચે ત્યાંથી શ્વેતાંખી તરફ વિહાર કર્યો. ત્યાં જવાના એ માર્ગો હતા. તેમાંનાં ટૂંકા માર્ગો ચંડકૌશિક નામનો દૃષ્ટિ-વિષ સર્પ રહેતો હતો, તેથી તે રસ્તે કોઇ જતું નહીં. પ્રલુ-

તો તેના પર ઉપકાર કરવા તે રહ્સ્તે જ ચાલ્યા. ચંડકોશિક સર્પના સ્થાન પાસે આવી કાચોતસર્ગ ધ્યાનમાં સ્થિત થયા. સર્પ ભીલની ખણાર નીકળ્યો. પ્રલુને જોતાં તેણે તેમના ઉપર સૂર્ય સામે જોઈને વિષવાળી દૃષ્ટિ હેંકી, પણ પ્રલુને તેની અસર ન થઈ, તેથી તે પ્રલુની પાસે આવી પ્રલુને પગે કરડવા ગયો. પગે ડંશ હેતા શ્વેત ઇધિર નીકળ્યું. તે જોઈને તૈમજ પ્રલુએ કહ્યું કે ‘ચંડકોશિક ! બુજ બુજ’ તે સાંલળીને ઊહાપોહ કરતાં તેને જલિસ્મરણ જ્ઞાન થયું. તેણે પૂર્વના લવ હીડા. મુનિનો લવ, દેવ લવ, તાપસનો લવ, તે પછી સર્પ થયાનું જાણ્યું. પછી પ્રલુનો મહાનું ઉપકાર માની ત્રણ પ્રહક્ષિણા દઈ વંદન કર્યું ને અણુસણું માગ્યું. પ્રલુએ ૧૫ દિવસનું અણુસણું કરાયું. સર્પ પોતાની દૃષ્ટિથી કોઈને હાનિ ન થાય માટે ભીલમાં મુખ રાખીને રહ્યો. તેને લક્ષ્ય થઈ ગયેલો જાણી ગોવાળણોએ તેના શરીર પર ક્ષીર ને ધૂત નાખી તેની પૂજા કરો. તેના સંઘોગથી કીડીઓએ આવી તેના શરીરને વીંધી નાખ્યું, પરંતુ તેણે તે પીડા પ્રલુની શીતળ દૃષ્ટિથી સમભાવે સહન કરો. ૧૫ દિવસે કાળ કરીને તે આડમા દેવલોકમાં દેવ થયો. પ્રલુએ ત્યારપણી ત્યાંથી વિહાર કર્યો.

ગંગાનદીને કાં ઠે આવતાં નહી ઉત્તરવા માટે પ્રલુ નાવમાં એક તેવામાં ધુવડનો શાણ સાંલળી ક્ષેમિલ નિમિત્તિયાએ નાવમાં એડેલા-ઓને કહ્યું—‘આપણુને નહી ઉત્તરતા મહાનું ઉપદ્રવ થશો, પણ આ મહાત્માના પ્રલાવથી બચ્ચી જશું.’ બન્ધું એમ કે-પ્રલુએ ત્રિપૃષ્ઠના લવમાં વિદારેલો સિંહ સુહંદ્ર નામે દેવ થયેલો તેણે ત્યાં આવી નાવને દુખાડવા ધણો પ્રયત્ન કર્યો, પરંતુ કંબળ ને શાંખળ નામના એ નાગકુમાર દેવે આવી એકે તેને હરાવીને

નસાજ્યો ને એકે નાવ જળીયું. એ ઉપરથિ મુક્ત થઈ પ્રભુ અને સર્વ સુખશાંતિથી કિનારે ઉત્તર્યા. કંબળશંખળદેવ પ્રભુને નમી, પુણ્યવૃષ્ટિ કરી સ્વસ્થાને ગયા. (એ કંબળ શંખળ દેવ કોણું હતા તેનું વર્ણન સુખોધિકારી જાણુવું.)

પ્રભુએ ત્યાંથી રાજગૃહી તરફ વિહાર કર્યો. ત્યાં નાલંદા પાડામાં એક વણુકરની શાળામાં ચાર માસખમણુ (મહિના મહિનાના ઉપવાસ) કરવાનો નિયમ કરી પ્રભુ ચાતુર્મસ રહ્યા. આ પ્રભુનું દીક્ષા પછીનું બીજું ચોમાસું જાણુવું.

પ્રથમ માસખમણુ વિજયશોઠને ત્યાં પારણું કર્યું. ત્યાં પંચ દિવિ પ્રગટ થયા. તે મંખલીપુત્ર ગોશાળે જેથા તેથી તેણું પ્રભુ પાસે આવીને કહ્યું કે-'હું તમારો શિષ્ય છું.' પ્રભુએ બીજ માસખમણુનું પારણું નંદશોઠને ત્યાં કર્યું. ત્રીજી માસખમણુનું પારણું સુનંદશોઠને ત્યાં કર્યું અને ચોથા માસખમણુનું પારણું કોલ્લાગ સંનિવેશમાં જઈ બહુલ નામના દ્વિજને લાં કર્યું. બધે પંચ દિવિ પ્રગટ થયા. ગોશાળો અહીંથી પ્રભુની સ્ત્રી થયો. પ્રભુએ સુવર્ણાખળ ગામ તરફ વિહાર કર્યો. ત્યાં ગોવાળીઆચોએ હૃધપાક કરવા એક હાંડલી ચૂલા પર મૂકી હતી. ગોશાળો હૃધપાકની લાલચે આંટા માર્યા કરતો હતો. સિદ્ધાર્થ કહ્યું કે-' એ હાંડલી લાંગી જવાની છે.' ગોવાળીએ ધ્રણી જળવી પણ કુરી ગઈ. તે જેઠ ગોશાળે નિર્ણય કર્યો કે-'જે બનવાતું હોય તે બને જ છે.' એ રીતે તે નિયતિવાદી થયો. પછી પ્રભુ પ્રાણાખુગામે ગયા. ત્યાં ગોશાળે તેને વાસી અજ આપનાર ઉપનંદનું ઘર પ્રભુના નામથી ખાળી નાખ્યું.

૧. ગોશાળાની ઉત્પત્તિ વગેરે સુખોધિકારી જાણુવું.

પ્રભુ ત્યાંથી ચંપાએ પધાર્યા અને ત્યાં એ દ્વિમાસી તપવડે (એ એ મહિનાના ઉપવાસવડે) બીજું ચોમાસું કર્યું.

બીજા દ્વિમાસી તપનું પારણું ચંપાની બહાર કરીને પ્રભુ કેટલાગ સન્નિવેશે પધાર્યા. ત્યાં શૂન્યગૃહમાં પ્રભુ કાચોતસર્ગે રહ્યા. અહીં એક રાજુપુત્રને તેની દાસી સાથે વિલાસ કરતો જોઈ ગોશાળે હાંસી કરી તેથી તેણે માર્યો. પ્રભુ પાસે આવીને ગોશાળો એલયો કે—‘મહારાજ ! મને આણે માર્યો તેનું નિવારણ આપે કેમ ન કર્યું ?’ સિદ્ધાર્થે કહ્યું કે—‘હું પછી આવું કરીશ નહીં.’ ત્યાંથી વિહાર કરી પ્રભુ પાત્રાલકે ગયા. ત્યાં પણ શૂન્ય-ગૃહમાં કાચોતસર્ગે રહ્યા. લાં પણ કોઈ રાજકુમારને દાસી સાથે વિલાસ કરતો જોઈ હાંસી કરવાથી ગોશાળે માર ખાધો. ત્યાંથી પ્રભુ કુમાર સન્નિવેશે પધાર્યા. ત્યાં ચંપરમણિય ઉદાનમાં કાચોતસર્ગે રહ્યા. તે અવસરે શ્રી પાર્શ્વનાથના સંતાનીયા મુનિ-ચંદ્રમુનિ કેટલાક પરિવાર સાથે ત્યાં પધાર્યા. તે મુનિઓને જોઈ ગોશાળે પૂછ્યું. ‘તમે કોણું છો ?’ તેમણે કહ્યું કે ‘અમે નિર્બંધ છીએ.’ ગોશાળો કહે કે ‘ક્યાં મારા ધર્મગુરુ ને ક્યાં તમે ?’ એટલે તે મુનિઓએ કહ્યું કે—‘જેવો તું છે તેવા તારા ધર્મગુરુ હશે.’ એટલે રોષ પામી ગોશાળે તેમનો ઉપાશ્રય બળી જવાનું કહ્યું. તેઓ એલયા કે—‘અમને તારી જેવાના કથનનો લય નથી.’ રાત્રે મુનિચંદ્ર મુનિ ઉપાશ્રયનો બહાર કાચોતસર્ગે રહ્યા હતા. તેને કોઈ કુલારે ચોરપણાની ઘુંઢિથી હણ્યા. મુનિ અવધિ-શાન પામીને સ્વર્ગે ગયા. હેવોએ તેનો મહેતસવ કર્યો. તેનો પ્રકાશ જોઈ ગોશાળો એલયો કે—‘મેં કહેલ તે ઉપાશ્રય બળે છે.’ સિદ્ધાર્થે રૂપે ખુલાસો કર્યો. ત્યાંથી પ્રભુ ચૌરાકગામે ગયા. ત્યાં

આ પરરાજ્યના ડેરક જણ્યાય છે એમ માની ગોશાળાને અને પ્રભુને લાકડાની હેડમાં નાખવા માંગ્યા. ગોશાળાને નાખ્યો તેવામાં ઉત્પળ નિમિત્તીયાની બહેન સોમા ને જ્યાંતિ સાધ્વીપણું ન પળવાથી તાપસી થઈ હતી તેણે ખંનેને મુક્ત કરાવ્યા. ત્યાંથી પ્રભુ પૃષ્ઠચંપાએ પધાર્યા. ત્યાં ચાર માસના ઉપવાસ (ચોમાસી તપ) કરી ચોથું ચોમાસું કર્યું. પારણું ચંપાની બહાર કર્યું.

ત્યાંથી પ્રભુ કાયંગળ સનિવેશો જઈને શ્રાવસ્તીએ પધાર્યા. નગરની બહાર કાચોત્સર્ગે રહ્યા. ત્યાં સિદ્ધાર્થ ગોશાળાને કહ્યું કે ‘આજે તને માંસ ચુક્ત આહાર મળશો.’ તે સાંભળી તે વણિકના ગૃહોમાં જ લિક્ષાર્થે ભમવા લાગ્યો. ત્યાં પિતૃદંત નામે એક વણિક રહેતો હતો. તેની સ્વી મૃતવત્તસા હતી. તેને એક નિમિત્તિયાએ કહ્યું હતું કે—‘હવે જે બાળક આવે તેનું માંસ ફૂધપાકમાં મેળવીને કોઈ લિક્ષુને આપવાથી તમારા બાળકે અચશો.’ તેણે તેમ કર્યું. ગોશાળાને તે ફૂધપાક આપ્યો. તે ખાઈને પ્રભુ પાસે આવ્યો. સિદ્ધાર્થ ફૂધપાકનું રહુસ્ય સમજાયું. તેણે ઉલ્લટી કરતાં તેમાં માંસના ખંડ જોયા તેથી તે વણિકનું ઘર બાળવા ગયો, પણ વણિકે તેના ભયથી બારણું ફેરવી નાખ્યું હતું. ગોશાળો ઘર ન જડવાથી પ્રભુના નામથી તે પાડો બાળી નાખ્યો. પ્રભુ ત્યાંથી દરિદ્ર નામના સનિવેશો આવ્યા. ત્યાં લોકોએ સળગા-વેદ અભિ પ્રભુના પગ સુધી આવ્યો. પ્રભુ અશ્યા નહીં તેથી પ્રભુના પગ ઢાઢી ગયા. ગોશાળો ભાગી ગયો. પ્રભુ ત્યાંથી મંગળા ગામે જઈ વાસુદેવના મંહિર પાસે કાચોત્સર્ગે રહ્યા. ત્યાં ગોશાળો બાળ-ક્રાને ષણીવરાવવા લાગ્યો. બાળકોના માબાપોએ તેને માર્યો. ત્યાંથી આવર્તાગમે આવી પ્રભુ બળદેવના મંહિર પાસે કાચોત્સર્ગે રહ્યા.

ત્યાં પણ ગોશાળો બાળકોને જીવરાવવા લાગ્યો એટલે તેના માખાપો તેને બદલે તેના શુરુને જ મારીએ એમ ધારી પ્રલુને મારવા હોડ્યા. તે વખતે બળદેવની મૂર્તિ જ હળ ઉપાડીને તેઓને મારવા દ્વારી એટલે સૌ પ્રલુને નમ્યા. પ્રલું ત્યાંથી ચોરાક સજીવેશે આંધ્યા. ત્યાં કોઈ મંડપમાં રસોએ થતી જોઇ ગોશાળો નીચેએ નમી નમીને જોવા લાગ્યો. તેને ચોર જાણીને મંડપવાળાઓએ માર્યો એટલે ગોશાળે તેનો મંડપ બાળી દીધો.

પ્રલું ત્યાંથી કલંખુકા ગામે ગયા. ત્યાં મેઘ ને કાળહસ્તિ નામે એ ભાઈ રહેતા હતા. તેમાં કાળહસ્તિએ પ્રલુને ઉપસર્ગ કર્યા ને મેઘે અમાંધ્યા. ત્યાંથી પ્રલું વધારે કર્મી અપાવવા માટે લાટ દેશમાં ગયા. ત્યાંના અનાર્ય લોકોએ અનેક પ્રકારના ઘોર ઉપસર્ગો કર્યાં. ત્યાંથી પૂર્ણુંકળશ નામના અનાર્ય ગામે ગયા. ત્યાં સામે એ ચોર મન્યા. તેઓ પ્રલુને જોઇ અપશુકન થયેલ માની પ્રલુને મારવા હોડ્યા. અવધિજ્ઞાનથી ઈદે તે હકીકત જાણી વળ્યવડે તેને હણું નામ્યા. પ્રલું ત્યાંથી લદ્રિકા નગરીએ પધાર્યાં. ત્યાં ચોર માસના ઉપવાસે પાંચમું ચોમાસું કરી, નગરી બહાર પારણું કર્યું. ત્યાંથી તંબાળથામે ગયા.

ત્યાં શ્રી પાર્થિનાથના સંતાનીએ નંદિષેણ મુનિ કેટલાક મુનિના પરિવાર સાથે આંધ્યા હતા. તેમને રાત્રે કાચોત્સર્ગમાં હતા ત્યારે ચોરની બુદ્ધિથી આરક્ષકના પુત્રે હણ્યા. તે મુનિ અવધિજ્ઞાન પામીને સ્વર્ગ ગયા. દેવોએ તેનો મહિમા કર્યો. અહીં ગોશાળાની હકીકત પૂર્વે મુનિચંદ્ર મુનિ માટે કહી છે તે પ્રમાણે સમજવી. ત્યાંથી પ્રલું કુંપિકથામે ગયા. ત્યાં તેમને ન ગોશાળાને હેરક જાણીને આરક્ષકે બાંધવા માંધ્યા તેને

પાર્કનાથની પરિવ્રાજિકા થયેલી સાધ્વી વિજયા ને પ્રગતભાએ છોડાવ્યા. ગોશાળો અહીંથી છૂટો પડ્યો. તેને ૫૦૦ ચોરે મખ્યા. તેમણે ‘મામો મામો’ કહી તેને ખલે ચડીને છોડાવ્યો, એટલે કાયર થધને પ્રલુને શોધતો વૈશાલીમાં આવ્યો. પ્રલુનું ત્યાં આવી એક લુહારની શાળામાં કાચોત્સર્ગે રહ્યા. લુહાર છ માસની માંદળી લોગવી તે દિવસે જ તેની શાળામાં આવ્યો. તે પ્રલુને જોઈ અપશુકન થયેલ જાણી ધણું લઈને મારવા હોડ્યો. અવધિજ્ઞાનથી ઈંડે તે હકીકત જાણી તેને વજાવડે હુણ્યો. પ્રલુનું ત્યાંથી આમાં સજીવેશો ગયા. ત્યાં ખીલેલક યક્ષે પ્રલુને મહિમા કર્યો. ત્યાંથી શાળીશીર્ષ ગામે જઈ ઉધાનમાં કાચોત્સર્ગે રહ્યા. તે વખતે ત્રિપુષ્ટના ભવમાં અપમાનિત કરેલી રાણી કુટ્પૂતના નામે વ્યાંતરી થઈ હતી. તેણે તાપસીનો વેશ કરી, જટામાં પાણી ભરી તેને પ્રલુનું ઉપર જોરથી છાંટવાવડે અસંશોધિત ઉપસર્ગ કર્યો. પ્રલુને શાંત રહેલ જોઈને તે નમસ્કાર કરી દૃષ્ટિ કરવા લાગી. અહીં પ્રલુને છફુના તપવડે આ ઉપસર્ગ સહેતાં લોકાવધિ જ્ઞાન ઉત્પજ્ઞ થયું. પ્રલુને ત્યાંથી અદ્રિકા-નગરીએ આવી ચાર માસના ઉપવાસવડે છહું ચોમાસું કર્યું.

નગરણહાર પારણું કરી વિહાર કર્યો, અહીં પ્રલુને અનેક પ્રકારના અલિથ્રણો કર્યાં. ત્યાંથી મગધહેશ વિગેરેમાં ઉપસર્ગ રહિતપણે વિહાર કર્યો. પ્રાંતે આલાંલિકામાં આવી સાતમું ચોમાસું ચાર માસના ઉપવાસવડે કર્યું. નગર બહાર પારણું કર્યું.

ત્યાંથી વિહાર કરી ઝુડિક થામે આવી વાસુદેવના ચૈત્યમાં કાચોત્સર્ગે રહ્યા. ત્યાં ગોશાળો વાસુદેવની મૂર્તિને પુંડ કરીને ઉલ્લો રહ્યો. તે જોઈ લોકોએ તેને માર્યો. પ્રલુનું ત્યાંથી મર્દન

આમે ગયા અને બળહેવના ચૈત્યમાં કાચોત્સરો રહ્યા. ત્યાં પણું બળહેવની મૂર્તિ સામે કુચેષા કરવાથી લોકોએ ગોશાળાને માર્યો. અને સ્થાને મુનિ જાણીને તેને છોડી દીધેા. ત્યાંથી પ્રભુ ઉજ્ઞાગથામે ગયા. ત્યાં માર્ગમાં સામે આવતાં દંતુર વરવધૂને જેઈને ગોશાળો હસ્યો. અને ‘વિધાતાએ પણ લલી જેડ મેળવી છે’ એમ કહ્યું. તે સંલગ્ની વરવાળાએ તેને પકડી મારીને વાંસની જાળમાં નાંખી દીધેા. પછી પાછી દયા આવવાથી આ મહા-પુરુષનો છત્રધર હશે એમ જાણી છોડી મૂક્યો. ત્યાંથી રાજ-ગૃહીમાં જઈને પ્રભુએ ચોમાસી તપવડે આડમું ચોમાસું કર્યું.

પારણું રાજગૃહીની ણહાર કરીને ઘણું ઉપસરો થવાનો સંલબ માની વજાભૂમિમાં ગયા અને ત્યાં ઉપસરો સહન કરવા સાથે નવમું ચોમાસું પણ ચોમાસી તપથી વજાભૂમિમાં જ કર્યું. પરંતુ ત્યાં ચોમાસું રહેવાના સ્થાનનો અલાવ હોવાથી અનિયતપણે કર્યું.

ચોમાસા બાદ પણ એ માસ ત્યાં રહ્યા. પછી કૂર્માંતરક જતાં માર્ગમાં એક તલનો છોડ જેઈ ગોશાળો પ્રભુને પૂછ્યું કે ‘આ છોડ ઉગશે કે નહીં?’ પ્રભુએ કહ્યું કે ‘તેમાં રહેલા પુણના સાત જીવો ચ્યાવીને તલપણે ઉપજશે.’ પ્રભુનું કહેલું ગોટું પાડવા ગોશાળો તે છોડ ઉઝેડીને ફેંકી દીધેા. નાણકમાં રહેલા ચ્યાવીને પ્રભુનું વચન સાચું પાડવા જળવૃષ્ટિ કરી, તેથી આદ્ર થયેલી ભૂમિમાં ગાયની ખરીથી તે છોડ ચંપાણો. પ્રભુ ત્યાંથી કૂર્માંતરે ગયા. ત્યાં વૈશાયન તાપસ જટા છૂટી મૂકીને આતાપના લેતો હતો. તેની જટામાં પુષ્કળ જૂઓ. જેઈને ‘જૂનું સથ્યાતર, જૂનું સથ્યાતર’ એમ વારંવાર કહીને ગોશાળો તેની નિષ્ઠાંછના

કરવા લાગ્યો. તે સાંલળીને કોપાયમાન થવાથી તાપસે ગોશાળા ઉપર તેજેલેશ્યા મૂકી. કરુણાસાગર પ્રભુએ કરુણા લાવી શીતલેશ્યાવડે તેને બચાવ્યો. તે વખતે તીવ્ર તાપ સમી તેજેલેશ્યા જોઈને ગોશાળે પ્રભુને તેજેલેશ્યા કેમ પ્રાસ થાય? એવું પૂછ્યું. લાવીલાવ બળવાન હોવાથી સર્વને ફૂધ પાવાની જેમ પ્રભુએ મહાઅનર્થકારી તેજેલેશ્યાની ઉત્પત્તિ કેમ થાય? તે આ પ્રમાણે બતાવ્યું:—

‘હંમેશાં આતાપના લેવાપૂર્વક છઠુનો તપ કરવો. પારણે એક સુઠી અડદના ભાકળા ને અંજલીપૂરતું ઉત્તું પાણી લેવું. એવી રીતે કરવાથી છ મહિનાને અંતે તેજેલેશ્યા પ્રાસ થાય છે.’

ત્યાંથી પ્રભુ સિદ્ધાર્થ આમે જતાં માર્ગમાં ‘પેદો તલનો છોડ જાગ્યો છે કે નહીં?’ એમ ગોશાળે પૂછ્યું. સિદ્ધાર્થ જગ્યાનું કહ્યું એટલે તેણે તે છોડ ઉઘેડી શાંગ હેડી, તો તેમાં સાત તલ ઉપજેલા જેયા એટલે ‘તે જ શરીરમાં જીવ ઇરીને ઉપજે છે’ એમ ગોશાળે નિરધાર કર્યો. અહીંથી ગોશાળો પ્રભુથી છુટો પહ્યો અને શ્રાવસ્તિએ જઈ એક કુલારનો શાળામાં છ માસ સુધી રહી પ્રભુએ કહેલા વિધિ પ્રમાણે તેજેલેશ્યા સિદ્ધ કરી. પછી પાર્શ્વનાથ પ્રભુના ક્રત તળુ દીધેલા શિષ્યો પાસેથી અણાંગ નિમિત શીજ્યો. એટલે અહીંકારથી લર્પુર થવાને લીધે ‘હું સર્વજ્ઞ છું’ એમ કહેવા લાગ્યો. પ્રભુએ શ્રાવસ્તિ પધારી દશમું ચ્યામાસું ચ્યામાસી તપવડે ત્યાં કર્યું.

અનેક પ્રકારના અલિથહયુક્તા તપ કરતા પ્રભુ ત્યાંથી ઘણ્યા મ્લેચ્છાવાળી દઠભૂમિમાં ગયા. ત્યાં પેઢાળ ગામની અહાર પોવાસ યક્ષના ચૈત્યમાં પ્રભુ અષ્ટમભક્તા કરીને ત્રીજે દિવસે એક

રાત્રિકી પડિમાચે કાચોત્સર્ગ ધ્યાને રહ્યા. તે વખતે સૌધર્મેંદ્રે સલામાં આવીને કહ્યું કે—‘ત્રણ લોકમાં કોઈ એવો સમર્થ નથી કે જે વીરપ્રભુને ધ્યાનમાંથી ચલાયમાન કરે.’ આવી પ્રશંસા સાંભળી તેને નહીં સફાતા સંગમ નામના ઈદ્રના સામાનિક હેવે ઈદ્ર સમક્ષ આવીને પ્રતિજ્ઞા કરી કે—‘હું એક ક્ષણુમાત્રમાં તેમને ચલાયમાન કરીશ.’ આમ કહીને પ્રભુ પાસે આવી તેણે અનેક પ્રકારના અસદ્ય ઉપસર્ગો કર્યાં. તેનું વર્ણન સુષેધિકા વિગેરથી જાણું. આ દરેક ઉપસર્ગ પ્રાણુંત કરે તેવા હતા. તેનું વર્ણન વાંચતા હૃદય કંપી ઉઠે તેમ છે. છેવટે તેણે હન્જરલારનું ચક જાયેથી પ્રભુ ઉપર એવી રીતે મૂક્યું કે જેથી પ્રભુ ગોઢણે સુધી જમીનમાં ચેસી ગયા. આ ચક મેરુપર્વતને પણ ચૂર્ણું કરે તેલું હતું. આવી રીતે એક રાત્રિમાં વીશ મોટા ઉપસર્ગો કર્યાં. છેવટ અનુકૂળ ઉપસર્ગ પણ કર્યાં. પ્રાતઃકાળે પ્રભુ આહાર લેવા નીકળ્યા, પરંતુ સંગમહેવે છ માસ પર્યંત શુદ્ધ આહાર મળવા દીધો નહીં. છ માસને અંતે સંગમ ગયો હશે એમ જાણી પ્રભુ એક ગોકુળમાં વહેલારવા ગયા. ત્યાં પણ અશુદ્ધ આહાર કરી દીધેલો જાણી પ્રભુ પાછા ફર્યા. પછી સંગમ પોતાના અવધિજ્ઞાનથી પ્રભુને નિશ્ચિળ જાણીને ઈદ્રના ડરથી પ્રભુને નભી, ખમાવીને હેવલોકમાં ગયો. ત્યારપછી પ્રભુએ એક વૃદ્ધ ડોરીના હાથ ક્ષીરાનથી છ માસ તપનું પારણું કર્યું:

સંગમ પ્રતિજ્ઞાભૂષ થવાથી શ્યામમુખવાળો થયો સતો સૌધર્મ હેવલોકમાં આવ્યો. એના ઉપસર્ગના છ માસ પર્યંત સૌધર્મેંદ્ર અને તમામ હેવહેવીએ શોકબ્રસ્ત રહ્યા હતા. ઈદ્રે આ ઉપસર્ગના કારણુભૂત પોતાને જાણીને બહુ ભિજીપણે ગાનતાન તમામ બંધ કરાયું હતું. સંગમને આવતો જેઇ ઈદ્રે હેવેને

કહું કે—‘અરે હેવો ! આ મહાપાપી કર્મચંડાળ અહો આવે છે, તેનું સુખ જેવાથી પણ પાપ લાગે તેમ છે, તેથી એને અહોથી કાઢી મૂકો. તે મારાથી ઉર્યો નહીં પણ પાપથી એ ઉર્યો નહીં’ એમ કહી પોતે પરાહસુખ થઈને રહ્યા. હેવોએ તેને લાકડી વિણેરેના મારથી હેરાન કરી કાઢી મૂક્યો. તે ત્યાંથી હડકાયા હૃતરાની જેમ નાશીને મેરુપર્વતની ચૂંઝિકા પર ગયો. ત્યાં બાકી રહેલું એક સાગરોપમનું આયુષ્ય પૂરું કરશે. તેની અથમહિષીએ ઈદ્રની આજા મેળવીને ખીજવદને તેની પાસે જઈને રહી.

આ ઉપસર્ગની હુકીકત જાણીને અનેક દ્યદ્રો પ્રભુને સાતા પૂછવા જુદે જુદે રથણે આવી ગયા. કેટલાક રાજુએ પણ સાતા પૂછવા આંદ્રા. પ્રભુ ત્યાંથી વિહાર કરી વિશાળ પધાર્યા. ત્યાં અણયારમું ચૌમાસું ચૌમાસી તપવડે કર્યું.

ત્યાંથી પ્રભુ સુસમારપુરે આંદ્રા. ત્યાં ચમરેદ્રને ઉત્પાત થયો. તેની હુકીકત દ્રશ અછેરાના વર્ણનમાંથી જાણવી.

પ્રભુ ત્યાંથી વિહાર કરીને કૌશાંખી નગરીએ પધાર્યા. ત્યાં શતાનીક નામે રાજ હતો. તેને મૃગાવતી નામે રાણી હતી. ત્યાં પ્રભુએ એવો અલિથહ પોષ શુદ્ધ ૧ મે કર્યો કે—‘દ્વારથી અડહના બાકુળા સુપડાના ખૂણામાં રહેલા હોય, ક્ષેત્રથી આપનારનો એક પગ ઉંખરાની બહાર હોય ને એક પગ ઉંખરામાં હોય, કાળથી સર્વ લિક્ષાચરે આવી ગયા હોય, ભાવું મુંડવેલું હોય, પગમાં એડી હોય, ત્રણ દ્વિવસના ઉપવાસ થયા હોય ને રૂદ્ધન કરતી હોય—એવી સ્વી આપે તો આહાર અહણ કરવો.’ એ વખતે શતાનીક રાજુએ

ચંપાનગરી ભાંગી; ત્યાંના દધિવાહન રાજની રાણી ધારિણી ને પુત્રી વસુમતી એક સુલટના હાથે કેદ પકડાયું. સુલટે માર્ગમાં ધારિણીને પોતાની સ્ત્રી કરવાનું કહેવાથી તે તો જુબ કરડીને મરણ પામી. વસુમતિને સુલટે કોચંખીમાં લાવીને વેચી. તેને ધનાવહ શેડ લઈ ગયા. તેણે ચંદના નામ આપીને પુત્રીપણે રાખી. શેડને તે બહુ પ્રિય થઈ પડી. તે જેઠને શેડની સ્ત્રી મૂલાએ વિચાર્યું કે—‘જરૂર શેડ એને પરણુશે ને એ આ ધરની સ્વામીનિ થશે, માટે તે રોગને મૂળમાંથી ડંસી ફડિ.’ એમ વિચારી શેડ બહારગામ ગયેલા તેવે વખતે ચંદનાનું માથું સુંડાવી, પગમાં એડી નાંખી, એક ઓરડામાં પૂરી, તાળું દઈને તે કયાંક ચાલી ગઈ. બીજે દિવસે શેડ આવ્યા. તેને મહાસુશીબતે ચોથે દિવસે ચંદનાની ભાળ મળી. એટલે તેમણે ઓરડે ઉઘડાવી ચંદનાને બહાર કાઢી. તે ત્રણું દિવસની બૂધી હોવાથી સુપડાના ખૂણામાં અડદના ખાકુળા આપીને શેડ એડી તોડાવવા માટે લુહારને તેડવા ગયા. અહીં પાછળથી વીરપ્રભુ પધાર્યા. ચંદના રાહ જેતી હતી કે ‘કોઈ લિક્ષુ આવે તો તેને આપીને પણી ખાડિ.’ વીરપ્રભુનો અલિથહ છ માસ થવા આવ્યા છતાં પૂરાણો નહોતો. તેમણે પોતાના અલિથહ પ્રમાણે બધું જોયું, પણ માત્ર આંખમાં આંસુ નહોતા તેથી પ્રભુ પાછા વખ્યા. તે જેઠ ચંદના બહુ દિવાંગીર થઈ ને આંખમાં આંસુ આવ્યા, એટલે પ્રભુ અલિથહ પૂરો થચેલો જેઠ પાછા વખ્યા ને ચંદનાને હાથે અડદના ખાકુળા વહોરી પાંચ દિવસ ન્યૂન છમાસી તપનું પારણું ત્યાં જ કર્યું. તે વખતે પાંચ દિવસ પ્રગટ થયા. મસ્તકે કેશ આવી ગયા. એડી કુટી ગઈ ને અંગર થયા. ધનાવહ શેડ પણ ત્યાં આવ્યા. આ હકીકત

નોઈને બહુ રાજુ થયા. ઈંદ્ર આવ્યા. દેવો આવીને નાચવા લાગ્યા. મૃગાવતી રાણી આવ્યા, તેણે ચંદનાને ઓળખી. તે પણ માસીને મળી. પાંચ દિવયમાં વસુધારામાં આવેલું દ્રોય શતાનીક રાજને લઈ જવા માંડયું, પણ ચંદનાના કહેવાથી તે ધન ધનાવહ શોઠને આપી ‘ચંદના પ્રભુની પ્રથમ સાધ્વી થશે’ એમ કહી ઈંદ્ર સ્વસ્થાને ગયા.

મૃગાવતી ચંદનાને પોતાની સાથે રાજમહેલમાં લઈ ગઈ. ધનાવહ શોઠે મૂળા શોઠાણીને કાઢી મૂકી. (અન્યત્ર કહ્યું છે કે તેણે આવીને ચંદનાને ખમાવી. ચંદનાને કહ્યું કે ‘મારી ખરી માતા તો તમે છો. તમે જે મને કષ આપ્યું ન હોત તો મને વીરપ્રભુને પારણું કરાવવાનો પ્રસંગ ક્યાંથી પ્રાપ્ત થાત ? માટે તમે તો મારા ઉપગારી છો.’ સજજનો તો શુણ્યનું જ થહુણું કરે છે.)

પ્રભુ ત્યાંથી વિહાર કરી ચંપાનગરીમાં આવ્યા. ત્યાં સ્વાતિદત્ત પ્રાક્ષણુની અગ્નિશાળામાં ચાર માસનાં ઉપવાસ કરીને ખારમું^૧ ચોમાસું કર્યું. તે પ્રાક્ષણુને પ્રભુ સાથે ઈદ્રિયોને અગોચર આત્મતત્ત્વ સંબંધી સૂક્ષ્મ વિચારને અંગે ધણો વાર્તાવાપ થયો, તેથી તે પ્રાક્ષણુ પ્રસન્ન થયો. અને પ્રભુનું બહુમાન કર્યું.

ત્યાંથી પ્રભુ જૂલિક ગામે ગયા. ત્યાં ઈંદ્રે પ્રભુને નાથ્યવિધિ અતાવી અને ‘અમુક દિવસે પ્રભુને કેવળજ્ઞાન થશે’ એમ કહી સ્વસ્થાને ગયા. ત્યાંથી પ્રભુ મેઠિકામે ગયા. ત્યાં ચમરેંદ્ર સાતા પૂછી ગયા.

ત્યાંથી પ્રભુ પણમાની ગામે આવ્યા. ત્યાં ગામની બહાર કાચોટસર્જો રહ્યા. એક ગોવાળીએ પોતાના ખળહો તેમની પાસે

૧. આ ચોમાસાની હકીકત સુખેાધિકામાં જણ્ણાતી નથી, કદ્યકિરણાવળીમાં છે.

મૂકી ગામમાં ગયો. પાછો આવી ‘મારા બળદો કયાં ગયા ?’ એમ પ્રલુને પૂછ્યું. પ્રલુ તો મૌન હતા એટલે જવાબ ન મળવાથી તે બહુ શુસ્તે થયો, તેથી તેણું પ્રલુના કાનમાં વાંસની અણીદાર એ સળીએ. એવા જેરથી નાખી કે ઐની અણી અંદર ભળી ગઈ. પછી બહારથી કોઈ ન હેણે માટે બહારનો લાગ કાપી નાખ્યો. વીરપ્રલુના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના લવમાં શય્યાપાલકના કાનમાં સીસું રેડાંયું હતું તે કર્મ અહો ઉદ્ઘયમાં આંયું. શય્યાપાળક અનેક લવ પછી ગોવાળીએ થયો હતો. પ્રલુ તો તે ઉપસર્ગ સમ્બંધ પ્રકારે સહન કરી મધ્યમ અપા-પામાં આવ્યા. ત્યાં સિદ્ધાર્થ નામના વણિકને ઘેર પ્રલુ લિક્ષા માટે પદ્ધાર્યા. તેને જેઠ પાસે એઢેલા ઘરકે નામના વૈહે પ્રલુને શલ્ય સહિત જાણ્યા. તપાસ કરતાં કાનમાં શલ્ય છે એમ ખાત્રી કરી. પ્રલુ તો ઉધાનમાં ગયા, એટલે તે વૈધ ને વણિક બંને મજબૂત એ સાણુસી લઈને ત્યાં આવ્યા અને પૂરા જેરથી તે સળીએ. એંચી કાઢી. તે વખતે પ્રલુ અનંતખળી છતાં ચીસ પડાઈ ગઈ. તે ચીસથી આખું ઉધાન ખળખળી જાઠયું. પછી પ્રણસંરાહિણી ઔષધિવડે તે પ્રણુને ઝાંઝયું. તે બંને સહગતિગામી થયા. ગોવાળીએ ભરણું પામીને સાતમી નરકે ગયો. એ રીતે પ્રલુને ઉપસર્ગો ગોવાળીયાથી શરૂ થયા અને ગોવાળીયાથી પૂર્ણ થયા.

એ ઉપસર્ગોમાં જધન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ એવો વિલાગ છે. જધન્યમાં ઉત્કૃષ્ટ કટપૂતના વ્યંતરીનેં શીત ઉપસર્ગ છે, મધ્યમમાં ઉત્કૃષ્ટ સંગમે મૂકેલું હન્દાર લારનું ચક છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કાનમાંથી ખીલા એંચવાનો સમજવાનો છે. ઉપર જણુાવેલા ઉપસર્ગો તો મોટા સમજવા, તે સિવાય ખીલા નાના ઉપસર્ગો તો અનેક થયા છે.

આ વખતે પ્રલુ કેવા શુણુવાનુ થયા તેનું વર્ણન ધણું વિસ્તારથી સુખોધિકા વિગેરેમાં આપ્યું છે તે ત્યાંથી જાણી લેવું.

પ્રલુ લાંથી વિચરતા વિચરતા તેરમા વર્ષના મધ્યમાં જૃંલિક આમે આવી કડજુવાલિકા નહીને કિનારે શ્યામાક કુદુંભીના ક્ષેત્રમાં જળરહિત છુટું તપ કરીને કાચોત્સર્ગમુદ્રાએ રહ્યા. શુક્લધ્યાનના મધ્યમાં (ખોલે પાયે) વર્તતા પ્રલુને વૈશાક શુદ્ધ ૧૦ મે ઉત્તરાક્ષાલગુની નક્ષત્રને ચંદ્ર સાથે ચોગ થયે સતે ચાર ઘાતીકર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ત્રણ ભુવનમાં ઉદ્ઘોત થયો. પ્રલુને કેવળજ્ઞાન થતાં સર્વ ઈંદ્રોના આસન કર્યા. ચારે નીકાયના દેવોએ આવીને સમવસરણ રહ્યું. પ્રલુએ દેશના આપી, પરંતુ કોઈએ ચારિત્રિકર્મ ન સ્વીકારવાથી દેશના નિષ્કળ ગાઠ. ત્યાંથી રાત્રે જ વિહાર કરીને પ્રલુ મધ્યમ અપાપાએ પદ્ધાર્યો. ત્યાં દેવોએ સમવસરણ રહ્યું, પ્રલુએ દેશના આપી અને ઈંદ્રભૂતિ આહે ૧૧ મુનિને ગણુધર પહ્યી આપી. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી.

મહાવીર પરમાત્માને કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટ થયું તે વખતે તેઓ ત્રણ લોકમાં રહેલા સર્વ પદ્ધાર્યોના ત્રણે કાળ સંબંધી સર્વ લાવ પ્રત્યેક સમયે જાણુવા લાગ્યા. તહુપરાંત સર્વે જીવોની ગતિ-ચારે ગતિના જીવો કયાં કયાં જાય તે, તથા આગતિ-ચારે ગતિમાં કયાં કયાંથી આવીને જીવ ઉપજે તે, સ્થિતિ-દરેક જીતિના જીવનું એક લખનું આચુણ્ય તે જીવસ્થિતિ અને તે જીતિમાં કેટલા કાળ સુધી ઉપરાઉપર ઉપજે તે કાયસ્થિતિ તેને જાણે. મનમાં ચિંતવેલું તેમ જ શરીરવડે કરેલું જાણે. છાનું કયું હોય કે પ્રગટ કયું હોય તે સર્વ જાણે. આધેલું

તેમ જ અન્ય ઈંદ્રિયોવડે સેવેલું જણે. વાચ્ય-કહેવા યોગ્ય ને અવાચ્ય-ન કહેવા યોગ્ય તે સર્વ જણે. રૂપી ને આરૂપી સર્વ પદાર્થના સર્વ ભાવ જણે. સર્વ દ્રોગોના અનંતા પર્યાયો પ્રત્યેક સમયે જણે. આ બધા જાણુપણુમાંથી કથનદ્વારા તો વાચ્ય પદાર્થનો અથવા કહેવા યોગ્ય લાવેનો અનંતમો ભાગ જ કહી શકે; કારણું કે આચુ પરિમિત ને વચ્ચન તો ક્રમસર નીકળે, તેથી વધારે કહી શકે નહીં, એ વાત સિદ્ધ થાય છે. અનંતા તીર્થ-કરે. મળીને કહી શકતા હોવાથી તે ભાવે વાચ્ય કહેવાય છે. પ્રભુના ગુણ કહેવાના સંબંધમાં પણ કહું છે કે:—

યુણ અનંતાનંત છે, વાચ ક્રમ ભિત દિદ્ધ;
બુદ્ધિ રહિત શક્તિ વિકળ, ક્રેમ કહું એકણ જીહ ? ૧.

“હે પ્રભુ ! તમારા ગુણો તો અનંતાનંત છે, તે કહેવા હું ઈચ્છું છું, પરંતુ વાણી તો ક્રમથી બોલી શકે છે, બોલવાના દિવસો પણ પરિમિત છે, હું ઉચ્ચ પ્રકારની બુદ્ધિ વિનાનો છું તેમજ કોઈ અપૂર્વ શક્તિવાળો પણ નથી, તો તે સર્વ ગુણો એક જીહે ક્રેમ કહી શકું ? ”

જાણવા હેખવાના સંબંધમાં તીર્થ-કર કે સામાન્ય કેવળીમાં કાંઈપણ એઠાવત્તાપણું નથી. તીર્થ-કર માટે આઠ પ્રાતિહાર્ય, ૩૪ અતિશય અને ૩૫ ગુણયુક્ત વાણી એ વિશેષ છે.

આ પછીના કેવળીપણુના ૩૦ ચોમાસાનું સંક્ષિપ્ત વર્ણન આ ખુકના પ્રારંભના ૨૫ પૃષ્ઠમાં આપ્યું છે ત્યાંથી જાણી લેવું.



પ્રભુએ છજીસ્થપણુના બાર વર્ષો ને સાડા છ માસમાં
કરેલા તપનું વર્ણન નીચે પ્રમાણે :—

તપ સંખ્યા.	માસ.	દિવસ.
૧ છ માસી	૬	૦
૧ છ માસમાં પાંચ દિવસ જીણુ	૫	૨૫
૮ અઉ માસી	૩૬	૦
૨ ત્રણુ માસી	૬	૦
૨ અઠી માસી	૫	૦
૬ એ માસી	૧૨	૦
૨ હોઠ માસી	૩	૦
૧૨ માસખમણુ	૧૨	૦
૭૨ પાસખમણુ (૧૫ દિવસના ઉપવાસ)	૩૬	૦
૧ લદ્દ, મહાલદ્દ ને સર્વતોલદ્દ પ્રતિમા એક સાથે કરી તેના દિવસ ૨-૪-૧૦	૦	૧૬
૧૨ અહુમ (ત્રણુ ઉપવાસ)	૧	૬
૨૨૬ છટુ (એ ઉપવાસ) (૪૫૮ દિવસ)	૧૫	૮
૧ દીક્ષાનેા દિવસ	૦	૧
<hr/> ૩૫૦	<hr/> ૧૩૮ — ૨૬	

પારણુના દિવસ ૩૪૬. ૧૧ — ૧૬

(કુલ માસ ૧૫૦॥ના વર્ષ ૧૨ ને માસ ૬॥) ૧૪૬ — ૪૫

કાર્તિક વદિ ૧૦ મે પ્રલુચે દીક્ષા લીધી અને વૈશાહ્ય
શુદ્ધ ૧૦ મે કેવળજ્ઞાન પામવાથી વર્ષ ૧૨ ને માસ દાંબ
થાય છે. તપ્ય ૩૫૦ ને પારણું ૩૪૬ હોવાતું કારણું કેવળજ્ઞાનના
છકું તપાતું પારણું આમાં ગણ્યાતું નથી તે છે.



ઉપસગોનો ક્રમ.

- ૧ ગોવાળીઆનો (ખળદ મૂકી જનારનો), તે ઈદ્રે નિવાર્યો.
- ૨ શૂળપાણી યક્ષનો (અસ્થિકાભારો), તેણે અનેક ઉપસગોં કર્યાં.
- ૩ ચંડકૌશિક સર્વનો (પ્રલુને પગે ડશ્યો)
- ૪ સુંદર્ભ હેવનો (ગંગામાં નાવ દુખાડવાનો) તે કંખળ
શાંખળ નામના નાગકુમાર હેવે નિવાર્યો.
- ૫ કટપૂતના વ્યંતરીએ કરેલા અસદ્ય શીત ઉપસગ.
- ૬ સંગમહેવે કરેલા ઘોર ઉપસગો (તેમાં ૨૦ મોટા)
- ૭ ગોવાળીઆએ કાનના ઝીલા નાખ્યાનો. તે કાઢતાં ધાણી
વ્યથા થઈ તેથી ઝીલા કાઢવાનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગણ્યાય છે.
ઝીલ નાના અનેક ઉપસગો જાણુવા.
- ૮ ગોશાળાનો. તેનેલેશ્યા પ્રલુની ઉપર મૂકવાર્દ્ય ઘોર
ઉપસગ. (આ કેવળજ્ઞાન પામ્યા પણી થયો છે.)
- ૯ પ્રલુના પગ ઉપર ગોવાળોએ ઝીર રાંધ્યાનો ઉપસગ પંચ-
કલ્યાણુકના સ્તવનમાં કદ્યો છે, પણ સુષ્ણોધિકામાં જણ્યાતો
નથી. (એને લગતો ઉપસગ સંગમના કરેલા ૨૦ ઉપસગોમાં
૧૪ મો છે. તેમાં પ્રલુના એ પગ વચ્ચે અર્દિન સણગાવીને
સાર્થી રસોધ કરી છે.)



શ્રી મહાવીર પરમાત્માના ગૃહસ્થપણુના

૩૦ વર્ષનું સંક્ષિપ્ત ચરિત્ર.

શ્રી મહાવીર પરમાત્માનું ચરિત્ર વિસ્તારપૂર્વક ત્રિષ્ઠી શલાકા પુરુષ ચરિત્રના પર્વ હશમામાં તેમ જ કદ્વપસૂત્ર સુષોધિકા ટીકા વગેરેમાં આવે છે. તેમાંથી ઉદ્ધરીને દીક્ષાપર્યાયના ૪૨ વર્ષના વિહૃતરતું વર્ષન ફક્ત સર ચોમાસાના સ્થળ સાથે આ ખુકના પ્રારંભમાં આપ્યું છે, તેથી બાકીના ગૃહસ્થપણુના ૩૦ વર્ષનું ચરિત્ર પણ સંક્ષિપ્ત આ નીચે આપ્યું છે, જેથી આ ખુક શ્રી મહાવીરસ્વામીના સંક્ષિપ્ત જીવનચરિત્ર તરીકે ગણી શકાશે.

શ્રી મહાવીરસ્વામીના ૨૭ અવો પૈકી ખાસ ધ્યાન આપવા લાયક ત્રીજો લવ ભરિયીનો છે કે જેમાં તેમણે નીચગોત્ર ખાંધ્યું. પછી ૧૮ મેા ત્રિપૃષ્ઠ વાસુદેવનો લવ છે કે જેમાં અનેક પ્રકારના અશુદ્ધ કર્મો ખાંધ્યા. બાદ ૨૫ મેા નંદનમુનિનો લવ છે કે જેમાં લાળા વર્ષ પર્યાત સતત માસખમણુની તપસ્યા કરી અને તીર્થ્યા કરનામકર્મ નીકાર્યીત કર્યું.

વીરપ્રભુ છેદ્વા ૨૭ મા લવમાં પ્રાણુત નામના દશમા દેવલોકથી ચ્યવી ખાંધણુંકુડ થામે ઋષભદત ખાંધણુને ત્યાં દેવાનંદાની કુદ્ધીમાં અશાડ શુદ્ધ રૂપે ઉત્પજ્ઞ થયા. માતાએ ૧૪ સ્વર્ણો જેયા. ઋષભદતે તેનું કુળ કલ્યું કે-'તમને અતિ ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે.' આ હકીકતને ૮૨ રત્ન વ્યતીત થતાં, સૌધર્મેન્દ્રે ભરતકોત્ર તરફ ઉપર્યોગ દ્વિતીને જેયું તો વીર પ્રભુના જીવને દેવાનંદાની કુદ્ધીમાં ઉત્પજ્ઞ થયેલ જેયો. એટલે

તે હકીકત અધિટિત જાણી હરિનૈગમેણી દેવને મોકલી તે ગર્ભ
ક્ષત્રિયકુડ આમે સિદ્ધાર્થ રાજની રાણી ત્રિશલા માતાની
કુલ્લામાં મૂકાવ્યો. ત્રિશલા માતાએ ૧૪ સ્વમ જોયા. સ્વૈન-
પાઠકોએ તેના ઝળ કહ્યા. અનુકમે દોહલા પૂરતાં ગર્ભ વૃદ્ધિ
પામ્યો. અને ચૈત્ર શુહિ ૧૩ શે પ્રબુનો જન્મ થયો.

પ્રબુનું પ્રસ્તુતિકાર્ય કરવા પર દિશાકુમારિકાએ આવી. ત્યારપછી સૌધમેન્દ્ર માતા પાસે આવી પાંચ રૂપ કરી પ્રબુને
મેરુપર્વત પર લઈ ગયા. ત્યાં બધા ઈન્દ્રાદિકે મળી પ્રબુને
જન્મોત્સવ કર્યો. પછી સૌધમેન્દ્ર પ્રબુને ત્રિશલા માતા પાસે મૂકી
ગયા. પ્રાતઃકાળે સિદ્ધાર્થ રાજએ જન્મોત્સવ કર્યો અને
ખારમે દિવસે પ્રબુનું વર્ધમાન નામ પાડ્યું.

પ્રબુ આમલકી કીડા કરવા ગયા. ત્યાં એક દેવે આવી
પ્રબુના ખળની પરીક્ષા કરી અને પ્રબુને અતુલ ખળી જાણી
મહાવીર નામ આપી સ્વસ્થાને ગયો. પ્રબુ આડ વર્ષના
થતાં માતાપિતાએ નિશાળે મૂકવાનો મહેત્સવ કર્યો. પ્રબુ તો
જન્મથી ત્રણ જ્ઞાનયુક્ત હતા એટલે ગુરુ થનાર અદ્યાપકના
સંશોધને ફૂર કર્યા. પ્રબુ યોવનવય પામતાં માતાપિતાએ
યશોદા રાજપુત્રી સાથે પરણ્યાંયા. તેને સુદર્શના નામે પુત્રી
થઈ. તેને સુદર્શનાના પુત્ર જમાલિ સાથે પરણ્યાવી. પ્રબુને
નંદીવર્ધન નામે મોટા ભાઇ હતા. સુદર્શના નામે ણહેન હતી.
પ્રબુએ ગર્ભમાં કરેલા નિયમ પ્રમાણે તેમની ૨૮ વર્ષની વયે
જ્યારે માતાપિતા સ્વર્ગનાસી થયા ત્યારે પોતાનો ચારિત્ર
લેવાનો ભાવ નંદીવર્ધનને જણ્યાંયો. તેમના આશ્રહથી એ વર્ષ
પ્રબુ સંસારમાં અનાસક્તાપણે રહ્યા. એક વર્ષ પછી લોકાંતિક
દેવે આંયા ખાદ એક વર્ષ પ્રબુએ અખંડ દાન દ્ધ દીક્ષા માટે

નંદીવર્ધનની આજા ભાગી. તે વખત સર્વ ઈંડાહિ ત્યાં આવ્યા. પ્રલુનો હીક્ષા મહેતસવ કર્યો. નંદીવર્ધને હીક્ષાનો વરધોડો કાઢ્યો. પ્રલુ શાતખંડ ઉધાનમાં પધાર્યા અને વરધોડેથી ઉતરી, વચ્ચા-ભૂખણો તળ દઈ, માગશર વહિ ૧૦ મે (શુ. કાર્તિક વહિ ૧૦ મે) છફુનો તપ કરી, સ્વયમેવ પંચમુષી લોચ કરી, કરેભિ જાંતે ઉચ્ચયા. તે જ વખતે પ્રલુને મનઃપર્યવજ્ઞાન ઉત્પજ્ઞ થયું. પ્રલુએ સ્વજનેને પૂછીને ત્યાંથી વિહાર કર્યો. ઈંડાહિક નંદીશ્વર દ્વારે જઈ અફુાહિમહેતસવ કરીને સ્વસ્થાને ગયા. નંદીવર્ધન પ્રલુને નમીને પાછા વળતા બોલ્યા કે—

ત્વયા વિના વીર! કથં વજામો, ગૃહેઽધુના શૂન્યવનોપમાને ।
ગોદિસુખં કેન સહાચરામો ? ભોક્ષ્યામહે કેન સહાથ બંધો!॥૧॥
સર્વેષુ કાર્યેષુ ચ વીરવીરે-ત્યામંત્રણાદર્શનતસ્ત્વાર્ય ! ।
પ્રેમપ્રકર્ષેદ્ભવજાતહર્ષ, નિરાશ્રયાશ્રાર્ય ! કમાશ્રયામઃ ? ॥૨॥

“ હે વીર ! તમારા વિના શૂન્ય વન જેવા ગૃહમાં અમે ડેવી રીતે જઈએ ? વાર્તાલાપથી થતો આનંદ કેાની સાથે મેળવીએ ? અને હે બંધુ ! અમે કેાની સાથે એસીને લોજન કરીએ ? સર્વ કાર્યમાં ‘ હે વીર ! હે વીર ! ’ એ પ્રકારના સંભોધનથી એલાવવાવડે અને તેથી થતા તમારા દર્શનવડે ગ્રેમના પ્રકર્ષપણુથી પ્રગટિત હુર્ષવાળા એવા અમે અત્યારે આશ્રયહીન થયા છતાં તમારા વિના કેનો આશ્રય લઈએ ? ” આ પ્રમાણે કહીને સ્વસ્થાને ગયા. ખાદ નિઃસ્પૃહી પ્રલુ ત્યાંથી તરત જ વિહાર કરી ગયા.

પ્રથમ કહેલા ૪૨ વર્ષના વર્ષન સાથે સંક્ષિપ્ત
શ્રી મહાવીર ચરિત્ર સંપૂર્ણ.

શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ
 ભવનું રસ્તવન ૧૦૦૪

દાખા

વિમલ કમલદલ લોયણું, હિસે વહન પ્રસંગ;
 આદર આણું વીરજિન, વાંદી કરું સતવન. ૧
 શ્રી ગુરુતણે પસાઉલે, સ્તવશું વીર જિણુંદ;
 લવ સત્તાવીશ વરણુવું, સુણુંલે સહુ આણુંદ. ૨
 સાંભળતાં સુખ ઉપજે, સમકિત નિર્મણ હોય;
 કરતાં જિનની સંકથા, સકળ દહાડો સોય. ૩

દાળ પહેલી

મહાવિદેહ પાશ્ચયમ જાણું, નયસાર નામે વખાણું;
 નયરતણો છે એ રાણો, અટવી ગચો સપરાણો. ૧
 જમવા વેળાએ જાણું, લક્ષ્ણ રસવંતી આણું;
 દત્તની^૧ વાસના આવી, તપસી જુવે તે લાવી. ૨
 મારગ ભૂદ્યા તે હેવ, મુનિ આંદ્યા તત્પેવ;
 આહાર દીધો પાય લાગી, અધિની બૂખતૃષા સવિ ભાગી. ૩
 ધર્મ સુષ્ણો મન રંગે, સમકિત પાન્યો^૨ એ ચંગે;
 અધિને ચાલંતા જાણું, હીયડે અતિ ઉલટ આણું. ૪

૧. દેવાની. ૨. અહીંથી ભવ ગણ્યાય છે. આ પહેલો લવ.

મારગ હેખાડો વહેતો, પાછો વળીએ એમ કહેતો; ૫
 પહેલે ભવે ધર્મ જ પાવે, અંતે હેવગુરુને ધ્યાવે.
 પંચ પરમેષ્ઠિનું ધ્યાન, સૌધર્મ પામ્યો વૈમાન; ૬
 આઉખું એક પદ્યોપમ, સુખ લોગવી અનોપમ.
 ભવ બીજે^૧ ત્રીજે આયો, ભરત કુળે સુત જાયો; ૭
 ઓચ્છલ મંગલિક કીધું, નામ તે મરીઅંચ દીધું.
 વાધે સુરતરુ સરીએ, આદિજિન હેખીને હરખાયો; ૮
 એઓએર હેશના દીધી, ભાવે દીક્ષાએ લીધી.
 જ્ઞાન ભણ્યો સુવિશેષ, વિહાર કરે હેશવિહેશ; ૯
 દીક્ષા દેહીએ ન ઝરે, અળગો સ્વામીથી વિચરે. ૧૦
 મહાત્રત ભાર એ મોટો, હું પણ પુન્યાધારે છોટો;
 ભગવું કાપડણ કરશું, માથે છતર ધરશું. ૧૧
 પાયે પાનહી પેરશું, સ્નાન શુચિ જળે કરશું;
 પ્રાણી થૂલ^૨ નહી મારું, ખુર સુંડ ચોટીએ ધારું. ૧૨
 જનોધ સોવનકેરી, શોભા ચંહન લદેરી;
 હાથે ત્રિદંડિયું લેવું, મનમાંડ ચિંતણું એહવું. ૧૩
 કિંગ કુલિંગનું રચીયું, સુખ કારણ એ મચીયું;
 શુણુ સાધુના વખાણો, દીક્ષા ચોગ્ય તે જાણો. ૧૪
 આણી જતિએને^૩ આપે, શુદ્ધો ભારગ સ્થાપે;
 સમવસરણ રચ્યું જાણી, વાંદે ભરત વિજાણી. ૧૫
 બારે પરખદા રાજે, પૂછે ભરત એ આજે;
 કોઈ છે તુમ સરીએ, દાખણું મરીઅંચ નીકો.

૧. બાજે ભવે હેવ. ૨. એમણે. ૩. ન પળે. ૪. વખ્ય. ૫. આદર. ૬. મુનિએને.

પહેલો વાસુદેવ થાશો, ચક્રવર્તી સુકાંચે^૧ વાસે;
ચાવીશમો એ તીર્થંકર, વર્દ્ધમાન નામે જ્યંકર. ૧૬
ઉલસ્થું ભરતનું હૈયું, જઈ મરીઅંચને કહિયું;
તાતે પદવીઓ હાખી, હરિ ચકી જિન પદ ભાખી. ૧૭
ત્રણુ પ્રદક્ષિણુા દેધ, વંદન વિધિશું કરેધ;
સ્તવના કરે એમ દાહો, પુત્ર ત્રિદંડી ન રાહો.^૨ ૧૮
વાંદું છું એહ ભરમ, થાશો જિનપતિ ચરમ;
એમ કહી પાછો વળીયો, ગરવે મરીઅંચી ચડીયો. ૧૯

દાલ ખીજ

ઈખાગ કુળે હું ઉપનો, મારો ચક્રવર્તી તાત જુ,
દાહો મારો જિનપતિ હુંઓ, હું પણ ત્રિજગ વિખ્યાત જુ;
અહો અહો ઉત્તમ કુળ માહુરું, અહો અહો સુજ અવતાર જુ,
નીચ ગોત્ર તિહાં ખાંધીયું, જુઓ જુઓ કર્મ પ્રચાર જુ. ૨૦ ૨
આ ભરતે પોતનપુરે, ત્રિપૃષ્ઠ હરિ અભિરામ જુ;
મહાવિદેહ ક્ષેત્રે સુકાપુરી, ચકી પ્રિયમિત્ર નામ જુ. ૨૦ ૩
ચરમ તીર્થંકર થાઇશું, હેશો ત્રિગડું સાર જુ;
સુરનર સેવા સારશો, ધન્ય ધન્ય સુજ અવતાર જુ. ૨૦ ૪
રહે મહમાતો એણીપરે, એક દિન રોગ અતીવ જુ;
સુનિજન સાર કો નવિ કરે, સુખ વાંછે નિજ જીવ જુ. ૨૦ ૫
કપીલ નામે કોઈ આવીઓ, પ્રતિબાધ્યો નિજ વાણુ જુ;
સાધુ સમીપે દીક્ષા વરો, ધર્મ છે તેણે ઢામ જુ. ૨૦ ૬

૧. મહાવિદેહની નગરી. ૨. હું ત્રિદંડીપણુાની રતુતિ કરતો નથી.

સાધુ સમીપે તેહ મોકલે, નવી જાએ તે અનોગ છુ;
 ચિતે મરીઅંચ નિજ મને, દીસે છે સુજ જોગ છુ. અ૦ ૭
 તવ તે વળતું એલીયો, તુમ વાંદે શું હોય છુ ?;
 લો લો ધરમ ઈહાં અછે, ઉત્સૂક ભાખ્યું સોય છુ. અ૦ ૮
 તેણે સંસાર વધારીએ, સાગર કોડાકોડી છુ;
 લાખ ચોરાશી પૂરવતાણું, આયુ ત્રીજે લવ જોડી છુ. અ૦ ૯
 લવ ચોથે ર્વર્ગ પાંચમે, સાગર દિથતિ દશ જણુ છુ;
 કૈશિક દ્વિજ લવ પાંચમે, લાખ એંશી પૂરવ માન છુ. અ૦ ૧૦
 શુણ્ણા નયરીએ દ્વિજ થયો, પૂરવ લાખ બહેંતેર સાર છુ;
 હુએ ત્રિદંડી છું લવે, સાતમે સોઠુમ અવતાર છુ. અ૦ ૧૧
 અભિઘોત આઠમે લવે, સાડ લાખ પૂરવ આય છુ;
 ત્રિદંડી થઈ વિચરે વળી, નવમે ઈશાને જય છુ. અ૦ ૧૨
 અભિભૂતિ દશમે લવે, મંદિરપુરે દ્વિજ હોય છુ;
 લાખ છપજ પૂરવ આઉખું, ત્રિદંડી થઈ મરે સોય છુ. અ૦ ૧૩
 ઈગ્યારમે લવે તે થયો, સનતકુમારે દેવ છુ;
 નયરી શ્વેતાંધીએ અવતર્યો, બારમે લવે દ્વિજ હેવ છુ. અ૦. ૧૪
 ચુમાલીશ લાખ પૂરવ આઉખું, ભારદ્વાજ જસ નામ છુ;
 ત્રિદંડી થઈ વિચરે વળી, મહેંદ્ર તેરમે લવે ઢામ છુ. અ૦ ૧૫
 રાજગૃહી નયરી લવ ચૌદમે, થાવર પ્રાણણ દાખ છુ;
 ચ્યાત્રીશ લાખ પૂરવ આઉખું, ત્રિદંડી લિંગ તે લાખ છુ. અ૦ ૧૬
 અમર થયો લવ પજસ્મે, પાંચમે દેવલોક દેવ છુ;
 સંસાર લર્યો લવ સોળમે, વિશ્વભૂતિ ક્ષત્રી હેવ છુ. અ૦ ૧૭

થાળ ત્રીજી

- વિશ્વભૂતિ ધારણીનો એટો, બુજખળ કુઠ સમૂહ સમેટો;
સંભૂતિ ગુરુને તેણે લેટચો. ૧
- સહસ વરસ તિણાં ચારિત્ર પાળી, લણી દીક્ષા આતમ
અનુવાળી; તપ કરી કાયા ગાળી. ૨
- એક હિન ગાય ધર્સી સિંગાલી, પડ્યો ભૂમિ તસ
ભાઈએ લાળી; તેહશું બળ સંભાળી. ૩
- ગરવે રીસ ચઢી વિકરાળી, સિંગ ધરી આકાશે
ઉછાળી; તસ બળ શંકા ટાળી. ૪
- તિણાં અનસન નીયાણું કીધું, તપ વેચી બળ માળી
લીધું; અધો પ્રિયાણું કીધું. ૫
- સત્તરમે લવે શુકે સુરવર, ચવી અવતરીએ જિહાં
પોતનપુર; પ્રજાપતિ મૃગાવતી કુંવર. ૬
- ચારાસી લાખ વરસનું આયુ, સાત સુપનસૂચિત સુત
નયો; ત્રિપૃષ્ઠ વાસુદેવ ગાયો. ૭
- આગણીશમે લવે સાતમી નરકે, તેત્રીશ સાગર આયુ
અલગો; લોગવીધું તનુ સંગે. ૮
- વીશમે લવે સિંહ હિંસા કરતો, એકવીશમે ચોથી
નરકે ઝીરતેમ; વચે વાણી ધણા ભવ ભમતો. ૯
- ખાવીશમે લવે સરલ સ્વભાવી, સુખ લોગવતાં જસ
ગવરાવી; પુનચે પુલભમતિ આવી. ૧૦
- ત્રેવીશમે લવે સુકાપુરી સુખે, ધનંજયારણીની કૂખે;
નર અવતરીએ સુખે. ૧૧

૧ અધોગતિનું પ્રયાણ કર્યું.

ચહેરતીની પદવી લાધી, પોટીલાચાર્યશું ભતિ બાંધી;
શુલમતિ કીરીઆ સાધી. ૧૨

કેડી વરસ દીક્ષાનો જણુ, લાખ ચોરાશી પૂરવ
પ્રમાણુ; આઉખું પૂરું જણુ. ૧૩

ચોવીશમે ભવે શુકે સુરવર, સુખ ભોગવીઆ સાગર
સતર; તીહાંથી ચવીએ અમર. ૧૪

દાળ ચોથી

આ ભરતે છત્રિકાપુરી, જિતશત્રુ વિજયા નાર મેરે લાલ;
પચવીશમે ભવે ઉપનો, નંદન નામ ઉદાર મેરે લાલ,
તીર્થીંકર પદ બાંધીયું. ૧ એ બાંકણી.

લઈ દીક્ષા સુવિચાર મેરે લાલ, વીશ સ્થાનક તપ આદર્યું;
હુએ તિહાં જ્ય જ્યકાર, મેરે લાલ. તીર્થીં ૨

રાજ તણ દીક્ષા લીયે, પોટીલાચાર્ય પાસ મેરે લાલ;
માસખમણુ પારણું કરે, અલિથહવંત ઉદ્વાસ મેરે લાલ. તીર્થીં ૩
લાખ વરસ ઈમ તપ કર્યો, આલસ નહીંઅ લગાર મેરે લાલ;
પરિગલ પુષ્ય પોતે કર્યું, નિકાચ્યું જિનપદ સાર મેરે લાલ. તીર્થીં ૪
માસખમણુ સંખ્યા કહું, લાખ ઈંઘાર એંશી સહસ મેરે લાલ;
છશોં પીસ્તાલીશ ઉપરે, પંચ દિન વૃદ્ધિ કરેસ મેરે લાલ. તીર્થીં ૫
પચવીશ લાખ વરસ આઉખું, માસ સંલેખણું કીધ મેરે લાલ;
ખમી ખમાવી તે ચ૦૧ા, દશમે સ્વર્ગ કુળ લીધ મેરે લાલ. તીર્થીં ૬
પુષ્પોત્તરાવતંસકે, વિમાને સાગર વીશ મેરે લાલ;
સુર ચવીએ સુખ ભોગવી, હુએ એ ભવ છવીશ મેરે લાલ. તીર્થીં ૭

દાલ પાંચમી

સત્તાવીશમો ભવ સાંભળો તો, ભમર હુલી
 રૂથડું માહણુકુંડ ગામ તો; ઋષલદત્ત પ્રાક્ષણ વસે તો, ભ૱ન
 દેવાનંદા ધરણી નામ તો. ૧

કર્મ રઘ્યાં લવલેશ વળી તો, ભ૱ન મરીઅંચી ભવના જેહ તો;
 પ્રાણુત કદ્વયદી ચવી તો, ભ૱ન દ્વિજ કુળે અવતર્યી તેહ તો. ૨
 ચઉદ સુપન માતા લહે તો, ભ૱ન આણુંદ હુચો બહુત તો;
 ઈદ્રે અવધિ જેઈયું તો, ભ૱ન એહ અછેરાભૂત તો. ૩
 ખ્યાલી દિન તિહાં કણે રઘ્યા રઘ્યા તો, ભ૱ન ઈદ આદેશો દેવ તો;
 સિદ્ધારથ ત્રિશલા કૂઝે તો, ભ૱ન ગરભ પાલટે તત્પેવ તો. ૪
 ચઉદ સુપન ત્રિશલા લહે તો, ભ૱ન શુલ મુહૂર્તે જણ્યા જમ તો;
 જન્મ મહેાંધ્રવ તિહાં કરે તો, ભ૱ન ઈદ ઈદ્રાણી તામ તો. ૫
 વર્દ્ધમાન તસ નામ દ્વિચો તો, ભ૱ન દેવે દીચો મહાવીર તો;
 હુર્ચેશું પરણુવીઆ તો, ભ૱ન સુખ વિલસે ધર વીર તો. ૬
 માય તાય સુરલોક ગયા તો, ભ૱ન જિન સાધે નિજ કાજ તો;
 દૈકાંતિક સુર ઈમ કહે તો, ભ૱ન દ્વ્યો દીક્ષા મહારાજ તો. ૭
 વરસીદાન દૃઢ કરી તો, ભ૱ન પ્રલુ લીધો સંયમ ભાર તો;
 એકાકી જિન વિહાર કરે તો, ભ૱ન ઉપસર્ગનો નહીં પાર તો. ૮
 તપ ચઉવિહાર કર્યાં ધણ્યા તો, ભ૱ન એક છમાસી ચઉવિહાર તો;
 બીજો છમાસી કર્યો તો, ભ૱ન પંચ દિન ઊણા ઉદાર તો. ૯
 નવ તે ચોમાસી કર્યાં તો, ભ૱ન એ ત્રણુમાસી જણુ તો;
 અઢી માસી એ વાર કર્યાં તો, ભ૱ન એ માસી છ વાર વખાણુ તો. ૧૦

હોઠ માસી એ વાર કર્યાં તો, લું માસખમણું કર્યાં બાર તો; બહેંતેર પાસખમણું^૧ કર્યાંતો લું છદું બશેં ઓગણુત્રીશ સાર તો. ૧૧
 બાર વરસમાં પારણું તો, લું ત્રણુશેં ને ઓગણુપચાસ તો; નિદ્રા એ ઘડીની કરી તો, લું એડા નહીં બાર વરસ તો. ૧૨
 કરમ ખપાવી કેવળ લદ્ધું તો, લું ત્રિગડે પરષ્ઠા બાર તો; ગણુધરપદની સ્થાપના તો, લું જગ હુએં જ્યજ્યકાર તો. ૧૩
 ગણુધર વર ઈગ્યાર હુઆ તો, લું ચઉદ્દ સહુસ સાધુ સુખકાર તો; છત્રીસ સહુસ સાધવી હુદ્ધ તો, લું શિયલ રયણ ભંડાર તો. ૧૪
 એક લાખ ઓગણુસાડ હન્જર કદ્યા તો, લું શ્રાવક સમકિત ધાર તો; ત્રણ લાખ અઠાર હન્જર શ્રાવિકા તો, લું એ કદ્યો વીરપરિવાર તો. ૧૫
 અધ્યાણ માતપિતા હુઆ તો, લું મોકલ્યા મુક્તિ મજાર તો; સુપુત્ર આવે ઈમ કર્યું તો, લું સેવકની કરેં સાર તો. ૧૬
 ત્રીશ વરસ ગૃહવાસ વસ્યા તો, લું બાર વરસ છદ્દસ્થ તો; ત્રીશ વરસ કેવળ ધર્યું તો, લું બહેંતેર વરસ સમસ્ત તો. ૧૭
 ઓણીપરે પાળી આઉખું તો, લું દિન દીવાળી જેહ તો; મહાનંદ પદવી પામીઆ તો, લું સમરું હું નિલ્ય તેહ તો. ૧૮
 સંવત સોણ બાસઠ વર્ષે તો, લું વિજ્યા દશમી^૨ ઉદાર તો; લાલવિજ્ય ભક્તે કહે તો, લું વીરજિન ભવજળ તાર તો. ૧૯

ઢાંઢ છદ્દી

સમરણે સુખ સંપદ મીલે, ઝે મનોરથ કોડ લુ,
 દોગ વિદોગ સવિ ટણે, ન હોય શરીરે કોદ લુ. ૧

૧. પંદર દિવસના ઉપવાસ. ૨. વિ. સં. ૧૬૬૨ ના આસો શુદ્દિ ૧૦.

આદ્રીઆણુપુર મંડળો^૧, ખંડળો પાપનો પૂરો લ,
જે લવિયણુ સેવા કરે, સુખ પામે તે ભરપૂરો લ. ૨
મૂરત મોહન વેલડી, દીઠે અતિ આણુંછો લ,
સિંહાસન સોણે સદા, ગગને જુસ્યો રવિયંછો લ. ૩
પ્રતિ મંગલ દીચે સદા, પ્રશુભું જોડી હાથ લ,
ત્રણુ પ્રદક્ષિણા ઢેર કરી, માગું સુક્રિનો સાથ લ. ૪
શાવક અતિ ઉધમ કરી, કીધો જિન પ્રાસાદો લ,
કાદ્યું પાપ ડેલી કરી, પુષ્યે જગ જસવાદો લ. ૫

કલાશ.

શ્રી વોર પાટપરંપરાગત, શ્રી આણુંદવિમલસૂરીશરુ,
શ્રી વિજયદાનસૂરિ તસ પાટે, શ્રી હીરવિજયસૂરિ ગણુધરુ;
શ્રી વિજયસેનસૂરિ તસ પાટે, શ્રી વિજયહેવસૂરિ હિતકરુ,
કદ્વાણુવિજય ઉવજાય પંડિત, શ્રી શુલવિજય શિષ્ય જ્યંકરુ. ૧



શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવની ટૂંક હક્કીકત.

ભવ ૧ લો-પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં નયસાર નામે ગામેતી,
ભવ ૨ જો-સૌધર્મ હેવલોકમાં હેવ. [સમકિત પ્રાપ્તિ.
ભવ ૩ જો-ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ. ત્રિદંડીપણાની
શરૂઆત.

ભવ ૪ ચો-પાંચમા હેવલોકમાં હેવ.

ભવ ૫ મો-કેલાક નગરમાં કૌશિક આણણ ત્રિદંડી.

૧ મૂળનાયક પ્રલુનું નામ લખ્યું નથી પરંતુ મહાવીરસ્વામી સંભવે છે.

- ભવ ૬ કું-શુણુા નગરીમાં આદ્ધણ ત્રિદંડી.
- ભવ ૭ મો-સૌધર્મ હેવલોકમાં હેવ.
- ભવ ૮ મો-અગિનધોત આદ્ધણ ત્રિદંડી.
- ભવ ૯ મો-ધીજા ઈશાન હેવલોકમાં હેવ.
- ભવ ૧૦ મો-મહિરપુરમાં અગિનલૂતિ નામે આદ્ધણ ત્રિદંડી.
- ભવ ૧૧ મો-ત્રીજા સનત્કુમાર હેવલોકમાં હેવ.
- ભવ ૧૨ મો-ખેતાંથી નગરીમાં લારદ્વાજ નામે આદ્ધણ ત્રિદંડી.
- ભવ ૧૩ મો-ચોથા માહેંદ્ર કદ્વપમાં હેવ.
- ભવ ૧૪ મો-રાજગૃહી નગરીમાં સ્થાવર નામે વિપ્ર ત્રિદંડી.
- ભવ ૧૫ મો-પાંચમા અહ્મ હેવલોકમાં હેવ.

અસંખ્ય ભવભ્રમણ.

- ભવ ૧૬ મો-વિદ્યલૂતિ નામે ક્ષત્રિય. નિયાણું કરનાર.
- ભવ ૧૭ મો-સાતમા મહુશુક હેવલોકમાં હેવ.
- ભવ ૧૮ મો-પોતનપુરમાં ત્રિપૃષ્ઠ નામે વાસુહેવ.
- ભવ ૧૯ મો-સાતમી નરકે નારકી.
- ભવ ૨૦ મો-સિંહ.
- ભવ ૨૧ મો-ચોથી નરકે નારકી.

અસંખ્ય ભવભ્રમણ.

- ભવ ૨૨ મો-સાંઘારણ મનુષ્ય. ચક્રવર્તી થવાતું મુન્ય બાંધન ૧૨.
- ભવ ૨૩ મો-પ્રિયમિત્ર ચક્રવર્તી મહુવિહેલે મુકા નગરીએ.
- ભવ ૨૪ મો-સાતમા મહુશુક હેવલોકમાં હેવ.
- ભવ ૨૫ મો-છત્રિકા નગરીમાં નંદન નામના રાજપિં.
- ભવ ૨૬ મો-દશમા પ્રાણુત હેવલોકમાં હેવ.
- ભવ ૨૭ મો-શ્રી મહુવીર પ્રભુ.

શ્રી મહાવીરસ્વામીના પંચકુલ્યાણકુનુ

૭ સ્તવન् ૭

દળ પહેલી.

સરસતી લગવતી દીઓ ભતિ ચંગી, સરસ સુરંગી વાણ;
હુજ પસાય માય ચિત્ત ધરીને, જિન ગુણુરયણુનો ખાણ. ૧
ગિરુઆ ગુણ વીરજી, ગાઈશું ત્રિલુલન રાય;
જસ નામે ધર મંગળમાળા, તસ ધર બહુ સુખ થાય. ગિ૦ ૨
જંખુદીપ લરત ક્ષેત્રમાંહે, નથર માહણુકુંડ આમ;
ઝષભસદત વર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયાનામ. ગિ૦ ૩
સુર વિમાન વર પુણોત્તરથી, ચવો ભૂપ લીએ અવતાર;
તથ તે માહણી રયણી મધ્યે, સુપન લહે દશ ચાર. ગિ૦ ૪
ધુરે ભયગલ મલપતો હેણે, બીજે ઝષભસ વિશાલ;
ત્રોને કેસરી ચ્યાથે લક્ષ્મી, પાંચમે કુસુમની માળ. ગિ૦ ૫
ચંદ્ર સૂરજ ધવજ કળશ પદ્મસર, હેણે એ હેવ વિમાન;
રયણ રેલ રયણાયર રાને, ચૈદમે અંગ્રી અધાન. ગિ૦ ૬
આનંદલર જાગી સુંદરી, કંથને કહે પરલાત;
સુણીય વિપ્ર કહે તુમ સુત હેણો, ત્રિલુલનમાંહે વિખ્યાત. ગિ૦ ૭
અતિ અલિમાન કીયો ભરીયંચ લવે, લવિ જુઓં કર્મ વિચાર;
તાત સુતાવર તિહાં થયા કુંવર^૧, વળી નીચ કુણે અવતાર. ગિ૦ ૮
ઇણે અવસર ઈંદ્રાસન ડોલે, નાણ્ણેર કરી હરિ જેય;
માહણી કુખે જગશુર પેણે, નભી કહે અધટતું હોય. ગિ૦ ૯

૧ પુત્રીને પરણેલ પિતાના પુત્ર થયા તે. ૨ હાનવડે.

તતકણુ હરિણુગમેળી તેડાવી, મોકલીયો તેણે ઠાય;
 માહણી ગર્ભ અને ત્રિશલાનો, બિહું ખદલી સુર જાય. ગિંદો ૧૦
 બળી નિશિલર તે દેવાનંદા, દેખે એ સુપન અસાર;
 આણે એ સુપન ત્રિશલા કર ચઠિયા, જઈ કહે નિજ લરતાર. ગિંદો ૧૧
 કંથ કહે તું હું ખર દુર સુંદરી, મુજ મન અચરિજ એહ;
 મરુથલમાંહે કદ્વપદુમ દીઠો, આજ સંશય ટજ્યો તેહ. ગિંદો ૧૨

દાલ ધીજ

નયર ક્ષત્રિયકુંડ નરપતિ, સિદ્ધારથ ભદ્રો એ,
 આણુ ન ખંડે તસ કોય કે, જગ જસ નિરમળો એ;
 તસ પટરાણી ત્રિશલા સતી, કૂએ જગપતિ એ,
 પરમ હર્ષ હિયડે ધરી, ઠવિયા સુરપતિ એ....૧

સુખસજ્જાએ પોઢી દેવી તો, ચઉંદ સુપન લહે એ,
 આગતી જિનગુણુ સમરતી, હરખતી ગહગહે એ;
 રાજહંસ ગતિ ચાલતી પીડ કને આવતી એ,
 પ્રહ જીગમતે સૂર, કે વિનવે નિજપતિ એ....૨

સુણીય વાત રાય રંલ્યો, પંડિત તેડિયા એ,
 તેણે શુલ સુપન વિચારવા, પુસ્તક છોડિયાં એ;
 બાલે મધુરી વાણુ કે, ગુણુનિધિ સુત હોશો એ,
 સુખ સંપત્તિ ધરે વાધશો, સંકટ લાંજશો એ....૩

પંડિતોને રાયે તોષીયા, લચ્છી દીએ ધણું એ,
 કહે એ વાણી સકૃણ હોજો, અમને તુમ તણું એ;
 નિજ પદ પંડિત સંચર્યા, રાય સુખે રહે એ,
 દેવી ઉદ્ર ગર્ભ વાધતો, શુલ હોહલા લહે એ....૪

૧. મારવાડના ભૂમિઅંકદ્વપુર્ખ થયાનો અને સંશય હતો તે લાંગી ગયો.

માતલક્ષ્ણ જિનપતિ કરે, ગર્ભ હાલે નહીં એ,
 સાત માસ વોલી ગયા, માય ચિંતા લહી એ;
 સહીઅરને કહે સાંલળો, કોણે મારો ગર્ભ હયો એ,
 હું લોણી જાણું નહીં, ફ્રેન્કટ પ્રકટ કર્યો એ....૫

સખી કહે અરિહંત સમરતાં, હુઃખ દોહગ ટળે એ,
 તવ જિન જ્ઞાન પ્રયુલ્લાઓ, ગર્ભ સલસળે એ;
 માતાપિતા પરિવારનું, હુઃખ નિવારિયું એ,
 સંયમ ન લહું માયતાય છતાં, જિન નિરધારિયું એ....૬

અણુદીઠે મોઢ એવડો, કિમ વિશુએ ખમે એ,
 નવ મસવાડા ઉપરે, દિન સાડા સાતમે એ;
 ચૈત્ર શુક્રવાર દિન તેરશે, શ્રી જિન જનમીયા એ,
 સિદ્ધારથ ભૂપતિ લતા, એવિષ તવ કીયા એ....૭

વસ્તુ

પુત્ર જન્મ્યો પુત્ર જન્મ્યો, જગત શાણગાર;
 સિદ્ધારથ નૃપ કુળતિલો, કુળમંડણું કુળતણ્ણો દીવે.
 શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલા દીવી સુત ચિરંલવે;
 એમ આશીશ દીએ લલી, આવી છપજ કુમારી;
 સૂતિકર્મ કરે તે સહી, સોઢે જિસી હરિની નારી. ૧

દાદ ત્રીજ

ચણ્ણું રે સિંહાસણું ઈંદ્ર જાને નિરખતા એ;
 જાણું જનમ જિણું ઈંદ્ર તવ હરખતા એ. ૧

આસનથી ઉઠેવ લક્ષ્ણાચે ગુણું શુણું એ;
 વાય સુધોષા ધંટ સધળે રણુંઅણું એ. ૨

ઈદ ભુવનપતિ વીશ વ્યાંતરતણ્ણા એ;	
ખત્રીશ રવિ શરીરી હોય દશ હરિ કદ્વપના એ.	૩
ચોશઠ ઈદ આણું હે પ્રાણુમી કહે એ;	
રદ્દનગલ્લી જિન માત ફુળ એસી નહીં એ.	૪
જામ મહોચછવ હેવ સવિહુ આવિયા એ;	
માય દેય નિદ્રા મંત્ર સુત લઈ મેરુ ગયા એ.	૫
કંચન મણિ ભૂંગાર ગંધોદકે લર્યા એ;	
કિમ સહેશે લઘુ વીર હરિ સંશય ધર્યા એ.	૬
વહેશે નીર પ્રવાહ ડેમ તે નામીએ એ;	
ન કરે નમણુ સનાહ જણયું સ્વામીએ એ.	૭
અરણુ અંગૂઠે મેરુ ચાંપી નાચીએ। એ;	
મુજ શિર પગ લગવંત એમ લહી રાચીએ। એ.	૮
ઉલટયા સાયર સાત સરવે જલહલયા એ;	
પાયાલે નાગેંદ્ર સઘળા સલસલયા એ.	૯
ગિરિવર તુટે દુંક ગડગડી પડ્યા એ;	
તીન ભુવનના લોક કંપિત લડથડ્યા એ.	૧૦
અનંતણળ અરિહંત સુરપતિએ કલ્યું એ;	
હું મૂરખ સહી મૂઠ એટલું નવિ લલ્યું એ.	૧૧
પ્રદક્ષિણ્ણા દઈ ખામેય એચ્છવ કરે એ,	
નાચે સુર ગાચે ગીત પુણ્ય પોતે ભરે ^૧ એ.	૧૨
ઇણે સુખે સ્વર્ગની લીલ ^૨ તૃણ સરખી ગણે એ,	
જિન મૂકી માયને પાસ પદ ^૩ ગયા આપણે એ.	૧૩

૧ પુણ્યના પ્રવહણુ ભરે. ૨ સૂખ. ૩ સ્થાન.

માય જાગી જુઓ પુત્ર સુરવડે પૂળુંઓ એ;
કુંડળ દોય દેવજીય અમીય અંગૂઠે દીઓ એ. ૧૪
જન્મ મહોચ્છવ રાય ઋદ્ધિએ વાધિયો એ;
સંજન સંતોષી નામ વર્દ્ધમાન થાપીએ એ. ૧૫

દાલ ચોથી

પ્રભુ કદેપતરુ સમ વાધે, ગુણુમહિમા પાર ન લાધે;
રૂપે અહુભુત અનુપમ અકળ, અંગે લક્ષણુ વિધા સકળ....૧
મુખ ચંદ્ર કમલદલ નયણુ, સાસ સુરલિગંધ મીડા વયણુ;
હેમ વરણે પ્રભુ તન શોભાવે, અતિ મિર્મળ વિણુ નવરાવે....૨
તપ તેજે સુરજ સોહે, જોતાં સુર નરના મન મોહે;
પ્રભુ રમે રાજકુવરશું વનમાં, માય તાયને આનંદ મનમાં....૩
ખળ અતુલ વૃષભ ગતિ વીર, ઈંદ્રે સલામાં કદ્ધો જિન ધીર;
એક સુર મૂઢ વાત ન માને, આંદો પરખવાને વન રમવાને.૪
અહિ થઈ વૃક્ષ આમલીએ રાખ્યો, પ્રભુ હાથે જાલી હુર નાખ્યો;
વળી ખાળક થઈ આવી રમિયો, હારી વીરને ખાંધે લઈ ગમીએ.૫
માય તાય હુઃખ ધરી કહે ભિત્ર, કોઈ વર્દ્ધમાનને લઈ ગયો શાનુ;
જાતો સુર વાધ્યો ગગને મિથ્યાતી, વીરે મુણ્ટીએ હણ્યો. પદ્યો ધરતી.૬
પાય નમી નામ દીધું મહાવીર, જેહવો ઈંદ્રે કદ્ધો તેહવો ધીર;
સુર વળીએ પ્રભુ આંદો રંગે, માય તાયને ઉલટ અંગે. ૭

વર્ણનુ

રાય એચ્છવ, રાય એચ્છવ, કરે મન રંગ,
લેખનશાળાએ સુત ઠાવે, વીરજ્ઞાન રાજ ન જણો;

તવ સૌધર્મ હંડ આવીયા, પૂછે અંથ સ્વામી વખાણું,
વ્યાકરણ જૈન તિહાં કીએ, આનંધો સુરરાય;
વચન વહે પ્રભુ લારતી, પંખ્યો વિસ્મય થાય. ૧

ઢાલ પાંચમી

યૌવન વય જખ આવીયાએ, રાય કન્યા જશોદા પરણુાવીયાએ;
વિવાહ મહોચ્છવ શુલ કિયાએ, સર્વે સુખ સંસારના વિલસીયાએ. ૧
અનુકૂળ હૃદ્ય એક કુંવરીએ, ત્રીશ વર્ષ જિનરાજ લીલા કરીએ;
માતપિતા સહૃગતિ ગયાએ, પછે વીર વૈરાગે પૂરીઆએ. ૨
મયણુરાય સેન જીતીએએ, વીરે અથિર સંસાર મન ચિંતીએએ;
રાજ રમણી ઝડ્ધિ પરિહરીએ, કહે કુટુંખને લેશું સંયમસિરિએ. ૩

ઢાલ છઠી

પિતરીએ સુપાસ રે, લાઇ નંદિવર્દ્ધન,
કહે વચ્છ ઓમ ન કીળએએ.

૧

આગે માય તાય વિછોાહ રે, તું વળી ત્રત લીધે,
આઢે ખાર ન દીળએએ.

૨

નીર વિના જિમ ભચ્છ રે, વીર વિના તિમ;
દળવળતું ધીમ સહુ કહેએ.

૩

કૃપાવંત ભગવંત રે, નેહ વિના વળી, વરસ એ જાઝેરાં રદ્ધાંએ. ૪
ક્રાસુ લીએ અજ્ઞપાન રે, પરધરનવિજમે, ચિત્ત ચારિત્ર લાવે રમે એ. ૫
ન કરે રાજની ચિંત રે, સુર લોકાંતિક, આવી કહે સંયમ સમોએ. ૬
ખૂજ ખૂજ ભગવંત રે, છોડ વિષયસુખ; એ સંસાર વધારણુએ. ૭

ઢાળ સાતમી

આલે આલે ત્રિશલાનો કુંઅર, રાજ સિદ્ધારથનો નંદ કે,
દાનસંવત્સરી એ; એક કોડી આઠ લાખ દિન પ્રત્યે એ, કનક
રથણુ રૂપા મોતી તો, સુડી ભરી ભરી એ. આલે૦ ૧

ધણુ કણુ ગજ રથ ઘોડલા એ, ગામ નથર પુર દેશ તો,
મનવંછિત વળી એ; નિર્ધનને ધનવંત કીયા એ, તસ ધર ન
ઓળએ નારી તો, સમ કરે વળી વળી એ. આલે૦ ૨

હુઃખ દારિદ્ર ટાજ્યા જગતણુ એ, મેધ પરે વરસીદાન
તો, પૃથ્વી અનૃણુ કરી એ; બહુ નર નારી ઓચ્છિવ જુએ
એ, સુર નર કરે મંડાણુ તો, જિન દીક્ષા વરી એ. આલે૦ ૩

વિહાર કમ જગગુરુ કીએ એ, કેઠે આઠ્યો માહણુ મિત્ર
તો, નારી સંતાપીએ એ; જિન યાચક હું વિસર્યો એ, પ્રભુ
ખંધથકી દેવહૂણ્ય તો, પદ ખંડ કરી દીએ એ. આલે૦ ૪

ઢાળ આઠમી

જસ ધર હોયે પ્રભુ પારણું, સુર તિહાં કંચન વરસે અતિ ધણું,
આંગણું દીપે તેજે તેહતણું એ;
દેવહુંદુંલી વાજે એ, તેણે નાહે અંભર ગાજે એ,
છાજે એ ત્રિલુલનમાંડે સોહામણું એ.

૧

તુલ્લં

સોહામણું પ્રભુ તપે, બહુ દેશ વિદેશો વિચરતા;
ભવિ લુલને ઉપદેશ દેતા, સાતે ઈતિ સમાવતા.
ષટ્ટ માસ વન કાઉસસગ્ગ રહી, જિન કર્મ કઠિન દહે સહી;
ગોવાલ જૌ લળાવી ગયા, વીર સુએ ઓલે નહીં.

૨

ઢાળ

એારુ સવિ દશ દિશો ગયા, તેણે આવી કહું મુનિ કિહાં ગયા ?
 ઋષિરાયા ઉપર મૂર્ખ કોપિયા એ;
 ચરણુ ઉપર રાંધી ખીર, તેણે ઉપસગે ન ચહ્યા ધીર,
 મહાવીર શ્રવણે ખીલા ઠોકીઆ એ.

૩

તુટક

ઠોકીયા ખીલા હુઃએ પીલ્યા, કો ન લહે તેમ કરી ગયા;
 જિનરાજને મન શત્રુ મિત્ર સરખા, મેરુ પરે ધ્યાને રદ્ધા.
 ઉઠહો વરસે મેઘ બારે, વોજળી જબુડે ધણ્ણી;
 બેહુ ચરણુ ઉપર ડાલ ઊંઘો, ઈમ કહે ત્રિભુવનધણી. ૧

૪

ઢાળ

એક દિન ધ્યાન પૂરું કરી, પ્રભુ નયરીએ પહોતા ગોચરી,
 તિહાં વૈદે શ્રવણે ખીલા જાણુંની એ;
 પારણું કરી કાઉસસગે રદ્ધા, તિહાં વૈદ સંચ લેલા કીંચા,
 બાંધીયા વૃક્ષે દોર ખીલા તાણુંની એ.

૫

તુટક

તાણું કાઢ્યા દોર ખીલા, વીર વેદન થઈ ધણ્ણી;
 આકંદ કરતાં ગિરિ થયો શતખંડ, જુઓ ગતિ કર્મહતણું.
 ખાંધે રે જીવડો કર્મ હસતાં, રૈવતાં છૂટે નહીં;
 ધન્ય ધન્ય મુનિવર રહે સમચિત, કર્મ એમ તૂટે સહી. ૬

ઢાળ નવમી

જુઓ જુઓ કર્મ શું કીધું રે, અજ વર્ષ ઋષલે ન લીધું રે;
 કર્મવશ મ કરો કોઈ એદ રે, મહિનાથ પાખ્યા ખીવેદ રે. ૧

૧. આ ગાથામાં કહેલી ખીર રાંધ્યાની, વરસાદ વરસ્યાની તેમજ
 ડાલ ઊંઘાની વાત કોઈ ચરિત્રમાં જણ્ણાતી નથી.

કર્મ ચક્રી અધ્યાત્મ નડીએ રે, સુભૂમ નરકમાણે પડીએ રે;
 ભરત ખાડુખલશું ભડીએ રે, ચક્રી હાર્યો રાય જસ ચડીએ રે. ૨
 સનતકુમારે સદ્ગા રોગ રે, નલ દમયંતી વિયોગ રે;
 વાસુદેવ જરાકુમરે માર્યો રે, ખલદેવ મોહનીએ ધાર્યો રે. ૩
 ભાઈ શાખ મસ્તકે વહીએ રે, પ્રતિયોધ સુરમુખે લહીએ રે;
 શ્રેણીક નરકે પહુંતા રે, વન ગયા દશરથ પુતા રે. ૪
 સત્યવંત હરિચંદ ધીર રે, કુંભ ધરે શિર વહું નીર રે;
 કુષેરહત્તને થચો કુચોગ રે, બહેન વળી માતાશું લોગ રે. ૫
 પરહુથે ચંદનબાળ રે, ચઠિયો સુલક્ષને આળ રે;
 મયણુરેહા મૃગાંકલેખા રે, હુઃખ લોગવીઆ તે અનેકા રે. ૬
 કરમે ચંદ્ર કલંકચો રે, રાય રંક કોઈ ન મૂકચો રે;
 ઈંડ અહુદ્વાશું લુફદ્યો રે, રયણાદેવી રવિ માઉ કીધ્યો રે. ૭
 ઈશ્વર નારીએ નચાંયો રે, અધ્યાત્મ ધ્યાનથી ચૂકાંયો રે;
 અદ્ય અદ્ય કરમ પ્રધાન રે, જીત્યા જીત્યા શ્રી વર્દ્ધમાન રે. ૮

દાળ દશમી

ઇમ એ કર્મ હણ્યા સવિ, ધીર પુરુષ મહાવીર,
 ખાર વર્ષ તચોતપ, તે સઘળો વિષુ નીર;
 શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા કેવલજ્ઞાન,
 સમવસરણ રચે સુર, દેશના હે જિનલાણુ. ૧

અપાપા નથરે જુએા, બજા કરે વિપ્ર જેહ,
 સર્વ ઝુઝવી દીક્ષા દીધી, વીરને વંદે તેહ;
 ગૌતમ ઋષિ આહે, ચારશોં ચાર હંજર,
 સહુસ ચૈદ મુનિવર, ગણુધર વર ઈગ્યાર. ૨

ચંદનખાલા સુખ્ય, સાધી સહસ છત્રીશા,
દોઢ લાખ સહસ નવ, શ્રાવક ઘે આશીશા;
ત્રણુ લાખ શ્રાવિકા, અધિકી સહસ અઠાર,
સંધ ચતુર્વિધ થાપ્યો, ધનધન જિન પરિવાર.

૩

પ્રભુ અશોક તરુ તળે, ત્રિગડે કરેઅ વખાણુ,
સુણે ખારે પરખુદા, ચોજન વાણી પ્રમાણ;
ત્રણુ છત્ર સોહે શિર, ચામર ઢળે ઈંડ,
નાટક ખદ્દ ખત્રીશા, ચોત્રીશા અતિશાય જિણુંદ.

૪

કુલ પગર ભરે સુર, વાગે હુંદુલી નાદ,
નમે સકળ સુરાસુર, છાંડી સવિ પરમાદ;
ચિહું રૂપે પ્રભુ સોહે, ધર્મ પ્રકાશો ચાર,
ચોવીશમા જિનવર, આપે ભવનો પાર.

૫

પ્રભુ વર્ષ ખણેંતેર, પાળી નિર્મણ આય,
ત્રિભુવન ઉપગારી, તરણુતારણ જિનરાય;
કાર્તિક માસે પ્રાંત દિન, દીવાળી નિરવાણુ,
પ્રભુ સુકૃતે પહેલાતા, પામે નિત્ય કદ્વયાણુ.

૬

કલશ

દુમ વીર જિનવર સયલ સુખકર, નામે નવનિધિ સંપદે;
ધર ઝડ્ધ વૃદ્ધ સુસિદ્ધ પામે, એક મના જે નર લજે.
તપગચ્છ ઠાકર શુણુ વેરાગર હીરવિજયસૂરીશ્વરે;
હંસરાજ વંદે મન આણુંદે, કહે ધન્ય મુજ એ શુરે.



શ્રી મહાવીરસ્વામીના પંચકુલ્યાણુકૃતું

સ્તવન

દાદા

શાસનનાયક શિવકરણુ, વંદું વીર જિણુંદ;
પંચ કુલ્યાણુક તેહનાં, ગાશુ' ધરી આનંદ. ૧.

સુણુતાં શુણુતાં પ્રભુતણાં, શુણુ ગિર્વા એક તાર;
ઝડ્ઝિ વૃદ્ધિ સુખ સંપદા, સક્રાણ હોય અવતાર. ૨.

દાદા પહેલી

(બાપલડી સુણ જભલડી—એ દેશી.)

સાંભળને સસનેહી સયણુા, પ્રભુજીના ચરિત્ર ઉદ્ઘાસે;
જે સાંભળશે પ્રભુગુણુ તેહનાં, સમકિત નિર્મળ થાશે રે. સાંદો ૧
જંબૂદ્ધીએ દક્ષિણ ભરતે, માહણુકુંડ નામ થામે;
રિખલદત પ્રાક્ષણુ તસ નારી, દેવાનંદા નામે રે. સાંદો ૨
અષાઠ શુદ્ધિ છહે પ્રભુજી, મુણ્પોત્તરથી ચવિયા;
ઉત્તરાક્ષાણુની જોગે પ્રભુ આવી, તસ કૂણે અવતરીયા રે. સાંદો ૩
તેણી રથણી સા દેવાનંદા, સુપન ગંભાડિક નિરખે;
પરભાતે સુણી કંત રિખવદત, હૈડામાંહી હુરખે રે. સાંદો ૪
ભાએ લોગ અર્થ સુખ હોશો, હોશો પુત્ર સુનણુ;
તે નિસુણી સા દેવાનંદાએ, કીધું વચન પ્રમાણ રે. સાંદો ૫

બોગ ભલા બોગવતા વિચરે, એવે અચરિજ હોવે;
 શતકૃત^૧ જીવ સુરેશ્વર હરપે, અવધેર પ્રભુજીને જોવે રે. સાંઠ ૬
 કરી વંદનને ઈંદ્ર સનમુખ, સાત આડ ડગ આવે;
 શહેરસ્તવ વિધિ સહિત લાણીને, સિંહાસન સોઢાવે રે. સાંઠ ૭
 સંશય પડિયા એમ વિમાસે, જિન ચક્કી હરિં રામ;
 તુચ્છ દારિદ્ર માહણુકુળ નાવે, ઉથ બોગ વિષુ ધામ રે. સાંઠ ૮
 અંતિમ જિન માહણુકુળ આંદ્રા, એહ અછેરું કહિયે;
 અવસર્પિણી ઉત્સર્પિણી અનંતી, જાતે એહનું લહિયે રે. સાંઠ ૯
 એણી અવસર્પિણી દશ અંછેરાં, થયાં તે કહિયે એહ;
 ગર્ભહરણ ગોશાળા ઉપસર્ગ, નિષ્કળ દેશના જેહ રે. સાંઠ ૧૦
 મૂળ વિમાને રવિ શશી આબ્યા, ચમરાનો ઉત્પાત;
 એ શ્રી વીરજિનેશ્વર વારે, ઉપના પંચ વિખ્યાત^૩ રે. સાંઠ ૧૧
 ખી તીરથ મહિ જિન વારે, શીતલને હરિવંશ;
 ઋષલને અહોતારસો સિદ્ધા, સુવિધિ અસંયતી શાંસ^૪ રે. સાંઠ ૧૨
 શાંખ શાણ મળીઆ હરિ હરિશું, નેમીશ્વરને વારે;
 તેમ પ્રભુજી નીચ કુળે અવતરિયા, સુરપતિ એમ વિચારે રે. સાંઠ ૧૩

ઢાળ બીજ

(નાની જસુનાડે તીર, બીડે દોય પંખીયાં—એ દેશી.)

ભવ સત્તાવીશ થૂળમાંહિ નીજે લવે, મરિચી કીયે।
 કુલમદ ભરત જદ^૫ સ્લવે; નીચ ગોત્રકર્મ બાંધું તિહાં તેહથી,
 અવતરિયા માહણુકુળ અંતિમ જિનપતિ. ૧

-
૧. સો વભત પાંચમી પડિયા વહેનાર કાર્તિક શેઠના જીવ.
 ૨. અવધિયાને. ૩. અછેરા. ૪. અસંયતી પૂનાણા. ૫. જ્યારે.

અતિશે અઘટતું એહ થયું થાશો નહિ, ચોનિપ્રસવ જન-
ચક્કી નીચ કુળે નહિ; એહ મારો આચાર ધરું ઉત્તમ કુળે,
હરિષુગમેધી દેવ તેડાંયો તેટલે. ૨

કહે માહણુકુંડ નયર જર્ઝ ઉચિત કરેા, હેવાનંદાની
કૂળેથી પ્રબુજુને સંહરેા; નયર ક્ષત્રિયકુંડ રાય સિદ્ધારથ
ગેહિની, ત્રિશલા રાણી ધરેા પ્રબુ કૂળે તેહની. ૩

ત્રિશલા ગર્ભ લઈને ધરેા માહણી ઉરે, બ્યાસી રાત
ન્યતીત કહું તેમ સુર કરે; માહણી દેખે સુપન જણે ત્રિશલા
હર્યા, ત્રિશલા સુપન લહે તિહાં ચૈાદ અલંકર્યા. ૪

હાથી વૃપલ સિંહ લક્ષ્મી માળા સુંદરુ, શશી રવિ ધ્વન
કુંભ પદ્મસરોવર સાગરુ; દેવવિમાન રયણુપુંજ અભિ વિમળ
હવે, દેખે ત્રિશલા માત કે પિયુને વિનવે. ૫

હરખે રાય કે સુપનપાઠકને તેડાવીઆ, રાજ લોગ સુત
કુલ સુણી તેને વધાવીઆ; ત્રિશલા રાણી વિધિશું ગર્ભ સુખે
વહે, માયતણે હિત હેત કે પ્રબુ નિક્ષળ રહે. ૬

માય ધરે હુઃખ જોર વિલાપ ધણ્ણા કરે, કે મેં કીધાં
પાપ અધીાર લવાંતરે; ગર્ભ હર્યો સુજ કેણે હવે કેમ પામીએ ?
હુઃખનું કારણ જાણ્યું વિચાર્યું સ્વામીએ. ૭

અહો અહો મોહ વિડંખણ્ણા જલમ જગતમેં, અણુદીઠે હુઃખ
એવડું પાયું પલકમેં; તામ અલિથહ કીધેા પ્રબુજુએ તે કહું;
માતપિતા લુવંતા સંજમ નવિ અહું. ૮

કરુણા આણી અંગ હલાવે જિનપતિ, ઓલે ત્રિશલા માત
હુંચે ધણ્ણાં હુસતી; અહો સુજ જાગ્યા લાગ્ય ગર્ભ સુજ સળવાયો,
સેંયો. શ્રી જિનધર્મ કે સુરતરુ જેમ ઇજ્યો. ૯

સખીએ। કહે શિખામણુ સ્વામિની સાંભળો, હળવે હળવે
ઓલો હુસો જેલો ચલો; એમ આનંદે વિચરતાં દોહુલાં પૂરતા,
નવ મહિના ને સાડાસાત દિવસ થતાં. ૧૦

ચૈત્રતાણી શુદ્ધિ તેરશ નક્ષત્ર ઉત્તરા, જેગે જન્મયા શ્રી
વીર સુહંકર સુંદરા; ત્રિભુવન થયો ઉધોત કે હરખ વધામણુા,
સોના રૂપાને કૂદે વધાવે સુર ધણુા. ૧૧

આવે છટ્ટપન કુમારિકા પ્રભુ એચ્છવતણુ, ચળે રે સિંહાસન
ઇંદ્ર કે ધંટા રણુઅણુ; મેળી^૧ સુરની કોડ કે સુરપતિ આવીયા,
પંચ રૂપ કરી પ્રભુને સુરગિરિ^૨ લાવીયા. ૧૨

એક કોડ સાઠ લાખ કળશ જળશું લર્યા, કેમ સહેશો લઘુ
વીર કે ઇંદ્રે સંશય ધર્યા; પ્રભુ અંગૂઠે ચાંઘ્યો મેરુ અતિ
થડથડ્યો, ગડગડ્યા પૃથ્વી લોક જગત જન લડથડ્યો. ૧૩

અનંત બળ પ્રભુ જણું ઇંદ્રે અમાવીયા, ચાર વૃષલના
રૂપ કરી જળ નામીયા; પૂજુ અચી^૩ પ્રભુને માય પાસે ધરે,
ધરે અંગૂઠે અમૃત ગયા નંદીશ્વરે. ૧૪

ઢળ ગ્રીલ

(દેશી હમચડીની)

કરે મહોચ્છવ સિદ્ધારથ નૃપ, નામ ધર્યું વર્ઝીમાન;
હિન હિન વાધે પ્રભુ સુરતરુ નેમ, રૂપકળા અસમાન રે. હમચડી૦ ૧.
એક હિન પ્રભુજી રમવા કારણુ, પૂર બાહિર જખ આવે;
ઇંદ્રમુખે પ્રશંસા સુણીને, મિથ્યાત્વી સુર આવે રે. ૬૦ ૨

૧. મેળો—એકત્ર કરીને ૨. મેરુપર્વત

અદ્વિતીયે વીંટાણ્ણો તરણું, પ્રલુલુએ નાખ્યો ઉછાળી;
 સાત તાડતું રૂપ કર્યું જખ, મુશ્કિએ નાખ્યો વાળી રે. હો ૩.
 પાય વાળીને તે સુર અમીયો, નામ ધર્યું મહાવીર;
 જેવા ઈંદ્રે વખાણ્યા સ્વામી, તેહવા સાહુસ ધીર રે. હો ૪.
 માતપિતા નિશાળે મૂકે, આઠ વરસના જાણી;
 ઈંદ્રતણું તિહાં સંશય ટાખ્યા, નવ વ્યાકરણ વખાણી રે. હો ૫.
 અનુહુમે ચોવન પામ્યા પ્રલુલુ, વર્યા જશોદા રાણી;
 અદ્વાવીશ વરસે પ્રલુલુના, માતપિતા નિર્વાણી રે. હો ૬.
 દ્વાય વરસ લાઈને આથડે, પ્રલુ ધરવાસે વસીયા;
 ધર્મપંથ હેખાડો એમ કહે, લોકાંતિક ઉદ્ઘૂસીયા રે. હો ૭.
 એક કોડ આઠ લાખ સોનૈયા, દિન પ્રત્યે પ્રલુલુ આપે;
 એમ સંવત્સરી દાન દેઈને, જગના દારિદ્ર હુઃખ કાપે રે. હો ૮.
 છંડી રાજ્ય અંતેજર પ્રલુલુ, લાઈએ અનુમતિ હીધી;
 માગશર વહિ દશમી ઉત્તરાએ, વીરે હીક્ષા લીધી રે. હો ૯.
 ચઉનાણી તે દિનથી પ્રલુલુ, વરસ દિવસ જાઝેરે;
 ચીવર ધરી પ્રાણણુને આખ્યું, ખંડ ખંડ દ્વાય ઝેરે રે. હો ૧૦.
 ઘોર પરીષહ સાડાભારે, વરસે જે જે સહીયા;
 ઘોર અલિથહ જે જે ધરીયા, તે નવિ જાયે કહીયા રે. હો ૧૧.
 શુળપાણી ને સંગમ હેવે, ચંડકોશિક ગોશાળે;
 હીધાં હુઃખ ને પાયસ રાંધી, પગ ઉપર ગોવાળે રે. હો ૧૨.
 કાને જોગે ખીલા ડોકયા, કાઢંતા મૂકી રાટી;
 જે સાંભળતાં ત્રિભુવન કંઘ્યા, પર્વત શિલા ફાટી રે. હો ૧૩.

તે તે હૃષ્ટ સહુ ઉજરીયા, પ્રલુલુ પરઉપગારી;
 અડદતણું બાકુલડા લઈને, ચંદનખાળા તારી રે. હો ૧૪.

હોઅ છ માસી નવ ચઉ માસી, અઠી માસી ત્રણુ માસી;
 હોઠ માસી અણે કીધાં, છ કીધાં એ માસી રે. હો ૧૫.

ખાર માસ ને પક્ષ અહેંતેર, છંકુ અશેં ઓગણુત્રીશ લણું;
 ખાર અહુમ લદ્રાદિ પડિમા, દિન હોય ચાર દશ જાણું રે. હો ૧૬.

એમ તપ કીધો ખારે વરસે, વિણુ પામી ઉદ્વાસ;
 તેમાં પારણું પ્રલુલુએ કીધાં, ત્રણુશેં ઓગણુપચાસ રે. હો ૧૭.

કર્મ અપાવી વૈશાખ માસે, શુદ્ધ દશમી સુજાણુ;
 ઉત્તરાન્ને શાળિવૃક્ષ તળે, પાખ્યા કેવળનાણુ રે. હો ૧૮.

ઇદ્રભૂતિ આહે પ્રતિભોધ્યા, ગણુધર પદવી દીધી;
 સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા, સંઘ સ્થાપના કીધી રે. હો ૧૯.

ચઉદ સહુસ અણુગાર સાધવી, સહુસ છત્રીશ કહીને;
 એક લાખ ને સહુસ ઓગણુસાઠ, શ્રાવક શુદ્ધ લહીને રે. હો ૨૦.

ત્રણુ લાખ ને સહુસ અઢાર વળી, શ્રાવિકા સંખ્યા જાણી;
 ત્રણુશેં ચઉદશ (૧૪) પૂરવધારી, તેરશેં એહીનાણી રે. હો ૨૧.

સાતશેં તો કેવળનાણી, લભિધધારી પણ તેતા;
 વિપુલમતિ પાંચશેં કહીને, ચારશેં વારી જેતા રે. હો ૨૨.

સાતશેં અંતેવાસી સિધ્યા, સાધવી ચૌદશેં સાર;
 દિન દિન દીપે તેજ સવાઈ, પ્રલુલુનો પરિવાર રે. હો ૨૩.

ત્રીશ વરસ ગૃહવાસે વસિયા, ખાર વરસ છદ્રમસ્થ;
 ત્રીશ વરસ કેવળ એંતાજીશ, વરસ તે સમણુવથ્થ રે. હો ૨૪

વરસ બહેંતેરકેરું આયુ, વીર જિણુંદનું જાળ્યો;
 હીવાળી હિન સ્વાતિ નક્ષત્રે, પ્રલુલુનું નિર્વાણ રે. હું ૨૫
 પંચ કલ્યાણુક એમ વખાણ્યાં, પ્રલુલુનાં ઉજ્ઝ્વાસે;
 સંધતણું આથે ધર્મ હર્ષલર, સુરત રહી ચોમાસું રે. હું ૨૬

કળશ

એમ અરમ જિનવર, સયલ સુખકર, શુષ્ણ્યો અતિ ઉલટ લરે;
 અપાઠ ઉજનવલ પંચમી હિને, સંવત સતતર તહેંતરે;
 શ્રી વિમલવિજય ઉવજાય પંકજ, ભમર સમ શુભ શિષ્ય એ;
 રામવિજય જિન વીર નામે, લહિયે અધિક જગીશ એ.

○○○
 ○○શ્રી મહાવીરસ્વામીના સત્તાવીશ ભવતું○○
 ○○○○○○○○○○○→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→→

દાહા

શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય; લવ
 સત્તાવીશ વર્ણવું, સુષુતાં સમકિત થાય ॥ ૧ ॥ સમકિત પામે
 જવને, લવ ગણુતીએ ગણુય; જો વળી સંસારે લમે, તો પણ
 સુગતે જાય ॥ ૨ ॥ વીર જિનેશ્વર સાહીએ, લમીયો કાળ
 અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત ॥ ૩ ॥

દાળ પહેલી

(કપૂર હોયે અતિ બજોનો રે—એ દેશી)

પહેલે લવે એક ગામનો રે, રાય નામે નયસાર;
 કાષ વેવા અટવી ગયો રે, લોજન વેળા થાય રે ॥ પ્રાણી ॥

ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે ॥ પ્રાણી
ધરિયો ॥ ૧ ॥ એ આંકળી ॥ મન ચિંતે મહિમાનીલો રે,
આવે તપસી કોય; હાન દેહ લોજન કરું રે, તો વંછિત ઇણ
હોય રે ॥ પ્રાણી૦ ॥ ૨ ॥ મારગ હેખી સુનિવરા રે, વંદે દેહ
ઉપયોગ; પૂછે કેમ લટકો ઈંડાં રે, સુનિ કહે સાથ વિનોગ રે
॥ પ્રાણી૦ ॥ ૩ ॥ હરખલરે તેડી ગયો રે, પડિલાણ્યા સુનિરાજ;
લોજન કરી કહે ચાલીએ રે, સાથ લેળા કરું આજ રે
॥ પ્રાણી૦ ॥ ૪ ॥ પગવઠીએ લેળા કર્યા રે, કહે સુનિ દ્રોય
એ માર્ગ; સંસારે ભૂલા ભરે રે, ભાવ મારગ અપવર્ગ રે
॥ પ્રાણી૦ ॥ ૫ ॥ દેવગુરુ ઓળખાવિયા રે, દીઘે વિધિ નવકાર;
પશ્ચિમ મહાવિદેહમાં રે, પાંચા સમકિત સાર રે ॥ પ્રાણી૦
॥ ૬ ॥ શુલ ધ્યાને મરી સુર હુआ રે, પહેલા સ્વર્ગ મજાર;
પહ્યોપમ આયુ ચીઠી રે, ભરતધરે અવતાર રે ॥ પ્રાણી૦
॥ ૭ ॥ નામે મરીયી જોવને રે, સંયમ લીધે પ્રલુ પાસ; હુંકર
ચરણ લહી થયો રે, ત્રિદંડિક શુલ વાસ રે ॥ પ્રાણી૦ ॥ ૮ ॥

ઢાળ ભીજ

(વિવાહલાની દેશી)

નવો વેષ રચે તેણું વેળા, વિચરે આદીશર લેળા; જળ
થાડે સ્નાન વિશેષે, પગ પાવડી ભગવે વેષે ॥ ૧ ॥ ધરે
ત્રિદંડ લાકડી મેઠાટી, શિર સુંડણું ને ધરે ચોટી; વળી છત
વિલેપન અંગે, થૂળથી વ્રત ધરતો રંગે ॥ ૨ ॥ સોનાની
જનોધ રાખે, સહુને સુનિ મારગ લાખે; સમોસરણું પૂછે
નરેશ, કોધ આગે હોશે જિનેશ ॥ ૩ ॥ જિન જંપે ભરતને
તામ, તુજ પુત્ર મરીયી નામ; વીર નામે થશે જિન છેલો,

આ લરતે વાસુદેવ પહેલો ॥ ૪ ॥ ચક્રવર્તી વિદેહ થાશે,
 સુણ્ણી આંયા લરત ઉદ્વાસે; મરીચીને પ્રદક્ષિણું દેતા, નમી
 વંદીને એમ કહેતા ॥ ૫ ॥ તમે પુન્યાધીવંત ગવાશો, હરિ ચક્રી
 અરમ જિન થાશો; નવિ વંદું ત્રિહંડિક વેષ, નમું લક્ષ્ણિએ
 વીર જિનેશ ॥ ૬ ॥ એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી
 મન હર્ષ ન માવે; મારે ત્રણ પદવીની છાપ, દાદા જિન
 ચક્રી બાપ ॥ ૭ ॥ અમે વાસુદેવ ધૂર થઈશું, કુળ ઉત્તમ
 રહારું કહીશું; નાચે કુળમદશું લરાણ્ણો, નીચ ગોત્ર તિહાં
 ખંધાણ્ણો ॥ ૮ ॥ એક દિન તનુ દોગે બ્યાપે, ડોઢ સાધુ પાણું
 ન આપે; ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક
 ॥ ૯ ॥ દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીધો પ્રભુ પાસે;
 રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉદ્વાસે ॥ ૧૦ ॥
 તુમ દરશને ઘરમનો ઠેમ, સુણી ચિંતે મરીચી એમ; મુજ
 ચોણ્ય મજૂયો એ ચેલો, મૂળ કડવે કડવે વેલો ॥ ૧૧ ॥
 મરીચી કહે ધર્મ ઉલયમાં, લીધે દીક્ષા જોવન વયમાં; એળો
 વચને વધ્યો સંસાર, એ ત્રીજો કદ્યો અવતાર ॥ ૧૨ ॥ લાખ
 ચોરાશી પૂરવ આય, પાળી પંચમે સર્ગ સધાય; દશ સાગર
 જીવિત ત્યાંહી, શુલ્વવીર સદા સુખમાંહી ॥ ૧૩ ॥

ઢાળ ત્રીજ

(ચોપાધની દેશી)

પાંચમે લવ ડોદ્વાગસજ્જિવેશ, કૌશિક નામે ખાલ્સાણ વેષ;
 એંશી લાખ પૂરવ અનુસરી, ત્રિહંડીયાને વેષે મરી ॥ ૧ ॥
 ઢાળ બહુ લમીયો સંસાર, શુદ્ધાપુરી છઢો અવતાર; બહેંતેર
 લાખ પૂરવને આય, વિષ ત્રિહંડી વેષ ખરાય ॥ ૨ ॥ સૈધર્મે

મધ્ય સ્થિતિએ થયો, આઠમે ચૈત્ય સજીવેશો ગયો; અમિદ્યાત
દ્વિજ ત્રિદંડીયો, પૂર્વ આયુ લાખ સાઠે મૂળ્યો ॥ ૩ ॥ મધ્ય
સ્થિતિએ સુર સર્ગ ધશાન, દશમે મંહિરપુર દ્વિજ ઠાણુ; લાખ
છુપન પૂર્વાયુ પૂરી, અનિબૂતિ ત્રિદંડિક મરી ॥ ૪ ॥ ત્રીજે
સર્ગે મધ્યાયુ ધરી, બારમે લવ કૃતાંધીપુરી; પૂરવ લાખ
ચુરમાણીશ આય, લારદ્વાજ ત્રિદંડિક થાય ॥ ૫ ॥ તેરમે
ચોથે સર્ગે રમી, કાળ ધણો સંસારે લમી; ચઉદમે લવ
રાજગૃહી જાય, ચોત્રીશ લાખ પૂરવને આય ॥ ૬ ॥ થાવર
વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સર્ગે મરીને ગયો; સોળમે લવ
કુડ વરસ સમાય, રાજકુમર વિશ્વભૂતિ થાય ॥ ૭ ॥ સંભૂતિ
મુનિ પાસે અણુગાર, હુક્કર તપે કરી વરસ હળર; માસ-
અમણુ પારણુ ધરી દ્યા, મથુરામાં ગોચરીએ ગયા ॥ ૮ ॥
ગાયે હણ્યા મુનિ પદિયા ધસ્યા, વિશાળનંદી પિતરિયા હસ્યા;
ગોશૃંગે મુનિ ગર્વે કરી, ગયણુ ઉછાળી ધરતિ ધરી ॥ ૯ ॥
તપણણથી હેણે ણળધણુ, કરી નિયાણુ મુનિ અણુસણુ;
સત્તરમે મહાશુકે સુરા, શ્રી શુલવીર સત્તર સાગરા ॥ ૧૦ ॥

ઢાળ ચોથી

(નદી ધમુનાને તીર જડે દોય પંખીયાં—એ દેશી)

અઢારમે લવે સાત સુપન સુચિત સતી, પોતનપુરીએ
પ્રભાપતિ રાણું મૃગાવતી; તસ સુત નામે ત્રિપૃષ્ઠ વાસુદેવ
નીપન્યા, પાપ ધાણું કરી સાતમી નરકે ઉપન્યા ॥ ૧ ॥
વીશમે લવ થઈ સિંહ ચોથી નરકે ગયા, તીહાંથી ચવી
સંસારે લવ બહુળા થયા; ખાવીશમે નર લવ લહી પુણ્ય
દશા વર્યા, ત્રેવીશમે રાજધાની મૂકાએ સંચર્યા ॥ ૨ ॥

રાય ધનંજય ધારણીએ જનમિયા, લાખ ચોરાશી પૂરવ
આયુ જીવિયા; પ્રિયમિત્ર નામે અકૃપતી દીક્ષા લહી, કોડી
વરસ ચારિત્ર દશા પાળી સહી ॥ ૩ ॥ મહાશુદ્ધે થઈ હેવ
ઇણે ભરતે ચવી, છત્રિકા નગરીએ જિતશત્રુ રાજવી; લદ્ધામાય
લાખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્રે દીક્ષા
આચરી ॥ ૪ ॥ અગિયાર લાખ ને એંશી હબ્દર છશેં વળી,
ઉપર પીસ્તાળીશ અધિક પણ દિન ઢળી; વીશ સ્થાનક માસ-
ખુમણે બાવજળું સાધતા, તીર્થેં કરનામકર્મ તિહાં નિકાચતા
॥ ૫ ॥ લાખ વરસ દીક્ષાપર્યાય તે પાળતા, છંબીશમે લવ
પ્રાણુતકદે હેવતા; સાગર વીશતું જીવિત સુખલર લોગવે,
શ્રી શુલવીર જિનેશ્વર લવ સુણુંલે હવે ॥ ૬ ॥

૬૦ પાંચમી

(ગજરામારણ ચાલ્યા ચાકરી રે—એ દેશી)

નથર માહણુકુંડમાં વસે રે, મહાત્રાર્દ્ધ ઋષલદત નામ;
હેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રલુ વિશરામ રે; પેટ
લીધો પ્રલુ વિશરામ ॥ ૧ ॥ જ્યાસી દિવસને અંતરે રે, સુર
હરિણુગમેષી આય; સિદ્ધારથ રાજ ધરે રે, ત્રિશલા કૂઝે
છટકાય રે ॥ ત્રિ૦ ॥ ૨ ॥ નવ માસાંતરે જનમીયા રે, હેવ હેવીએ
ઓછિવ કીધ; પરણી યશોદા જેવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ
રે ॥ ના૦ ॥ ૩ ॥ સંસાર લીલા લોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા
લીધ; બાર વરસે હુઅા ડેવળી રે, શિવવહુનું તિલક શિર દીધ
રે ॥ શિ૦ ॥ ૪ ॥ સંધ ચતુર્વિધ થાપીએ રે, હેવાનંદા ઋષલ-
દત ખ્યાર; સંચમ દેધ શિવ મોકલ્યાં રે, લગવતીસૂરે
અધિકાર રે ॥ ભ૦ ॥ ૫ ॥ ચોત્રીશ અતિશય શોભતા રે,

ચૈદ સહસ અણગાર; છત્રીશ સહસ તે સાધવી રે, ખીજે
ઢેવ ઢેવી પરિવાર રે ॥ ખીજો ॥ ૬ ॥ ત્રીશ વરસ પ્રભુ
કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; ખણાંતેર વરસનું આઉખું
રે, દીવાળીએ શિવપદ લીધ રે ॥ દીવા ॥ ૭ ॥ અણરૂપદ્ય
અવગાહને રે, કીયો સાહિ અનંત નિવાસ; મોહરાયમહૃ મૂળશું
રે, તન મન સુખનો હોય નાશ રે ॥ તન મનો ॥ ૮ ॥
તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તો અમને
સુખીયા કરે રે, અમે ધરીએ તુમારી આશ રે ॥ અમે ॥
૬ ॥ અખ્યય અજનો નાથનો રે, મેં દીકો ગુરુ ઉપદેશ;
લાલચ લાળી સાહેખા રે, નવિ લજીએ કુમતિનો લેશ રે
॥ નવિ ॥ ૧૦ ॥ મહોટનો જે આશરો રે, તેથી પામીએ
લીલ વિલાસ; દ્રોય લાવ શરૂ હણી રે, શુભવીર સદા સુખ-
વાસ રે ॥ શુલ્ભ ॥ ૧૧ ॥

કલશ

એણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો; મેં
શુષ્ણ્યો લાયક વિશ્વનાયક, વર્ઝ્માન જિનેશ્વરો; સંવેગ રંગ
તરંગ જીવે, જસવિજય સમતા ધરો; શુલ્વવિજય પાડિત
ચરણ સેવક, વીરનિજ્યો જયકરો ॥ ૧૨ ॥

॥ ઈતિ શ્રી મહાવીરસ્વામીનું ॥
પંચદાળિયું સમાપ્ત ॥

શ્રી મહાવીર પરમાત્માએ હજુસ્થપણામાં ને કેવળીપણામાં
એકંદર ૪૨ વર્ષના શ્રમણુપર્યાયમાં કરેલા ચ્યામાસાનો
અનુક્રમ નીચે પ્રમાણે—

૧ અસ્થિકાર્ય	૨૨ રાજગૃહી
૨ રાજગૃહી-નાલંદાપાડે	૨૩ વાણિજ્યામ.
૩ ચંપા	૨૪ રાજગૃહી
૪ પૃષ્ઠચંપા	૨૫ ભિથિલા
૫ ભદ્રિકા	૨૬ ભિથિલા
૬ ભદ્રિકા	૨૭ ભિથિલા
૭ આલંભિકા	૨૮ વાણિજ્યામ
૮ રાજગૃહી	૨૯ રાજગૃહી
૯ વજ્જ્બૂમિ (અનાર્ય)	૩૦ વાણિજ્યામ
૧૦ આવર્સિત	૩૧ વૈશાળી
૧૧ વિશાળા	૩૨ વૈશાળી
૧૨ ચંપા	૩૩ રાજગૃહી
૧૩ રાજગૃહી	૩૪ રાજગૃહી-નાલંદાપાડે
૧૪ વિશાળા	૩૫ વિશાળા
૧૫ વાણિજ્યામ	૩૬ ભિથિલા
૧૬ રાજગૃહી	૩૭ રાજગૃહી
૧૭ વાણિજ્યામ	૩૮ રાજગૃહી-નાલંદાપાડે
૧૮ રાજગૃહી	૩૯ ભિથિલા
૧૯ રાજગૃહી	૪૦ ભિથિલા
૨૦ વૈશાળી	૪૧ રાજગૃહી
૨૧ વાણિજ્યામ	૪૨ પાવાપુરી

એકંદર ૪૨ નીચે પ્રમાણે—

૧ અસ્થિકાર્ય	૨ ભદ્રિકા
૩ ચંપા-પૃષ્ઠચંપા	૩ આલંભિક
૧૨ વિશાળા-વાણિજ્યામ	૪ આવર્સિત
૧૪ રાજગૃહી-નાલંદાપાડા	૫ વજ્જ્બૂમિ (અનાર્ય)
૬ ભિથિલા	૬ અપાપાનગરી (પાવાપુરી)

૫. શ્રી મહાવીર જીન સ્તવન.



જગપતિ તારક શ્રી જિનહેવ,
 દાસનો દાસ છું તાહરો;
 જગપતિ તારક તું કિરતાર,
 મનમોહન પ્રભુ માહરો. ૧

જગપતિ તાહરે તો લક્ષ્ય અનેક,
 મારે તો એક જ તું ધણી;
 જગપતિ વીરમાં તું મહાવીર,
 ભૂરતિ તારી સોહામણી. ૨

જગપતિ ત્રિશલા રાણીનો તન,
 ગંધાર ખંડર ગાળુઓ;

જગપતિ સિદ્ધારથ કુળ શાણુગાર,
 રાજરાજેશ્વર રાળુયો. ૩

જગપતિ ભગતોની લાગે છે લીડ,
 લીડ પડે પ્રભુ પારીયે;

જગપતિ તુંહી પ્રભુ અગમ અપાર,
 સમજ્યો ન જાય મુજ સારીયે. ૪

જગપતિ ઉદ્ય નમે કર જોડ,
 સત્તર નેવ્યાસી સમે કિયો;

જગપતિ ખંલાત જંખૂસર સંધ,
 લગવંત લાવશું બેટિયો. ૫



